



Ite of dug. CENTRAL RESERVE POLICE FORCE 30 May 2008 Wer Baldan Verst Baldan 2 Br. 27.1-1990 TD 20.1000 State Sta



Director General and all Ranks of Border Security Force remem-ber its gallant Jawans Head Constable Amar Singh, Lance Naik A Sasi and Constable Dipter KD Saw, Arun Kumar Singh, Mohan Chavan and Satvir Yadav on their Balklan Diwas. On this day they sustained fatal injuries in an IED blast rifegered by mili-tants, followed by firing in area of Jagraon, Ludhiana, Punjab and made ubires eareflice in the line of dutr.

they assume in that inputs in an into thas inggeted of initial sites, followed by fining in area of largeon, Ladhana, Penjab and made ultramateriative in the line of duy. HEAC CONSTRUCT FORCE HEAC CONSTRUCT FORCE CHANGER 300,500 20,70169 – 300,5200 Director General and all Ranks of Border Security Force remember is gallara Hawan Head Constable English Chandre and Constable Pradeep Singh on their Balidan Dives. On this day, they sussing Privense huller indures while flighting with millions in a new of CI Post Thuru, Jammu and made ultimate sarrifice in the line of duy.

### SALUTE THE SOLDIER

# CONTRACT CONTRAC

Patharghate, W

01sustained faral bullet injuries during a counter ter-ror operation in Srinagar area, J&K and later suc-cumbed to his injuries at 92 Base hospital, Srinagar.

# PAUSHAK LIMITED CIN: L51909GJ1972PLC044638 Regd. Office: Alembic Road, Vadodara – 390 003 Website: www.paushak.com | Email: investor@paushak.com Tel: +91 265 6637000

### NOTICE OF LOSS OF SHARE CERTIFICATE(S)

Notice is hereby given that the following Equity Shares Certificate(s) of the Company have bee transferred to Investor Education and Protection Fund (EPF) Authority and the registered deguits haveholder(s) have provide them as been with registered and guity from EPF Authority, the registered equity shareholder(s) have applied to the Company for the issue of applicate Equity Shareholder(s) have applied to the Company for the issue of applicate Equity Shareholder(s).

Shareholder's Name and/or	Folio	Certificate	Distinctive	No. of
Claimant's (Legal Heirs) Name	No. (s)	No. (s)	Nos.	Shares
Medam Rangalah Gupta (Deceased) Legal heir Medam Muralidhar	M00165	1414	800625-800724	100

The Public is hereby warned against purchasing or dealing with these securities in any way. Any person(s) having any claim in respect of the aforesaid Equity Shares Certificate(s), should immediately send fuld details with documentary evidence to the Company's RTA-MUFG intime India Immediately send full details with documentary widence to the Company STR-A-UNE function Private Limited Formerly known as Link Intime India Private Limited) at its officia at "Getatuan Banki Nagar Sociesy Beinind ABS Tower OUP parka Rada Varidataria -30015 for to the Company its Registered Office mentioned above, so as to reach us within 15 days from the date of public of this Robert and the mentioned above, so as to reach us within 15 days torm the date of public of this Robert and the mentioned above, so as to reach us within 15 days from the date of public of this Robert and the mentioned above, so as to reach us within 15 days torm the date of public of this Robert and the mentioned above.

the that no claims will be entertained by the Company or the RTA with respect to origin are Certificate(s) subsequent to the issue of duplicate(s) thereof. Please note that no claims will be Equity Share Certificate(s) subset For Paushak Limite

Date : 29" May, 2025 Place : Vadodara

Sagar Gandh

Company Secretary

The Multistate co-operative bank, having branches in Rajisthan & Gujarat, request for proposal for Comprehensive Annual Maintenance (AMC) for All Types & Various Nakes and Model of Alr Conditioners at multiple location. Interested comparies & Rirms send proposal in seven days to given below E-mail ID administradulh. For more information contact on mobile no.9414151217 & address.

ATTVE BANK LTD.

### WESTERN RAILWAY - AHMEDABAD DIVISION ADVERTISING, MISC STATIC SERVICE & ATM CONTRACTS Auction catalogue No. - NFR-ADI-5-25 Auction Start (All Lots) - 11-06-25 12:00:00

Seq No	Lot No./ Category	Description	Trips/ Days	Lot End Date Time
AA/1	137-24-2 (Advertising - Train Interior)	Bulk Advertisement right for the display of advertisement with Railway safety/cleanliness messages through changeable metallic frames inside the coaches of train No. 09360 [SBIB-PTN DMU], 09370 [PTN-SBIB DMU], 09431 [SBIB-MSH	1096	11-06-25 12:30:00
DMU], 09544 09440 PASSI	09438 [ABR-MSH [ASARVA-DUNGAI 09443/09444.09 ENGER].09213/093	MUJ, 09433 (SBIB-PTN DMUJ, 09434 (PTN-SBIB DN I DMUJ, 09401/09402 (ASARVA-HIMMATNAGAR RPUR DMU SPL), 09441 / 09442 (WKR-MVI-WKR D 561/09562, 09563/09564, 09585/095861, 093590/0 314 (BTD-DHG-BTD SPECIAL), of Ahmedabad Divis al Advertisement Area = 133.37 Sq. Mir	DÉMU MU Rake	SPL], 0954 e links-0943 ID-DHG-BT
AA/2	ADVT-Int-250054- 2-25-1 (Advertising - Train Interior)	Contract for placement of advertisement strips hanging between each overhead hand grab in each coach of Train no. 94801/94802 ADI-BHUJ-ADI Namo Bharat Rapid Rail for 03 years. Please refer to the attached asset details document for to the attached asset details document for	1096	11-06-25 12:40:00
ompl	ete details and speci	fications.		
AB/1	ADVT-ADI-PNU- OH-144-24-1 (Advertising - Out of Home)	Bulk Advertisement Contract for Display of Hoardings at LC No.1 SPL (near height guage) near Laxmipura, Palanpur of Ahmedabad Division covering a total area of 800 sq. ft. for a period of five years.	1826	11-06-25 12:50:00
AB/2	ADVT-ADI-ADI- OH-205-25-1 (Advertising - Out of Home)	Offers are invited through e-auction for the contract to display advertisements through wall paintings on 30 overhead water tanks located across the Ahmedabad Division. The approximate total advertising area available is 2,901 square meters.	1826	11-06-25 13:00:00
		ad water tanks, including their precise locations and et details document.	contact	details for si
AB/3	ADVT-ADI-MAN-	Contract for Non-Digital Advertising Board (Lit /	1096	11-06-25
	OH-218-25-1 (Advertising - Out of Home)	Non-Lil) with total display area of 1600 sq ft. (640 x 2.5) at West side wall of Maninagar station for three (03) years. Location: Outside of wall at PF No. 1 facing towards road at Maninagar Railway Station.		13:10:00
AC/1	ADVT-ADI-GNC- OSD-208-25-1 (Advertising - On Station Premise (Digital))	Contract for Supply, Installation, Operating & Maintenance of Closed Circuit Digital Display System Integrated Along with Public Announcement System Comprising of LED TVs and Speakers at Gandhinagar Capital (GNC)	1826	11-06-25 13:20:00
Railwa	ay Station of Ahmeda	ibad Division for five years.		
AD/1	ADVT-ADI-MAN- OSN-181-24-1 (Advertising - On Station Premise (Non-Digital))	Contract for 200 glow advertising signage boards at Platform No. 1,2/3 and FOBs of Maninagar Railway station covering a total area of 800 Sq ft for a period of three years.	1096	11-06-25 13:30:00
AD/2	ADVT-ADI-ADI- OSN-202-24-1 (Advertising - On Station Premise (Non-Digital))	Contract for advertisement through Glow sign Board/LED Flange at Platform no 2, 2A, 3, 4 & 5 of Ahmedabad Railway station. The total no of Glow sign Board/LED Flange to be installed is 120 Nos (2 ft x 2 ft circular or square shape) both sided i.e.	1096	11-06-25 13:40:00
-		a. For details kindly see the feasibility report attached		
BA/1	ATM-ADI-ADI- Gen-36-25-1 (ATM - General)	Contract for installation and management of Automated Teller Machines (ATM) (maximum 02) at Circulating Area at Ahmedabad (ADI) station of Ahmedabad Division for a period of five years.	1826	11-06-25 13:50:00
CA/1	MSS-ADI-ASV- BCrush-35-25-1 (Misc-Static- Services-Bottle crushing machine)	E-auction for Supply, Installation, Operating & Maintenance of 50 PBCM at Asarva (ASV), Mahesana (MSH), Palanpur (PNU), Viramgam (VG) & Bhuj (BHUJ) (10 PBCM at each station) Railway Stations of Ahmedabad division Western	1826	11-06-25 14:00:00
	ay for a period of 05 y	ears at the cost of the licensee.		
CA/2		E-auction for Supply, Installation, Operating & Maintenance of 04 PBCM at Maninagar (MAN) & Vatva(VTA) (02 PBCM at each station) Railway Stations of Ahmedabad division Western Railway for a period of 05 years at the cost of the licensee.	1826	11-06-25 14:10:00
CB/1	MSS-ADI-RDHP- BOXNWC-57- 25-1 (Misc-Static- Services- BOXN Wagon Cleaning)	The licensee should provide service of cleaning and removal of residual coal and other materials fallen ontracks and discarded in the BOXN/BOX/NHL wagons. Location covered for working under the scope of work: (1.) Goods sheds	1096	11-06-25 14:20:00
of Ra	adhanpur, (2.) Go	n, contact Division office DCMI-NFR AD	ttached	document

labad - 382345

GOVERNMENT OF INDIA MINISTRY OF EDUCATION DEPARTMENT OF HIGHER EDUCATION

### Appointment of Vice-Chancellor of Dr. Harisingh Gour Vishwavidyalaya

Applications are invited for the post of Vice-Chancellor of Dr. Harisingh Gour Vishwavidyalaya. The Vice-Chancellor, being the academic as well as administrative head, is expected to be:

- A person possessing the highest level of competence, integrity, morals and institutional commitment.
- A distinguished academician, with a minimum of 10 years' experience as Professor in a University or 10 years' experience in reputed research and/or academic administrative organization with proof of having demonstrated academic leadership
- · Preferably not more than 65 years of age as on the closing date of receipt of applications of this advertisement.

### Salary and Service Conditions

- · The post carries a pay of Rs. 2,10,000/- (Fixed) per month with Special Allowance of Rs. 11,250/- and other usual allowance
- · The terms and conditions of the services will be those as set forth in the Act. Statutes and Ordinances of the University.

### Procedure for appointment


- · Appointment will be made from a panel of names recommended by a committee nstituted under the provisions of Act of the University.
- · The advertisement is available on the websites http://www.education.gov.in and https://dhsgsu.edu.in
- Candidates are required to "<u>APPLY ONLINE ONLY</u>" on the Ministry of Education SAMARTH portal as per the link given below: https://vcrec.samarth.ac.in/index.php/
- The above link will be active from 30.05.2025, 10:00 Hours to 28.06.2025 17:00 Hours cbc/21201/11/0006/2526

# JINDAL JINDAL WORLDWIDE LIMITED

CIN: L17110G.J1980PLC008042 CIN: Regd.& Corp. Off: 'Jindal House', Opp. Dmart, LO.C. Petrol Pump Lane, Shivranjan Shyamal 132 F. Ring Road, Stallie, Ahmedaba-380015, Gujarat Ph: 079-71001500 · Email d: csjinatd@jindaltextles.com · Website : www.jindaltextles.com Ph: StaTeNENT OF STANDLONE & CONSOLIDATE DAUTDE Ph: NANCIAL RESULTS (As per Regulation 32 of SBBI (LODR) Regulation, 2015, Schedule III of Companies Act, 2013 & IND-AS) \* For the Quarter & Financial year Inded 31" March, 2025 {Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015)

_	(Rs. in Lakhs except EPS)									
Quarter Ended Year Ended 3 months Preeceeding 3 Corc 3 months Current Financial Provious F										
Sr. No.	Particulars	3 months ended of C.Y.	months ended of C.Y.	Corr. 3 months ended in P.Y.	Year Ended	Year Ended				
NO.		31" March, 2025 Refer Note No 8	31" Dec, 2024 (Un-Audited)	31"March, 2024 Refer Note No.8	31" March, 2025 (Audited)	31" March, 2024 (Audited)				
Ľ	-	STANBA	NUMBALON	E	(					
1.	Total income from operations (net) Net Profit / (Loss) for the period (before Tax,	55582.84	58588.49	59455.06	222466.81	185935.50				
3,	Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax	2,847.02	2,432.22	3,301.41 3,301.41	9,949.68 9,949.68	9,528.99 9,528.99				
4.	(after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after	2067.34	1820.02	2334.94	7376.66	7002.94				
5,	exceptional and / or Extraordinary items) Total Comprehensive income for the period	200101	1020102	200104	10/0.00	1002104				
	after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1952.05	1820.02	2080.61	7261.37	6748.61				
6. 7.	Equity Share Capital Receives (confident Revoluction Research) on	10026.02	2005.20	2005.20	10026.02	2005.20				
<i>'</i> .	Reserves (excluding Revoluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31 <sup>st</sup> March 2024 and Current Financial Year ended 31 <sup>st</sup> March 2025	NA	NA	NA	67882.47	69042.96				
8.	Earnings Per Share (of Rs. 1/ each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.21	0.18	0.23	0.74	0.70				
	2. Diluted	0.21	0.18	0.23	0.74	0.70				
1.	Total income from operations (net)	60553.34	62430.11	57379.15	228807.14	181408.90				
2.	Net Profit / (Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items)	3050.40	2508.27	3894.47	10363.65	10250.52				
з.	Tax Exceptional and/or Extraordinary items) Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	3050.22	2508.20	3893.46	10363.64	10249.58				
4.	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary items)	2201.99	1844.54	2817.30	7586.39	7564.78				
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2122.98	1844.54	2562.97	7507.38	7310.45				
	Equity Share Capital	10026.02	2005.20	2005,20	10026.02	2005.20				
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31 <sup>st</sup> March 2024 and Current Financial Year ended 31 <sup>st</sup> March 2025	NA	NA	NA	68988.09	69902.05				
8.	Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.22	0.18	0.28	0.76	0.75				
	2. Diluted	0.22	0.18	0.28	0.76	0.75				
1	uparter and financial year ended 31 <sup>th</sup> March, 2025 have been reviewed and recommended by the Audit Committee in its meeting held on 28 <sup>th</sup> May, 2025, and approved by the Board of Directors in their meeting held on 28 <sup>th</sup> May, 2025. 2 A statement of Standatone & Consolidated Financial Results & Statement of Assets & Liabilities are also available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India									
4 5 6 7	equity shares to the eligible shareholders on book closure date (cs., 3" March, 2025) in the ratio of 4.1 resulting in an increase in issued capital by capitaling reserves of the Parent Company, The Earning Per Share figures for the quarter ended 3" Deefender 2024 and the unater and year ended 3" March, 2024 have been restated to give effect to the albornent of 4 The above financial results have been prepared in accordance with the Companies (Inclian Accounting Standards; Rules, 2015 (Incl AS) prescribed under section 133 of the Companies (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 (as annended). (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 (as annended). The consolidated by disclosed in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 (as annended). The consolidated by disclosed in terms of Regulation 33 of the Companies (as the company). The Statement of Consolidated Segment's therefore segment haced level, refer to the Statement of Consolidated Segment Revenue, Results & Segment Assets And Liabilities. The figures for the corresponding previous periods have been restated/regrouped wherever "Fund Resing by Issuance of beth Security by Large Entities". The Company for the discloses the discloser beth securities by Large Entites". The Company for "Fund Resing by Issuance of the Dis Sterms to Ly Large 2016 (2016) (14) dated 26 November, 2016 "Fund Resing by Issuance of the Financial VI and 2016 (2017) (20									
Da	FursiSaff10 tifts Comparison Software Comparison Way, 2014, a Statement Of Cash Year ended 31" March, 2025 is Simulatione And Com for the effect of the statement of Standalone & between the audited figures in res 31" March, 2024 and the published on 31" December 2024 respectiv Auditor's thereon.	Flows (both enclosed h rended 31" Consolidat ect of the fu year to date ely, which v		e & Consolic Annexure- ent of Assets 5 and 31" M al Results an even ended c figures up to t to limited r For and For JINDA Vice Chairam	(MR. AMIT	DE LIMITED SD/-				

Join FREE Whatsapp Channel https://whatsapp.com/channel/0029Van2VRb6RGJOKH60Bd0F Ahmedabad



							(Rs.In Lak
			Standalone			Consolidated	
Sr.No.	Particulars	Quarter ended 31.12.2024 (Unaudited)	Nine months ended 31.12.2024 (Unaudited)	Quarter ended 31.12.2023 (Unaudited)	Quarter ended 31.12.2024 (Unaudited)	Nine months ended 31.12.2024 (Unaudited)	Quarter ended 31.12.2023 (Unaudited
1	Total income from operation	2366.71	7363.38	2184.83	2366.71	7363.38	2184.83
2	Net Profit (Loss) for the period before tax and exceptional items	37.70	217.29	54.42	37.42	216.90	G4.42
3	Net Profit (Loss) for the period before tax and after exceptional items	37.70	217.29	54.42	37.42	216.96	54.42
4	Net Profit (Loss) for the period after tax (after extra. exceptional items)	26.03	156.58	40.67	25.75	156.26	40.67
5	Total Comprehensive Income for the period (Comprising profit)(Loss) for the period after tax) and other Comprehensive income (after tax)]	26.03	156.58	40.67	25.75	156.26	40.67
6	Equity share capital	1012.50	1012.50	1012.50	1012.50	1012.50	1012.50
7	Other Equity (excluding Revaluation Reserve)		4839.97			4839.97	
8	Earnings per share (before and after extra ordinary items) (of Rs. 1/- each)						
	Basic	0.03	0.15	0.04	0.03	0.15	0.04
	Diluted	0.03	0.15	0.04	0.03	0.15	0.04
Notes: 1 2 Place: /	The results were reviewed by the Audit Commit The above is an extract of the detailed format of A Exchange Board of India (Listing Obligations an available on the websites of the Stock Exchange Atmediabad	udited Financia nd Disclosure Re	Results filled wi equirement) Reg	th the Stock Exc ulations, 2015. 1	hanges under R 'he full format of te www.aakashe	egulation 33 of the Audited Fin xploration.com. ash Exploration	ne Securitie ancial Res

WWW.INDIANEXPRESS.COM

Torrent- рняктя IN: L24230GJ1972PLC002126 Website: www.torrentpharma.com mail: investorservices@torrentpharma.	Registered O Torrent Hous Ahmedabad Ph. : + 91 79	e, Off Ashram Road 380 009, Gujarat, I 26599000	ļ,
Extract of C for the Quarter and I	onsolidated Fina Nine months end	ed December 31,	2024 cept per share data
Particulars		Nine Months Ended December 31, 2024	Quarter Ended
, an area and a	Unaudited	Unaudited	Unaudited
Total Income from operations	2809	8557	2732
Net Profit / (Loss) for the period before tax and exceptional items	691	2008	543
Net Profit / (Loss) for the period before tax and after exceptional items	691	2008	631
Net Profit / (Loss) for the period after tax and exceptional items	503	1413	443
Total Comprehensive Income	433	1284	442
Paid up equity share capital	169.23	169.23	169.23

	Unaudited	Unaudited	Unaudited
Total Income from operations	2809	8557	2732
Net Profit / (Loss) for the period before tax and exceptional items	691	2008	543
Net Profit / (Loss) for the period before tax and after exceptional items	691	2008	631
Net Profit / (Loss) for the period after tax and exceptional items	503	1413	443
Total Comprehensive Income	433	1284	442
Paid up equity share capital	169.23	169.23	169.23
Other equity excluding revaluation reserve'			
Earnings per share			
(Face value of ₹ 5 each) (Not annualised):			
0.1	14.00	41.20	12.10

\*Other Equity excluding Revaluation Reserve as on March 31, 2024 was ₹ 6687 crores Notes : 1 Summary details of standalone audited financial results of Torrent Pharmaceuticals Limited

Diluted

Place : Ahmedabad, Gujarat Date : January 24, 2025

14.88

14.88

			[₹ in crores]
Particulars		Nine Months Ended December 31, 2024	
Total Income from operations	2377	7249	2123
Profit before tax	651	1988	430
Profit after tax	485	1414	297
Total comprehensive income	478	1378	284

2 The Board of Directors in their meeting held on January 24, 2025, recommended an interim equity dividend of ₹ 26 per equity share.

CHUID WITCHING OF Corporations and the second se bsite (URL: www.torrentpharn com/inv sults/). The same car sed by scanning the QR code provided below



41.76

13.10

\_\_\_\_

5

CORRIGENDUM TO THE NOTICE OF POSTAL BALLOT DATED 7<sup>™</sup> JANUARY, 2025

issue and allotment of Bonus shares." This Contgendum to the Postal Ballot Notice shall form an integral part of the Postal Ballot Notice, which has already been circulated to the Shareholders of the Company, and on and from the date hereof, the Postal Ballot Notice shall always be read in conjunction with this Configendum. Accordingly, all concerned shareholders, Stock Exchanges, Depositortes, Registrar and Share Transfer Ageni, agencies appointed for evoting, other Authorities, All other contents of the Postal Ballot Notice, save and except as modified or supplemented by this Configendum, shall remain unchanged, This Corrigendum dated 24<sup>21</sup> January, 2025, shall also be available on the Company's website www.jinditextiles.com, websites of the Stock Exchanges it, BSE Limited and National Stock Exchange of India Limited at www.seindia.com and <u>www.nseindia.com</u>, respectively and the e-Voting Service Provider (ESP).

www.bseindia.com and <u>www.nseindia.com</u>, responsively and the set of (SP). This Contgendum is being sent only through electronic mode to those Shareholders whose email address is registered with the Company (depository participants) as on the cut-off date i.e. Friday, 10<sup>2</sup> January, 2025, We would like to inform all those, who have already casted their viotes in the ongoing possibal ballot i.e. after the start of e-Voling towards the postab ballot but prior to receiving this Contgendum to postab ballot notice, that their e-vote shall have no impact and o relation with the information provided in the Corrigendum. The omission stated in this Contgendum is no way resulting in any change in the purpose of Special Businesses and the proposed resolutions thereof. Twie Contribution shared.

proposed resolutions intereor. This Contgendum should be read in continuation of and in conjunction with the Postal Ballot notize dated 7" January, 2025. The above is for your information and records, For and on behalf of the Board of Directors For JMDAL WORLDWIDE LIMITED

AMIT AGRAWA

Vice-Chairman & Managing Director DIN: 00169061

Date : 24<sup>th</sup> January, 2025 Place : Ahmedabad

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

inclusive. Beyond the Boardroom: Managing for Impact Traditional MBA programs often train students for hierarchical corporate structures. DMI's PGDM, in contrest, researces and usate to

ADVERTORIAL

learning through their work and the guidance of field

and the guidance of field mentors. This 70/30 split between classroom and in-situ learning ensures that DMI graduates are well-versed in theory and equipped with the practical skills and insights needed to succeed as Impact Managers.

### Reclaiming Bihar's glory as a destination for education: DMI Patna Redefines Management Education for a Better World, Offers Extensive Scholarships education, healthcare and finance to make growth inclusive.

years, a narrative has persisted: Bihar, for many aspiring students, is a place to leave, not a destination for quality higher education. The allure of government jobs, however modest, or the perceived prestige of institutions outside the state. perceived presting of institutions outside the state-even those offering questionable values of the state of the struggling to attract top talent. But in the heart's institution state of pana, a quiet revolution is brewing at the Development Management Institute (DMI), an autonomous institution established by the Government of Bihar, DMI isn't just another management school; it's pioneering a new kind of education that goes beyond the traditional MBA and empowers a new generation of beyond the traditional MBA and empowers a new generation of leaders to tackle the world's most pressing challenges. Recognising many students' financial constraints, DMI is committed to making this transformative education accessible through a comprehensive scholar-support proorangme.

comprehensive scholar-support programme. A Vision Beyond Business as Usual DMI's vision is to be "the preferred destination for cross-functional and interdisciplinary education and vision, and profiles in development management." This vision and its mission 'to ad va a ce de vel o p n ent management knowledge and practices through collaborative research, sducation, and solutions that empower grassroots communities" clearly sets it apart from conventional management schools. It's an institution that operates, "beyond business as usual," focusing simultaness profiles."

DMI Difference: Where
Purpose Meets Profit Purpose Nexts Profit Take, for example, the field of marketing, A typical MBA program might teach consumer behaviour to manipulate purchasing decisions. It rarely, if ever, goes beyond brand level competition. DMI goes deper-la courses in the Marketing stream do not confine themselves to brand level substitution. They get students to engage in Product-level competition, enabling them to work towards effecting the

support for tuition fe men and Res Categories Management Aptitude Test Score - Percentile Categor 100% 50% etween 50 and 60 nil 25% production and mindful consumption for sustainability.

Management Aptitude Test-score based Scholarships:

For Transpek Industry Limited Alak D. Vyas pany Secretary & Compliance Officer

Ala Company Secretary & Complian

PUBLIC NOTICE

PUBLIC NOOT COP I adew Sign Advocate as per Instruction of Our Client Gujard Flotz Phrate Limited Published these Nofes Is as under - All that gives and parcel of Immovable Norseyricultural land admessuring 24, 281 sq. mtr of revenue records survey No, 2152: situated a Muoje Bamolti. Attuak Santajur District Patan and Sub-Registran Santajur was belonged is Shipal Rasul Vajbur Thereafter on dated 2006/2011 hes Odd Konveyd the said land to Nandhal Nathathat Bavaditys vide Registered Sale Deed No 913. Thereafter on dated 2017/2024 Nandhal Nathathat Bavaditys a solt & conveyd the said 2017/2024 Nandhal Nathathat Bavaditys a solt & conveyd the said 2017/2024 Nandhal Nathathat Bavaditys a solt & conveyd the said 2017/2024 Nandhal Redistered Sale Deed No. 913/2011 was Mioptace 320. The Original Redistered Sale Deed No. 913/2011 was Mioptace Used Norg and Vagot Sale Thereafter Of Harving Norg Right. Title, Claroter Jer and one Thoid the Sale Resistered Sale Deed No. 913/2011 han Contact to Cur Client Or If any has any Right. Title, Claroter 176, Salvage Building, Opp. Dihola Tover, Lai Darwaja, Ahmedabad. Mo. No. 98250 26213

Date : 24.01.2025

The career opportunities for DMI graduates are not confined to functional management roles. They are the baseline opportunities. Beyond them lie roles in, among others: Development programm-ing: Leading development initiatives that make a real difference.

Shaping governance systems: Triggering stake-holder participation and democratic practice for the greater good.

necessities and virtues of member-oriented businesses. It prepares students to build a better workl, improve quality of life, help governments deliver services more effectively, build enterprise-oriented live/fibuode estimation technologies to spread growth and prosperity-unike traditional management programs that treat a large Aligning institutional policies & practices for the triple bottom line: Working through internal systems for engendering sustainable and Social Entrepreneurship: Building enterprises that respond to needs, unlike traditional ones that address demand.

Collective Enterprise building: Facilitating institution building for the enterprises of the small and marginal unlike traditional management programs that treat a large section of society only as consumers of goods and services. DMI's PGDM promotes responsible

marginal Techno-entrepreneurship: Harnessing information technology in agriculture, \_\_\_\_

hterarchical corporate countral, prepares gnduats in navigate complex environments where diverse stakeholders -each with their agendas and DMI students kenn to manage for impact by understanding institutional structures, coordination mechanisms, conditionation accentral struc-tures, and structures, conditional concerns, social standing, political strategies. They are equipped work effectively in settings where distributional concerns, social standing, political are just as important as economic factors. succeed as Impact Managers. Making Education Accessible: DMU's Core philosophy – scholar support programme DMI is committed to ensuring that financial constraints do no prevent deserving students from pursuing this transformative education, nor are students burdend with large debts for their education. The institute offers a wide range of scholar support opportunities. Academic Performance Scholarships: Up to 100% tuition fee waiver based on term-wise performance. A Unique Course Structure: Bridging Theory and Practical

University Topper Scholarship: 50% tuition fee waiver for university toppers in any discipline. ese scholarships demonstrate • DMI's PGDM programme is structured to provide a unique

### These DMI Difference: A Vision Beyond Business as Usual

Where Purpose Meets Profit. DMI's commitment to diversity, attracting and supporting the truly motivated students regardless of their financial background. Choosing DMI: Choosing a Future of Purpose

blend of theoretical knowledge, both know-why and know-how, and their practical applications. The programme consists of eight academic terms. Five terms are dedicated to **ILES** the charming Session foundation in functional areas of management, inter-disciplinary fields and development praxis. Three terms are devoted to Choosing DMI: Choosing a Future of Purpose putture of Purpose DMI Patna is not just an institution; it's an institution; it's an investment, it's individuals to use their management education and skills to build a more equitable and sustainable world. It's a too put the observation of the sub-bub of innovation in education. Studying in the state offers extramural opportunities to soak in the ancient history of the sub-vision and mission, is shaping a new generation of leaders who will drive positive change from the grassrootsup. Rural Management was just the Three terms are devoted to Experiential Learning Segments (ELS), immersing students in real-world institutional and organisational practice: actice: Development Immersion (5 weeks): Students are e mb ed ded in rural communities, enabling observation and learning interactions.

 theractions.
 Enterprise Learning (6 weeks): Placed with collective and small enterprises, students learn the end-to-end functionalities of e n t er pr is set and corresponding business challenges.
 Management Interprise Win dive positive change i the grassroots up. Rural Management was just Beginning - Embrace the Spectrum of Developm Management at DMI Pa Thus, Beyond Rural, Bey Traditional: This DevelopmentManagement.



challenges. Management Internship (10 weeks): Coming as it does in the second year, when students have developed early ideas for their future contributions, they choose to be with entities that align the best. They work on a 'business problem' to gain

Apply now for DMI Patna's PGDM 2025-27 and become an Impact Manager who shapes "Sustainable Futures". Ahmedabad

writch from historically writch from historically that are sustainable resilient, and generative of civic virtues and public good. This includes gamering positive behaviours like interalia, circular economy, sanitation practices, vaccine adoption, and preventive healthy impact human lives beyond simply driving sales of a particular brand. Taking recourse to the fundamentals of Marketing, it encourages students to intercogate value and learn the technology of building marketing ystates what resustainability, and resilience shaped and a same technology of building marketing positive externalities is for the small and marging while creating positive externalities is fundamentally different. While a traditional management part and form the another shaped baye all and the same technology of building marketing values and the same technology of building marketing systems that are sustainability, and resilience shaped lacademic choices. This is just one example of how D M I's curric u la units as sum ptions of f hom o economicas' and for-profit in part a sociological and markets, exposing hem to a multiplicity of rationalities, necessities and virtues of member-oriented businesses, It consumption for sustainability. From "Change Agents" in Redefining Leadership Some may hexistate, associating development" with activitism and self-sacrifice. But DMI is changing that perception. Instead of "change agents," DMI graduates are propared to be "Im pact Man ag ers." – professionals who understand that social good, economic progress and environmental sustainability gotogether. 

ゎ゚゚゚゚゚゚゚゚゚゚゚゙゙゠ DMI

ફાયના	ન્સિયલ	એકર	મપ્રેસ



e

/Dect		FORM B ANNOUNCEMENT atov Board of India (Liquidation Process) Reculations, 2016)	
FOF	R THE ATTENTION OF THE STAI	KEHOLDERS OF GO AIRLINES (INDIA) LIMITED	
SI. No.	PARTICULARS	DETAILS	UCAL
1.	Name of corporate debtor	Go Airlines (India) Limited	
2.	Date of incorporation of corporate debtor	29* April 2004	
3.	Authority under which corporate debtor is incorporated / registered	Ministry of Corporate Affairs, ROC - Delhi	
4.	Corporate Identity No. / Limited Liability Identification No. of corporate debtor	U63013DL2004PLC217305	Martine to be achieved
5.	Address of the registered office and principal office (if any) of corporate debtor	Registered Office Address: Britannia Industries Limited, A-33, Lawrence Road Industrial Area, New Delhi 11035 Principal Office Address: 4h Floor, Kaledonia Building, Sambhaji Negar, Sahar Road, Andheri Faat, Mumbai MH 400069	Notice is hereby giv (Formerly Known as Government i.e Mini V and other applica
б.	Date of closure of insolvency Resolution Process	20 January, 2025	(DIN: 08188358) as
7.	Liquidation commencement date of corporate debtor	20 January, 2025	12" November 2029
8.	Name and registration number of the insolvency professional acting as liquidator	Mr. Dinkar T. Venkatasubramanian IBBI/IPA-001/IP-P00003/2016-17/10011	Nomination and Re members approval d
9.	Address and e-mail of the liquidator, as registered with the Board	Ernst & Young LLP , Golf View Corporate Tower B, Sector 42, Gurugram Haryana – 122002 Dinkar,venkatasubramanian@in.ev.com	This notice shall also
10.	Address and e-mail to be used for correspondence with the liquidator	Go Airlines (India) Limited 4 <sup>th</sup> Floor, Kaledonia Building, Sambhaji Nagar, Sahar Road, Andheri East, Mumbai MH 400069.	exchanges i.e BSE L
		gofirstcirp@gmail.com Creditors are requested to submit their claims through the following link:	Any person having a writing to the Secreta
		www.gofirstclaims.in/liquidation	
11.	Last date for submission of claims	19 February, 2025	Prasad Road, New
comm The s or bef The fi may s Subm Subm In cas such Banks	encement of liquidation of Go Airlines askeholders of Go Airlines (India) Limbi en 19 February, 2025 to the liquidator rancial creditors shall submit their cla ubmit the claims with the proof in perso ission of false or mislead ng proof of cla e a stakeholder does not submit its cla a stakeholder does not submit its cla a stakeholder does not submit its cla a stakeholder does not submit its cla	d are hereby called upon to submit their dame with proof on the address memory and the most of the address memory and the memory of the proof by electronic means only. All other predices , by posit of thy dectronic means, only. All other predices , by posit of the duration process, the dame submitted by insolving the judication process, the dams submitted by insolving viscolution process under the Insolvingy and Uption Process for Corporate Persons Regulations, 2016,	thereof, to the Comp Place : Chennai Date : 24.01.202
Date:	e deemed to be submitted under sectio January 25, 2025 : Delhi	n 38. Sd/- Mr. Dinkar T. Venkatasubramanian	

NO	Pt FICE is hereby	I Floor, Maker Chamber ione: 022-3555 5000. En CIN: L17110M	ail: inves H1973PL DTICE	nd Nariman Point, 1 tor.relations@ril .C019786 	.com  : Company are stated		
	we been lost plicate certif	or misplaced and Registi icate(s).	red Hok	sers thereof have	applied for the issue		
Sr. No.	Folio No.	Name / Joint Names	Shares	Certificate Nos. From - To	Distinctive Nos. From - To		
Any with Seler Hydi failin	Public is hero person(s) wh the Compan sium Tower erabad - 500 : g which, the C	Jagdeesh Allam Pally Lata Naresh Mehra Sujata Anil Chavda Total by warned against parci ya Regizera and Tayata ya Regizera and Tayata ya Regizera and Tayata ya Regizera and Tayata Daviethin Swere (D) Jangang Wil proceed to Jangang Hanga Sangang Jangang Jangang Jangang Jangang Jangang Sangang Jangang Jangang Jangang Sangang J	25 25 50 40 10 6 250 1406 egard of chibowi lays from ssue lette	62513709-709 66781165-165 47122-123 74684-684 12219381-381 15044902-902 15044902-902 15044902-902 15044902-902 15044903-903 15044904-904 15044903-905 51774962-966 dealing with the the securities, shi cir. "KFIn Techn , Financial Diss the date of publi	ould lodge such claim tologles Limited". rict, Nanakramguda, ication of this notice,		
			1:	or Reliance Indus Sd/-	tries Limited		
	e : Mumbai : : lanuary 2	4.2025	Comm	Savithri P w Secretary and	arekh Compliance Officer		
540	junita y z		vril.com	y secressly and	complance Onicer		
	ધી સાઉમ વિન્ડિયન બેંક વિં, શેજનાર ભોરિયત, બમદાવાદ : ૪૧૫, લોધો મળ, સાઇન: - ૫૫, લેક લું થોમ 'જેકલન, આક્રમ શેક, નવરંગણ આદાવાદ, ગુજરાત-Jcooc, થોલ : rol18@સોઠ.cc.in, આદાવાદ, ગુજરાત-Jcooc, થોલ : rol18@સોઠ.cc.in,						

પઝેશન નોટીસ ્. (સ્થાવર મિલકત માટે) વાથી, નીચે સાતી કરનાર **દાં સાલાય કોન્ડિયાર અને કા લ**તા અપૈ દુન અપિકારીએ સિસ્પોરિટાઈ ડેસ દુકાલન ઓક કાયનાન્ત્રીવાલ એસેટ્સ એન્ડ એન્કોર્સિન્ટ ઓક સિસ્પોરીટી ઇન્ટરેસ્ટ અપિનિયમ સેસ્પોરિટી ઉત્પરંદર (એ લોકોર્સ નટ) કુલા, ૨૦૦૦ના નિયમ આપે કેવાની કાયત ૧૩ (૧૩) હેઠ છે તે પીપન નોડી શેર પ્રેલા તા હપત, અદ અર ક્યાન લોક વાર લોક વાર બાદ કોઇ પ્રેલ માંગલી નોટી શ્વા કરો: (૧), બી લેવા અનિયભાર્થ (એ. ભોષા બ્રાહ્મ, લાખા માર્કેટીંગ થારં, એન્ટર, બ 

n ા પ્લપ્તા. (/ જામીનદારોનું ધ્યાન આક્રચ્પ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં પેટા કલમ ૩ સરકેમી એકટ હેઠળ તથો તમારી સુરક્ષિત થિલક્તના બાકી હહેણાં ભરપાઈ કરી પાછી स्थापर भिलकतनं पर्शन





mination and Remuneration Committee at their meeting held on 12" November, 2024 and in terms of the embers approval dated 19"December, 2024.

y person having any objection(s) to the above may. If he / she so desires communicate his/her objections in ting to the Secretary, Ministry of Corporate Affairs, Government of India, A-Wing, Shastri Bhawan, Dr. Rajendra asad Road, New Delhi - 110.001 within 30 days from the date of publication of this notice and send a copy ereof, to the Company at the above mentioned address

otice is hereby given pursuant to Section 201 of the Companies Act, 2013 (the "Act"), that UCAL Limited mem/Fy/Kowa 802 (AL). Feel Systems Limited) (the Company), intends to make anaplication to the Central overment i.e Ministry of Corporate Affairs, Government of India under Section 196 read with Part-1 of Schedule and other applicable provision of the Act, in respect to the appointment of Mr. Addhys Shrintas Jayakar III. No 6188555, Bochuy Managing Director of the Company for apriced of System Ton 2<sup>1</sup> November, 2024 of Provember 2029, pursuant to the terms and conditions as approved by the Board of Directors including

is notice shall also be available on the website of the Company at www.ucal.com and on the website of the stock changes i.e BSE Limited and National Stock Exchange of India Limited.

By order of the Board For UCAL Limited S. Narayan

Company Sec

VES BANK and on shifter and a shifter of the state માં મોચે સેદી કરળાર અંધિકૃત ઓધિકારીએ સિચારેટાસીમાં દીવ આંગુ સિઝાગેલી બેન્ટરેસ્ટ એસ, ૨૦૦૨ તથા કલમ ૧(૧૨) હેઠળ મળેલે સાથ સાથે સિઝાનેલી બન્દરે ૨૦૦ તથા બિચા ૨૦૦૩ તંત્ર મળેલે સમાથી સુધ ગોલે ગાયતા હોય લાગ્યાના સુધ સિઝાનેલી બન્દરે મેને નોરેસ તાલેખુબભવાલીના દૃદ્ધ દિત્સોની ઝાંદર નોટોસમાં વભાવેલ રકમ શુકલવા વભાવેલ. કલ્ગુઓ(Fb2a): ૨૦૦૨ વરના વ્ય સ એન્ડ એન્ફોસંમેન્ટ ઓફ સિક સિંમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા ( ણા નોટીસ જારી કરીને નોટીસ તાંઓ)સંદ-ઉદ્યાટકર્તાઓ/મિટરોટો રકમ શુરુવામાં કરૂરવાર સતાં આથી ખાસ કરીને ઉદ્યાર્ગ્ધના વ્યવાયતાં તાંઓ)સંદ-ઉદ્યાદર્શનાઓ/મિટરોટો રકમ શુરુવામાં કરૂરવાર સતાં આથી ખાસ કરીને ઉદ્યાદર્શનાઓ/ તોઓ/સંદર્શનો સંદર્શનો સંસ લો કરવાર નોટોસ થી વધાપ્રતામાં આવે છે કે આધિનિયમ ૧૩(૪) નો સાથે નિયમ ૮ દેશ આપેલી રાખા છે તોને સલી કરવાર નોય વપાછતે નિશ્લતોનો કબ્જો તોદાર છે. રક્તાં અને માટે તે આ પણ અન્ય પણ કરવાનું જાવ પાપાલ ભાઉતાલાં કંબેજા શાંધા છે. કરતાં અંગે સરકર બિશા અંતી ગિરવેદારો ને વિશેષ સુધ્ધી તથા પાટેર જવાનો આશી સરકર બિકતો અંગે કોઈપણ બતનો વ્યયદ સ્વાનો વેતરાણી આપમાં આવે છે. સારકર્ણ ભિકાલ અંગે કહેવો કોઈપણ વ્યવતાર **થય તેક લીમીટેડ** નોચે દશાંવેલ રક્ષ્મ પ્ છી શાસ ત્યાં સુધી વ્યાજ તથા અન્ય ખર્ચા સાથેના બીબ સાઉતનો રહેશે. ભરાળ આપ પા શુપ્રા આપ આપ આગ ના માતાનાના ના પાસાના અને પ્રાપ્ય છે. આ તમારા દામા પર પ્રાપ્ય પ્રાપ્ય છે કે SARF51 કેસ્ટનો કલપ ૧૬(૮) કેઠળ, જ્યાં સુરક્ષિત લેણદાર દ્વારા કરવામાં આવેલ ભા ઘરું, આપ એમ ખર્ચ સાથે સુરક્ષિત લેણદારની ભાકી રકમના ટ્રકમ ઝગાઉ છોધણા સમયે સુરક્ષિત લેણદાર ને આવામાં આવે છે. ભોર કરવું / કેન્ડ / ખાન્ચ / આગે કેરવા પ્રાપ્ય નેશિક્તા આકલાનો ના દીપ, સુરક્ષિત સંપત્તિ કેવા આવા સમાનંતરણ કરવામાં આવો નહે ભો તે સુરક્ષિત સંપત્તિના સ્થાનાંતરણ અથવા વેચાણ માટે આગળ કેપું ધગલા લેવામાં આવશે નહીં. ીઓ / સહ-ઉધારક્તાઓ / ગિરવેદારો / પ્રોપ ડીમાન્ડ નોટીસની તારીખ અને બાકી લેશા ૨ક 
 Butterdiol / Jose Dittertiol / Jose Dittertiol / Jose Dittertion / Josept Dittertion / Jose Ditterin / Jose Dittertin / Jose Dittertion / Jose Dittert (શુંદ્ર), કરવુંદ્ર, ગમનાના પ્રાપ્ત કરવુંદ્ર, ગમનાના પ્રાપ્ત કરવુંદ્ર, ગરુરચર, કલમતો પ્રકાર સોકેલિક કલમો પ્રેણારે દેશે સોક્સે સોક્સ કરવું ક પ્રુણારે દેશેલા લાસાંદાની (Ke (લાકર્લા અને વિશ્વેરાર) ) વિશા સુલાવે લાસાંદાની (Ke (લાકર્લા અને વિશ્વેરાર) ) વિશા સુલાવે લાસાંદાની (Ke (લાકર્લા અને વિશ્વેરાર)

# JINDAL JINDAL WORLDWIDE LIMITED

CIN : L17110GJ1986PLC008942 Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, ranjanShyamal 132 FL: Ring Road, Satellite, Ahmedabad – 380015, Gujarat, India 7/1001500 - Email Id : csjindal@jindallextiles.com • Website : www.jindalextiles. Shiv hivranjaniShyamal 1 079-71001500 • Err

CORRIGENDUM TO THE NOTICE OF POSTAL BALLOT DATED 7<sup>TH</sup> JANUARY, 2025

CORRIGENDUM TO THE NOTICE OF POSIAL BALLOT DATED 7 JANUARY, 2025 Dear Shareholders, This is with reference to the Notice of Postal Ballot dated 7<sup>b</sup> January, 2025 issued to the shareholders of Jindal Worldwide Limited ('the Company') and ongoing e-voting available from Friday, 17 January, 2026 at 09:00 AM. (IST) which will end on Saturday, 15<sup>6</sup> February, 2026 at 05:00 P.M. (IST). The Notice of Postal Ballot dated 7<sup>7</sup> January, 2025 ('Postal Ballot Notice') was dispatched via email to the Shareholders of the Company on 16<sup>7</sup> January, 2025, in due compliance with the provisions of the Companies Act, 2013, and rules made thereunder, read with circular issued by the Ministry of Corporate Aflairs and Securities Exchange Board of India, respectively. We draw the attention of all the Shareholders of the Company towards the said Postal Ballot Notice. In pursuance to the compliance of SEII (LODR) Regulations, 2015 read with all such necessary amendments thereto, this Corrigendum is being issued to viave notice to the shareholders for omission of the Poritin z 7 of Notes to the Postal Ballot give notice to the shareholders for omission of the Point no. 7 of Notes to the Postal Ballot Notice, as per the explanation below:

The requirement of announcing dates of closure of transfer books in place of record date fo The requirement of announcing dates of closure of transfer books in place of record date to securities held in physical form, for complying with requirements for Issue of Boouns Issue of Sharesi.e. Regulation 42(5) of SEBI (LODR) Regulations, 2015, has been omitted by the SEBI vide its Notification No. SEBI/LAD-INRO/ON/2024/218 dated 12<sup>th</sup> December, 2024. Accordingly, the Company be and hereby omit Point no. 7 of Notes to the Postal Ballot Notice and that the Postal Ballot Notice as circulated earlier should be read after ignoring the Point No. 7 which has been omitted through this corrigendum.

Notice and that the Postal Ballot Notice as circulated earlier should be read atter ignoring the Point.N.2. "Michine Sole on emitted through this compandum." Point No.7. "Michine Postal Ballot Notice" COMTINCT: "7. Pursuant to the provision of Section 91 of the Companies Act, 2013 read with relevant rules and Regulation 42 of SEB/ (LODR) Regulations, 2015; the Register of Members and Share Transfer Books of the Company will remain closed (Book Closure Period) form Mhordky, 24" February, 2023 to Tuesday, 25" February, 2025 (both days inclusive) for the purpose of sisue and allotteneriof Bonus shares." This Corrigendum to the Postal Ballot Notice shall form an integral part of the Postal Ballot Notice, which has already been circulated to the Shareholders of the Company, and on and from the date hereof. the Postal Ballot Notice shall always be read in conjunction with this Corrigendum, shall remain enchanged. This Corrigendum dated 24" January, 2025, shall also Consequent, shall chareholders, Stock Exchanges, Depositories, Regulators, and all other concerned parsons are requested to take to lead the suppositories, All other contents of the Postal Ballot Notice, save and except as modified or supplemented by this Conrigendum, shall emain unchanged. This Corrigendum dated 24" January, 2025, shall also be evaliable on the Company's website www.jindiatcrities.com, websites of the Stock (ESP) www.bashella on and <u>www.nscalindia.com, respectively</u> and the e- Voling Service Provider (ESP).

(ESP). This Corrigendum is being sent only through electronic mode to those Shareholders whose email address is registered with the Company / depository participant(s) as on the cut-off date i.e. Friday, 10<sup>-3</sup> January, 2025. We would like to throm all those, who have already casted their votes in the ongoing postal ballot i.e. after the start of e-Voling towards the postal ballot but pror to receiving this Corrigendum to postal halto inco, that their e-vole shall have no impact and no relation with the information provided in the Corrigendum. The omission stated in this Corrigendum is no way resulting in any change in the purpose of Special Businesses and the proposed resolutions thereod.

Date : 24<sup>th</sup> January, 2025 Place : Ahmedabad

This Corrigendum should be read in continuation of and in conjunction with the Postal Ballol notice dated 7th January, 2025. notice dated 7<sup>th</sup> January, 2025. The above is for your information and records. For and on behalf of the Board of Directors For JINDAL WORLDWIDE LIMITED Set

Sd/ AMIT AGRAWAL Vice-Chairman & Managing Directo DIN: 00169061

ব্যাৱা লীহালে রীঁয়ে 🍟 ০০০৫০০ মেটে০০০ ৩০০৫ মংস রাধীস্তর, এপি মাল, ৭.এ. মির্মাং, ইমর্টার্ম র্যেগ হাঁড, হাপ্বরী: Email: css304@pnb.co.i სიე ლ\_\_\_\_\_

કબજા નોટિસ (અચલિત મિલકતો માટે) 50471 ગોટિંસ ( અચલિત ભારત) માટે આવી, તોરે સહી કરમાર 'પાત્ર સેમાલ ભાર્ક ના ગોદેવુક સાધેલાંગે લિલ્લું દેશાં છે. એસ્ટર એન્ક એન્સેએસ્ટ સેક લિક્સુડીઈ મંદરેસ્ટ એક્ટ ૨૦૦૨ ની દારા ૨૩ સાવે વંચાના નિષ્યા ૩ દેશન વિકારોદી મંદ્ર્સ્ટેશ (બેન્સુએસ્ટ) નિષ્ય ૨૦૦ ના અંગર્તને વારે દાર્ચાળા તારીક સ્પરાર્ટા 'પ્રમાદારો / મોડિલાને નિષ્પ્ર ના દેશ ના વેચારે (બેન્સુએસ્ટ) નિષ્ય ૨૦૦ ના અંગર્તના વારે દાર્ચાળા તારીક સ્પરાર્ટા 'પ્રમાદારો / મોડિલાને નિષ્પ્ર ના ચાલ પ્રચાન વાર્ય ગોરીસાં દાર્ચા ના વેચા 'મોડી પ્રચાન થયાના તારી બાળ છે કે છે દવારા સ્પર સ્પરાર્ટ્ય કરવાર છે. પ્રચાન પ્રચાન કરે છે. આ પ્રચાન વાર્ય સ્પર્ય કરવાર કરવાર કરવાર પ્રચાન વાર્ય સ્પર સ્પર્ય સ્પર 'પ્રાપ્યત્યાં આવે છે કે નીટે દાર્ચાલ તારે પ્રધાર વિચાના અંગતે નિચાર ના દારા ૧૩ (૪) ના અંગતે વીરે કરશાદર દરેશ કરવાર છે. 'પ્રશ્ની વ્યક્તી સે દાર્ચાલ ના અંગ સ્પર સ્પરા માં અલ્ય સ્પર્ય લ્યો ના દારા ૧૩ (૪) ના અંગતે વારે વરતાર છે સ્પર કરવાર છે. 'પ્રોપ્રેલ પ્રચાનો ગોળ બાળ પ્રચાન મેમ્બર બાલ બાળ લે ની નીટે દાર્ચીલ બાલ કરવાર તામ તામાં વાર્ય સાંગ છે.' 'પ્રોર્ચે સ્પર સેવાર બાલ બાલ બાલ બાલ બાલ બાલ બાલ બાલ છે. નીટે દાર્ચીલ બાલ કરવાર બાલ વારા વાર્ય સાંગ છે.' 'પ્રોર્ચે સ્પર સરમાયતો ભારતો બોન સોર્ચ પ્રાર્ચ ક્લાય સાંગ લે કે નીટે દાર્ચીલ બાલ કરવા આવે સાંગ છે.' 'પ્રેલ સ્પર સંપર સરમાયતો ભારતો બોન સાંગ છે.'


ક્રમ નં.	ઉધારકર્તાઓ/ જામીનદારો/ ગીરોકર્તાનું નામ અને શાખા	ડિમાન્ડ નોટિસની તારીખ અને બાકી લેણી રકમ +	અચલિત મિલકતોનું વર્છન	કબજાની તારીખ/ પ્રકાર/ સ્થળ
٦	શ્રી કિશન કનકરાય પંડયા (ઉધારકતી) અને શ્રી કનકરાય શોતિલાલ પંડયા (સદ-ઉધારકતી) વાખા : પોરબંદર એમ.જી. રોડ (૩ <b>ઝ</b> ૬૩૦૦)	ડિમાન્ડ નોટિસ તારીખ : ૧૫.૧૦.૨૦૨૪ રૂા. ૩,૯૯,૬૧૪.૩૦ અને તેના પરનું વ્યાજ	ઉલ્લેખિત રહેશાંક મિલ્કત : જે ગામ : આરિલ્યાણા, સર્વે બં. 3૪૩ અને ૩૪૪ જેવી લુલ જમીનાનો વિસ્તાર સ્વર-૦૧-૦૪ ડેક્સી. અને તોન પરબ તુનાંદકામ, જે ત્રી ક્રનકરામ થાંતિલાલ પંડથા ના નામની છે. સ્વર્ધ[સમા ની ચે મુજબ કે : પૂર્વ : અત્યાની માલિકીની મિલ્લત, પહિલ્મ : રસ્તો, ઉતર : રસ્તો, દક્ષિક :અત્યાની માલિકીની મિલ્લત માલિકી : ગી કનકરાથ થાંતિલાલ પંડથા	ર૧.૦૧.૨૦૨૫ સાંકેતિક આદિત્યાછા
2	શ્રીમતી ઠકરાર પુષ્પાએન સંજયભાઈ (ઉદ્યારકતી) અને શ્રીમતી મેઘનાથી દિનાએન દિવ્યેશ (સદ- ઉધારકતી) શાખા : પોરબંદર એમ.ઝ. રોક (ઢઝ૬૩૦૦)	કિમાન્ડ નોટિસ તારીખ : ૧૯.૧૦.૨૦૨૪ રૂ!. ૯,૮૧,૦૨૧ અને તેના પરનું વ્યાજ	પ્રાથમની Beshild : 6 હતેવીન્દ્ર Resa : ગે ભાર છે.5. આપા, પેમરંડલ, વારુ, છેલ્લા, ગે ની, ગે તે પા પાર્ટ્ડ કે ગ્લુપ સ્વીને 24 તે - પાર્ટ્ડ 3, 3, પેસ, દેશ્વા, ' સાં', ' સ્વી' નાવીનોનાની વિસ્તાર પાર વડ કરેડી, અને તે ગા (પાસ્તુ આપણે, પાર્ટ્ડ કરેડી, અને તે ગા (પાસ્તુ આપણે, પાસ્ટ્રિનીની શિલ્લ, પાસ્ટ્રિયા : આરો, આરો, પ્રદુ : અન્સની સિંદીની ગીલ્લ, પાસ્ટિયા : આરો, સ્ટાર, ગો ગોન સાં ' ગી ' ગોના, દક્ષિપ્ર : આરો, સ્ટાર ગોના સાં આર્ગી : પાર્ટ્સના ના સારભાળ કો એક્સ (સ્ટેલ્સાલ્મારી આર્ચના મા બની) અને સીધતી વિતાએન સંપલભાઈ કઠકરા (સ્ટિસ્ટેલ્સાલ્મી આર્ચના મા બની).	ર૧.૦૧.૨૦૨૫ / સાંક્રેતિક / પોરબંદર
3	શ્રી ઉપેન્દ્ર ફકીરાભાઈ ગોઠેલ (ઉધારક્તી) અને શ્રીમતી દિપેતા ઉપેન્દ્ર ગોઠેલ (મોર્ગેજર અને જામીનદાર) શાખા: પોરબંદર (૧૩૩૪૧૦)	ડિમાન્ડ નોટિસ તારીખ : ૧૬.૧૦.૨૦૨૪ રૂા. ૧૨,૪૮,૬૫૯ અને તેના પરનું વ્યાજ	ઉલ્લેશિન્સ પોસ્બંદર પશેર પાતે સ્થિત રહેશાંક માન શરાવતી ભિલ્લા ૧ પોર્સ્સ રાષ્ટ્રે, પોસ્ટર પ્રોસ, પોર્સ્સ રાષ્ટ્રી સિ વી છે તે , ગોરી ગાં તો , કરર ૮, જામિલ્તો વિસ્તાર કર ૮, ન્ડ્ર રહેત્રી, કારાટ તો ૧૮૩, પોરંતર સ્વારપાલિક્ષની દરગે અને તેના પેસ્તનું માળતું <b>ચતુસિમા નવી ગુજબ છે ! પૂર્વ કોમ</b> રસ્તો, <b>પશ્ચિક ! ગુલ્લી જામિ, હદા ! ગુલ્લી જામે નગે</b> તેલો તો <b>તે, દર્સિયા : વ્યાર્ટ્સ ! પ્રગ્ના મિલ્લાએ લગ્લે કોમ લ</b> ી વિસ્તાર <b>માહિકા : શ્રીમની મિલ્લાએ ન જોવાળાઈ મસાણી (ઉપેન્ક</b> ફરીશળાઈ મોહેલ ભા ખલી)	ર૧.૦૧.૨૦૨૫ / સાંક્રેતિક પોરબંદર
¥	શ્રી મદ્દેવા અશ્વીન વલ્લભદાસ (ઉધાક્કર્તા) અને ત્રીમતી શ્વેરના જયોરસના અશ્વીન (સદ- ઉધારકર્તી) યાખા : પોરબંદર એમ.જી. રોડ (૩૭૬૭૦૦)	ડિમાન્ડ નોટિસ તારીખ : ૦૬.૧૧.૨૦૨૪ ૨૦,૮૯,૪૩૭.૩૮ અને તેના ૫૨નું વ્યાજ	પ્રાથમારી વિશ્વધીથી : બાત લાગ અને અંધ સાઉતની હિલ્લીય ઉત્તરા કરે પ્રેશ્વર સંગં લ .ગુ / , "વહારુપી તરીકે ગોભમ ઘરમતી તેશકાં કેલુ પ્રાર્થિતિ, લોખોરા બંદ તે . ર ક્વી દર, ગ લા પરાત્રના વિભાગમું પ્રાર્થકા તે . ર ક્વી દર, ગ લા પરાત્રના પ્રાર્થકા આ ગોધ, પ્રોર્થકર તાલુકા / ગુલ્લા કેલન ૧ કેલ વાલ્લાદય પ્રોર્થ આ એ પ્લોલ સોવના સ્વાર્થના કોરો વાલ્લાદ પ્રાર્થકા અને પ્રાર્થના કોર્મ કાર્યતી કરોતા કાર બાદિલ, પ્રાર્થકા અને પ્રાર્થના કોર્મ કાર્યતી વાલ કોર્મ બાદ પ્રાર્થકત, પ્રાર્થકા અને પ્રાર્થના કોર્મ કાર્યતી કાર્યતા કાર્ય પ્રાર્થકત, પ્રાર્થકા અને પ્રાર્થના કોર્મ કાર્યતા કોર્મ કાર્યતા કોર્મ કોર્	ર૧.૦૧.૨૦૨૫ / સાંક્રેલિક / પોરબંદર
u	મે. પર્વ રોપ્સ (ભાગીદારી પેક્રી) (ઉધારકર્તા), શ્રીમતી રામ મનીશાલેન યોગેશભાઈ (મે. પર્વ દેપ્સ આ ભાગીદાર અને મીંજ એગેશ રામભાઈ ચમ (મે. પર્વ રોપ્સ ના ભાગીદાર અને મોર્ગેજર અને જામીનદાર) શાખા : પોરબંદર એમ.જી.	ડિમાન્ડ નોટિસ તારીખ : ૧૨.૧૧.૨૦૨૪ ફો. ૧,૦૮,૦૫,૧૪૯.૪૨ અને તેના પરનું વ્યાજ	ીમાટોટલ સિમ્પ્લેલિંગ - મોતોવિલ પ્લોટ લાયતા ઉત્સંતિત્વ Reser રે ગામ નાખાળા. તલુકો રાશાળાના પ્રસ્તુ સંવેત - દુર હોવ, પોટ તં. પર, નવાશા જીઆશેલી એરેટ. ગામેતાની વિરાદ પર વરન પાટ તેની. તે અંદ તે તા ઉપરતું પાર્ટ્લિયા ના બેલે પ્રસ્તુ છે ને ઉતર 17 પટ તે ની પાર્ટ પાર્ટ્લિયા ના બેલે છે ને ઉતર 17 પટ તે ની પાર્ટ તે પર્ટિયા ના બેલે પાર્ટ તે કરતાં કરતાં છે. તે કરતાં વિશ્વના માલીક 1. પ્રત્યે ને પ્રસ્તુ ભાગીનો ધોનેસ સાસ્ટલાઈ વાસ અને મનીરા મોગેસ પ્રત	ર૧.૦૧.૨૦૨૫ / સાંકેતિક / વનાણા જીઆઇડીસી (પોરબંદર)

(આ નોટિસનું અંગ્રેજીમાંથી અન્ય ભાષામાં અનુવાદ કરતી વખતે કોઈ સતિ થયેલ જણાયે તો કાયદાકીય રીતે અંગ્રેજી લખાણ જ માન્ય ગણાયે)



વુમેબુડા છે. કરવા તોકારબાદવાર વેષાવાડિયત પર આવલવેશ, ૧૯૧૧ અને બેએમાંબ્રેમાં કલામરક (૧-૦૩) અનુસાર ૧૪: કીડીએસ વાયરો અને ડેની ડોમ કરકવુક્રી(કેઇડી) માં ચલાનાં ગળા કરાવો. એક વિતારબી લાકડળ આપ આ કરાવો. ડેન્ટા કેબેક મેને મેલાવા અને બિલ્લાત વાર્ત વિશેષા માં વાય લુક વડીએ બાદિવૃત પ્રથ્લિકાર્યા માં પીએક વડી કરવારહગર કોર્યવા કારમાતા તેરે અવિક્રે માં કરવાર આપ કાર છે. તેરે અવિક્ર માં કરવારાં આ કે બિલ્લા તે આ તે વાય લુક વડીએ બાદિવૃત પ્રથમિક માં વિશે કરે પ્રારં છે. વારે અવિક્ર માં કરવારાં આ કે બિલ્લા તે આ છે. એક આ કારમાં આ વિશે કરવા વધા છે. આ કે બાદ કરવાર કોર્યવા કારમાં આ ક આ વેવાયનોટિસ વેરસાયક (પ્રથમ: hind)કોર્યુકાર્યા માં આવ્યું હોડો કરવાર પ્રચાર આવેક)મકલિત થયેલ છે. અધિક્ર ન અધિકારી,

અધિકૃત અધિકારી, હિન્દુજા લેલેન્ડ ફાઈનાન્સ લિમિટેડ તારીખઃ ૨૫.૦૧.૨૦૨૫, સ્થળઃ અમદાવાદ



એસકે ફાઈનાન્સ લિમિટેડ

sk

### કાયનાન્સિયલ એક્સપ્રેસ

TATA PO

NOTICE INVITING TENDER

Services for Foundation for RH2 Shed at Trombay CLP, at Chembur-Mahul Mumbai 400074

PUBLIC NOTICE PUBLIC NOTICE

G



પૈયા) ની શરુ બંહેને ચુક્યાના પેશ બંહાલતા દેશે. ઉદ્યારતીએને આપ તાલા તે પેતાનું કે રહેલી કારાદની દલમ ૧૩ (૮) ની ગેરબાઈ અનુસાર આપેલ સમયમર્થદામાં કાર્યદાનુસાર ટેમની સલાયત નિલકત પાછી મેળવી થકે છે. **સ્વારર સિવકલતું વર્દાન** (મહિંકા વ્યલવાં વડ્ડા આપજી કારો છે.) 'મંટારા ગામાના રેપન્સુ સંવે ને. પટ પૈકી ગામ ગ્રામ પંચાવત નિલકત નં. *9/25/પ* મંટારા ગામાના રેપન્સુ સંવે ને. પટ પૈકી ગામ ગ્રામ પંચાવત નિલકત નં. *9/25/પ* સારસ્વતી, છુ., પાટણ, ગુસ્પરા આં આવેલ મિલકત. બેની આપુલાય : ઉત્તરામ સારસ્વતી, છુ., પાટણ, ગુસ્પરા આં આવેલ મિલકત. બેની આપુલાય : ઉત્તરામ પછી સોટપ્ર પ્રિમામાં ૧૮ ફૂટ પહોળો ટોક. આપિક માટે પ્રાપ્ત કાર આપ્રિક 11. 15.01.2024

૧૮ ફૂટ પહાળા રાડ. અધિકૃત અધિકારી એસકે ફાઈનાન્સ લિમિટેડ (જુનું નામ – એસ કે ફીનકોર્પ લિમિટેડ

## nara Bank 📣 પ્રાદેશિક કાચલિય : ગાંધીનગર મામ્યલયલ્ય પ્લોટ નં. ૩૨૨ થી ૩૨૫, સમૃદ્ધિ કોમ્પલેસ, આંધીનગર

### **કબજા નોટિસ** (સ્થાવર મિલકત માટે)

564'91 નો)દેરી (સ્વાર (સ્વાર (સ્વાર (સ્વાર)) આવી, લીરે વારે (કરતો, પ્રત્વીલાર) અને સારાધીલ (સ્વાત) બુલ્લ્મેલા અંગ પ્રતીનગી લાગ સ્વારીકરાયો, પ્રતીલાર અને સારાધ્યાં સ્વાર્ચક્રા બ્લેટા તેવાનાં ગ્રે તેમ કરા પર (પ્રત્ન) તાર્ચ લોવા સ્વાર્ચક્રી વાર (પ્રત્નાલાન) બ્લાન્સ વેતાને ભિયમ રે કેલા ખરેલી સાત્ની ગ્રેણે, તોરે સારી કરાવે તા. પ્રાo. રાગ્ય ના સે પ્લ કેસ બેલા પ્રત્ને કેલા ખરેલી સાત્ની ગ્રેણે, તોરે સારી કરાવે તા. પ્રાo. પ્રાo. તોર બેલા એ સ્વાર્ચકાર બારા પ્રત્ના પ્રતિ કરાવે છે. આ ગ્રે તે સાત્ર પ્રતિ કરી કરી કરાવે તા. પ્રાપ્ત કરે સારે પ્રાપ્તાનાં સ્વાર કરાવે છે. આ ગ્રે પ્લાય કરોક કરાવે લાગ વાળાવું હતા સ્વાર પ્રાપ્ત કરી કરી કરાવે છે. પ્રાપ્તાનું સાત્રી અને સાત્ર કેલા હતા સ્વાર સાવાનો સ્વારો ગ્રાપ્ત કરો આ ગ્રે આ ગ્રે આ ગ્રે આ ગ્રે આ ગ્રે આવે આ ગ્રે આવેલી સ્વારે સાત્ર ગ્રે ગ્રે આ ગ્રે આ

સપિલ છે. આદી વિલેષપાટો દેવાદાર 'સપ્તીલાઇસે અને સામાન્ય પાટે મહેર જનતાને જણાવેલ બિલક અંગે કોઇપણ વ્યવસર નહીં કરવા ચેતવણી આપવામાં આવે છે અને આ બિલકતો અંગેનો કોઇપણ વ્યવસર સ્કરા 3, **પ, 09, 69, 27 પર, 07 (ગ્રીપમાં પાંચ કોડેક સાત લામ સાસા** હું વસ્તત્ર સાથાસે **ચોર્માની અને અક્સોર વેષ્ઠા** નોલામાં છે અને બિલાબા વાપ જ અને જયાં સુધી પૂરેણુ ટેસ ન્યુદ્ધારા રહ્યાં સુધી આકબ્પિક પર્યા, કોરણ, ચાર્જીસ વગેરે સાથે કેનાર બેંકાન બોજાને આધી.

તા.: ૧૨.૦૧.૨૦૨૫. સ્થળ : ડીરા સહી/- અધિકત અધિકારી, કેનરા બેંક



### NETWORK18 MEDIA & INVESTMENTS LIMITED

RailTel

railtel.in, https://e

Ser Contraction

CIN: L65910MH1996PLC280969 Regd. Office: First Floor, Empire Complex, 414 - Senapati Bagat Marg. Lower Parel, Mumbai - 400 013 Tet: + 91 22 66667 7777, 4001 9000 Website: www.mv18.com | E-mail: investors.n18@mv18.com

### EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31<sup>st</sup> December, 2024 · share data)

 `		 0,10	., •	 opi	pui	
	Т				T	

Particulars	Quarter Ended 31" Dec' 2024	Nine Months Ended 31" Dec' 2024	Quarter Ended 31" Dec' 2023
Value of Sales and Services	1,586.46	7,354.19	2,064.36
Goods and Services Tax included in above	225.96	1,027.59	290.63
Revenue from Operations	1,360.50	6,326.60	1,773.73
Profit/ (Loss) before Exceptional Items and Tax	25.68	(316.26)	(101.89)
Exceptional Items	1,425.73	1,425.73	-
Profit/ (Loss) for the period before Tax	(1,400.05)	(1,741.99)	(101.89)
Profit/ (Loss) for the period after Tax *	(1,399.91)	(1,747.58)	(102.31)
Total Comprehensive Income for the period (after tax)	(1,417.56)	(1,708.09)	(105.98)
Paid up Equity Share Capital, Equity Shares of ₹ 5 each	765.21	765.21	517.68
Other Equity excluding Revaluation Reserve **			
Earnings per Equity Share (Face value of ₹ 5 each) (Not Annualised)			
1 - Basic & Diluted (₹) - Before Exceptional Items		(1.51)	(0.39)
2- Basic & Diluted (₹) - After Exceptional Items	(9.38)	(10.83)	(0.39)
* Includes share of Non-Controlling Interest			

excluding revaluation reserve for the year ended as on 31<sup>st</sup> March, 2024 was ₹14,147.60 crore

Notes:

The Audit Committee has reviewed the above results and the Board of Directors have approved the above results and its release at their respective meetings held on January 14, 2025. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.

2 Additional information on Linaudited Standalone Financial Results is as follows:

Particulars	Quarter Ended 31" Dec' 2024	Nine Months Ended 31 <sup>st</sup> Dec' 2024	Quarter Ended 31" Dec' 2023
Value of Sales and Services	556.33	1,596.29	545.16
Goods and Services Tax included in above	79.92	221.84	76.07
Revenue from Operations	476.41	1,374.45	469.10
Profit/ (Loss) before Exceptional Items and Tax	(66.27)	(215.37)	(43.42)
Exceptional Items	3,498.21	3,498.21	-
Profit/ (Loss) for the period before Tax	3,431.94	3,282.84	(43.42)
Profit/ (Loss) for the period after Tax	3,431.94	3,282.84	(43.42)
Total Comprehensive Income for the period			
(after tax)	3,411.21	3,323.46	(45.90)

3 The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the quarter and nine months ended 31<sup>th</sup> December, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone and Consolidated Financial Results for the said guarter and nine months ended 31<sup>st</sup> December, 2024 are available Intraction resolution to the solution of the international of the control of t in this publication 

For Network18 Media & Investments Limited Sd/-

1				D	ate : Janua	ary 14, 202	25		5		Chair		
10	CONTROL C												
	EXTRACT OF UN-AUDITED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED 31ST DECEMBER, 2024 (Rs. In Jacs												
П			STANDALONE Quarter Ended			ONSOLIDATE			ALONE the ended		LIDATED ths ended		CONSOLIDATED
S. No	PARTICULARS	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	30.09.2024	31.12.2023	Nine mon 31.12.2024		Nine mor 31,12,2024	31.12.2023	Year 31.03.2024	1.03.2024
10		31.12.2024 (Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)			(Un-Audited)	(Audited)	(Audited)
1	Total income from operations (net)	1,468.29	1,287.13	1,150.78	2,064.65	1,977.16	1,131.37	3,826.60	3,220.27	5,098.20	3,282.60	4,453.83	4,595.95
2	Net Profit for the period												
Ш	(before Tax, Exceptional and Extraordinary Items)	36.92	20.69	98.87	53.13	35.18	89.50	140.09	241.51	121.73	238.02	258.14	284.56
3	Net Profit for the period before tax,												
Ш	(after Exceptional and Extraordinary items)	36.92	20.69	98.87	53.13	35.18	89.50	140.09	241.51	121.73	238.02	258.14	284.56
4	Net Profit for the period after tax,												
H	(after Exceptional and Extraordinary items)	36.92	20.69	98.87	53.13	35.18	89.50	140.09	241.51	121.73	238.02	177.92	203.50
5	Total Comprehensive Income for the period												
	[Comprising Proifit for the period (after tax) and			00.07	53.43		00.50	440.00		404.70	00000	477.00	000 50
	Other Comprehensive Income (after Tax)	36.92	20.69	98.87	53.13	35.18	89.50	140.09		121.73 5.339.01	238.02	177.92	203.50
6	Equity Share Capital	5,339.01	5,339.01	5,339.01	5,339.01	5,339.01	5,339.01	5,339.01	5,339.01	5,339.01	5,339.01	5,339.01	5,339.01
Ľ	Reserves (excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of the previous year)												
	"Earnings per share (of Re. 1/- each)			-									
ľ	(for continuing operations)"				Ι.								
l ł	1. Basic	0.0070	0.0040	0.0190	0.0090	0.0060	0.0170	0.0260	0.0450	0.0220	0.0450	0.0330	0.0380
ιł	2. Diluted	0.0070	0.0040	0.0190	0.0090	0.0060	0.0170	0.0200	0.0450	0.0220	0.0450	0.0330	0.0380
		0.0010	0.0040	0.0100	3.0000	0.0000	2.0110	3.0200	0.0400	0.0440	0.0400	0.0030	0.0000
Netse:         Instruction         Netse         Netse													
-	Segment wise sales: Electric Vehicles	1397.92	1033.53	721.24	1668.99	1051.93	171.94	3044.37	1188.06	3201.1	1150.25	2014.29	2031.02
	Renewable Energy Products	37.47	239.97	394.79	350.7	897.56	923.82	719.27	1928.18	1806.01	2024.18	2014.29	2031.02
⊢	contraction attering a routered	0.41	200.01	004.10	000.7	031.30	020.02	110.21	1020.10	1000.01	2024.10		SLOBAL LIMITED
	ace : New Delhi te : 13th January,2025											MOHAN JAG	Sd/ SDISH AGARWAL lanaging Director DIN: 07627565

જાહેર હરાજીથી વેચાણ	અગેની નોર્ટીસ	
એસકે ફાઈનાન્સ લિમિટેડના અધિકૃત અધિકારીએ સિક્યુરીટાઈઝેશન	એન્ડ રિકન્સટુકશન ઓફ ફ	ાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ
એન્કોર્સમેન્ટ ઓક સિક્યરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૫૪ ઓક ૨૦૦૨	સાથે ઘ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ	: (એન્કોર્સમેન્ટ) ૩લ. ૨૦૦૨
દેઠળ મળેલ અધિકારોને અંતર્ગત બેંકના બાકી લ્હેણાં <b>રૂા. ૨૦,૬૪,૫૫</b> લ	/- (રૂા. વીસ લાખ ચોસઠ	હજાર પાંચસો પચાસ પુરા)
તા. ૨૭.૦૨.૨૦૨૪ સુધીના અને તા. ૦૫.૦૩.૨૦૨૪ થી લ્ફેણાંની વસલાત	ન થાય ત્યાં સુધીનું કોન્ટ્રાક્ટ	રેટ પ્રમાણેનું ભવિષ્યનું વ્યાજ
તેમજ અન્ય ચાર્જીસની વસુલાત માટે તેના ઉદ્યારકર્તા શહુલ સિંહ સોમાજી શ	કોક તે સોમાજી શઠોકના પંત્ર અ	નને સઠ-ઉધારકર્તા <b>સોમાભાઈ</b>
બીજોલ્જી ઠાકોર અને સંદ-ઉધારકર્તા જોઈતીબેન સોમાભાઈ ઠાકોર તે	સોમાભાઈના પત્ની, લોન	<b>ฟิธเช็ค</b> ะ ค่. นรุษ36นะ.
રહે. આનંદ નગર, પોલીસ દેક ક્વાટર્સ પાસે, મુ. ભિલાકી, તા. કિસા, જી. વ		
પૈકી, નવી ભિલાકી, મિલકત નં. ૬૫७/૧, પી.એન. ૩७, આનંદ નગર, ૧		
ભિલાકી, ડિસા, બનાસકાંઠા, ગુજરાત–૩૮૫૫૩૦ અને અન્ય ઉધારકર્તા લ		
વાસ, સદરપુર લુણપુર, જના ડિસા, બનાસકાંઠા, ગુજરાત-૩૮૫૫૪૦ ને ત		
હેઠળ ડિમાન્ડ નોટીસ આપેલ હતી. નીચે સહી કરનાર દ્વારા નીચે જણાવેલ		
તે ધોરણે સીલ બંધ કવરમાં ઓકરો મંગાવવામાં આવે છે.		
બાંદ્રેઘરીવાળી મિલકત	રીઝર્વ કિંમત	ઈએમડી ની ૨૬મ
રેવન્થ સર્વે નં. ૪૪ / ૧ પૈકી, પ્લોટ નં. ૩૭ પૈકીનો પશ્ચિમ ભાગ ફલ ક્ષેત્રફળ	31. 5.46.204/-	31. 54.620.40
આશરે ૫૦૦–૦૦ થો. કટ એટલે કે ૪૬–૪૪૩૯ થો.મી. મૃ. ભિલાડી	(રૂા. પાંચ લાખ છેતાલીસ	(ગ્ર. યોપ્પન કજાર છસો
સ્થિત, તા. ડિસા, જી. બનાસકાંઠા, ગુજરાત ખાતે આવેલ મિલકત.	હજાર બસો ચાર પુરા)	વીસ અને ચાલીસ પૈસા)
	<b>N</b> /	,
નીચે સહી કરનાર ઈચ્છુક બોલીકારો માટે દ્વારા બેંકના રીપ્રેઝન્ટેટીવ/એજન બપોરના 3.00 કલાકે ઉપરોક્ત મિલકતના નિરીક્ષણની વ્યવસ્થા કરવામાં		
અપારના 3.00 કલાક ઉપરાક્ત ભલકતના નરાક્ષણના વ્યવસ્થા કરવામાં અને જો નીચે સહી કરનારને યોગ્ય લાગશે તો બેંકના રીપ્રેઝન્ટેટીવ/એજન્ટ		
અન જા નાચ સહ્ય કરનારન ચાગ્ય લાગશ લા બકના રાત્રઝન્ટટાવ/ અજન્ટ ઈચ્છક બોલીકારો માટે મિલકતનું નિરીક્ષણની વ્યવસ્થા કરી આપશે. સીલ બ		
ઇચ્છુક બાલાકારા માટ ામલકલનું ાનરાજ્ઞભાળ વ્યવસ્થા કરા આવેશે. સાલ બ <b>ખરીદી માટેની ઓફર''</b> લખવાનું રહેશે. ઇચ્છુક બોલીકારોએ સીલ બંધ ક		
ખરાદા માટના આફર ં લખવાનુ રહેશ. ઇચ્છુક બાલાકારાએ સાલે બધ ક ડાક્ટ / પે ઓર્ડર ''એસકે કાઈનાન્સ લિમિટેડ'' ના નામનો પેયેબલ એટ અ		
ગ્રાસ્ટ/ પંચાકર અસક ફાઇનાન્સાલાયટક ના નાયના પંચબલ અટઅ એસકે ફાઈનાન્સ લિમિટેક, કે.પી. એપીટોય, બી બ્લોક, ૧૪મો માળ, ઓફીર		
અરાક ફાઇશાન્ટા (લામટક, ક.પા. અપોટામ, બા પ્લાક, ૧૪માં માળ, આફાર અમદાવાદ–3200૫૧ પાસે જમા કરાવવાનો રહેશે. આ કવર મોઠામાં મોઠા		
અમદાવાદ—૩૮૦૦૫૧ વાસ જમાં કરાવવાના રહેશ. આ કવર માઠામાં માઠા નીચે સહી કરનારને મોકલી આપવાનું રહેશે. મિલકતની હરાજી / બીર્ડીંગ		
નાચ સહા કરનારન માકલા આવવાનુ રહેશ. ામલકલના હરાજી / બાડાગ વાગ્યે કરવામાં આવશે. ઈચ્છુક બોલીકારો ત્યાં ઠાજર રઠીને તેમની બોલીમાં		
વાગ્ય કરવામાં આવશ. ઇચ્છુક બાલાકારા ત્યાં ફાજર રહ્યન તમના બાલામાં મંજર થતા તેના સકળ બોલીકારે (૧૦% ઈએમડી બાદ કરેલ રકમ) વેચાણ		
મજૂર થતા તેમાં સફળ બાલોકોર (૧૦% ઇઅમઠા બાદ કરલ ૨૪મ) પંચાણ રિવસમાં જમા કરાવવાની રહેશે. જેમાં નિષ્ફળ જતા બોલીકાર દ્વારા જમા કરાવે		
શરતો અને નિયમો : (૧) મિલકતનું વેચાણ કકત ''જેમ છે જ્યાં છે અને જેવી !		
કરવામાં આવશે. છતાંપણ અધિકૃત અધિકારીને જરૂર જણાય ત્યાં આ નિય		
ઉપરોક્ત પરિશિષ્ટમાં જણાવેલ બાંદેઘરીવાળી મિલકત વિશે અધિકૃત અધિકા		
તેમાં કોઈ રહી ગયેલ ભૂલ-ચૂક કે ખામી કે ખોટા વર્ણન માટે જવાબ આપવાને વ		
રીઝર્વ કિંમત કરતા ઓછી કિંમતમાં વેચવામાં આવશે નહીં અને તેની સૌથી		
અધિકૃત અધિકારી ઉંચી બોલી બોલનારની ઓફર કે બધી જ ઓફરો સ્વીકાર્ય કે		
છે. (૪) બોલીકારે તેનું બીડ જમા કરાવતી વખતે તેના ઓળખપત્રના ડોક્યુમે		
ફશે તો તે માટેના અધિકૃત પ્રમાણપત્ર / રીઝોલ્યુશન / પાવર ઓફ એટર્ની કોઈપણ સંજોગોમાં બોલીકારને બીડ પાછી ખેચવાની મંજરી આપવામાં આવશે		
કાઇપણ સગાગામાં ખાલાકારના બાંડ પાછા ખંચપાના મંજૂરા આવેપામાં આવે અધિકારી અન્ય બોલીકાર સાથે વાર્તાલાપ કરી કે પ્રાઇવેટ ટીટી દ્વારા મિલકત		
આયકારા અન્ય બાલાકાર સાથ વાલાલાવ કરા કે પ્રાઇવટ ટ્રોટ્રા બ્રાસા મલકત લીદ્યેલ મિલકતને લાગુ પડતા કાયદાકીય કન્વેયન્સ / ટ્રાન્સફર ખર્ચાઓ જેવા		
લાયલ ભલકતન લાગુ પડતા કાયદાકાય કન્પયન્સ / ટ્રાન્સફર ખયાઝા જપા જાતે ભોગવવાના રહેશે. (૮) સફળ બોલીકારે વેચાણ લીધેલ મિલકતને લાગ		
'કાલ ભાગપંપાના રહશ. (2) સફળ બાલાકાર પંચાણ લાયલ ામલકલન લાગુ મેન્ટેઈનન્સ ચાર્જીસ, વિજળી પાણીના ખર્ચા તેમજ અન્ય બાકી લ્હેણાં / વેરા		
गण्डणगण्डा या जात, मन मना मादाला जेवा तमर जाव जाता तिवा (मेदा / पत	in-it attended det.	(e) eider entrigie olicibit

એસકે ફાઈનાન્સ લિમિટેડ

(જુનું નામ – એસ કે ફીનકોર્પ લિમિટેડ) રજીસ્ટર્ડ ઓફીસ : જી ૧, જી ૨, ન્યુ માર્કેટ, ખસા કોઠી સર્કલ, જયપુર, રાજસ્થા

sk

્રા. પ્લા લા સફળ બાંલીકરે (102 ડીમેપલે લાટ સેવર કમાં) કેવાલા કિયા છે. પ્લાસ કમ વે પરિક એ બાંલી બાં પ્રવ સમ પ ક્યા પ્લા લા સફળ બાંલીકરે (102 ડીમેપલે લાટ સેવર સમ કમાં) કેવાલા કિયા વે પર સમ કે પર સિક એ બાંલી બાં પ્રર સમ પ ક્યા પંચા કરવાના રેસ્ટ્રો, 'માં નિષણ બાલ લાં પેલાર સાર પ્લા કમાં કપોલ બાલી પર સમ બેંદ સાર માં કરવાનો સારો, ' ક્યા પંચા બાલ (1) બાલ લાં પ્રચા કમ ' ' અને પાંચ કરવા કમાં કપોલ બાલ (1) રસમ બેંદ સાર માં કપાસે બાલ (1) કરવામાં અલગે, ભાંચ પાંચ બાલ કરવામાં આવે છે. આ બેંદ સાર માં કપાસ બાલ (1) રસમ બેંદ સાર માં કપાસ કપાસ બાલ (1) કરવામાં અલગે, ભાંચ પાંચ બાલ લાં પ્રચા બેંદ બાલ બાલ (1) બાલ (1)

સ્થળ : બનાસકાંઠા તારીખ : ૧૩.૦૧.૨૦૨૫

### <u> જિંદાલ વર્લ્ડવાઇડ લિમિટેડ</u> JINDAL

CIN : L17110G.1988PLC008942 રજીસ્ટર્ક અને કોર્પોરેટ ઓફિસ : "જિંદાલ લાઉસ", ડી-માટે સામે, IOC પેટ્રોલ પમ્પ લેન, વ્રેલરંખની - શ્રેષાલ ૧૩ રુ રી દે રો ડો, સેટેલાદર, અમદાવાદ-ડટ૦૦૧૫, ગુજરાત, ભારત. ૯: 079-71001500 • Email ld : csjinda@jindaltextiles.com • Website : www.jindaltextiles. પોસ્ટલ બેલેટ અને ઇ-વોટીગની સુચનાઓની નોટિસ

મંજૂરી માંગેલ છે.

ક્રમ નં.	વિશેષ વ્યસાચનું વર્ણન
એ)	કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના કેપિટલ ક્લોઝમાં અધિકૃત શેર મૂડીમાં વધારો અને પરિણામે ફેરફાર માટે વિચારણા કરવી અને મંજુર કરવા.
બી)	બોનસ ઇક્વિટી શેર જારી કરવા માટે વિચારણા કરવી અને મંજુર કરવા.

એમરીએના પરિપાગે અનુસાર, બેમનું ઘ-મેલ ઝેરેસ કંપની / આરટીએ / ડિપોગેટરી સહભાગીઓ સાહ્ ભગુઆરી ૧૦, ૨૦૨૧ (કટ-ગોર તાંચીનો)ના રોજ કામાંડનાજના કલાકો પૂર્ણ ચાલા તો સુધી પંચનીના સભ્યેના રસુસ્ટરમાં તેઓને ઘમેકાલ્ક્રી હહેટાંનિક રીતે નોટિસની વ્યાનગી ભગ્યુઆરી ૧૬,૨૦૨૫ સુધીમાં ઘ-વોટિંગ માટેનો પ્રક્રિયા અને સુસ્નાઓ સાહિતની પોસ્ટલ બેલેટની નોટિસ મોકલાશે. ઉપરાંત કંપનીની વેબસાયટ <u>અપ્ર્ય્યાતેવોક્ષાલાક.com</u> COSL બે વેબસાટ <u>અપ્યત્ય-બાળાતોવાટ</u> વાળ અને સ્ટોક એક્સવેન્ડની વેબસાયટ www.bisedia.com અને <u>અપ્યત્ય અપ્યત્ય બેલ</u> હોવા છે. પ્યાં પ્રક્રાય કેલ્ડ પ્રેટસ્ટ પ્રિપેક્ટ બ્રિસિટન પ્રેટસાય કોર્ય આ પોસ્ટલ બેલેટ માટે નીટિસ સાથે પોસ્ટલ બેલેટ ફોર્મની હડે કોપી અને સેલ્ફ એફ્સક પ્રિપેક્ટ પ્રિયક્ય હતા દિવર્ડ મુકે છે. આ પ્રેટલ બેલેટ માટે નીટિસ સાથે પોસ્ટલ બેલેટ ફોર્મની હડે કોપી અને સેલ્ફ એફ્સક પ્રિપેક્ટ પ્રિયક્ય હતાસાય પર બિડીય પ્રાંકલાએ નહિ.

ુત્રુ નાઝવાન માહ. કંપનીના રોરઘારકો રિમોટ ઇન્ટ્વોટિંગ પ્રક્તિયા મારકુલ જ મતદાન કરી શક્વો. તે માટે કંપનીએ શેરઘારકોને રિમોટ ઇન્ટ્વોટિંગ સુવિધા પુરી પાડવા માટે અધિકૃત એજબ્લી, સીડીએસએલને રોકીલ છે. પોસ્ટલ બેલેટ નોટિસમાં ચિત્રેટ ઇન્ટ્વોટિંગ માટેલો સુચનાઓ આપવામાં આવેલ છે. રિમોટ ઇન્ટ્વોટિંગ સુવિધા નીચેના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેવો :

છ-લોટિંગ શરૂ થવાનો સમય અને તારીખ : શુક્લાર, ૧૭મી બન્યુઆરી, ૨૦૨૫, સલારે ૦૯.૦૦ લાગ્યે (IST) છ-લોટિંગ સમાત થવાનો સમય અને તારીખ : શનિવાર, ૧૫મી કેબ્રુઆરી, ૨૦૨૫, સાંગે ૧૫.૦૦ લાગ્યે (IST) છ-લોટિંગ માટેની પાત્રતા માટેની કટ-ઓફ-તારીખ : શુકલાર, ૧૦મી બાન્યુઆરી, ૨૦૨૫

- વાદગ માટના પાસ્તા માટનો કર-એફ-તારીખ : શુકલાર, ૧૦ મી બન્લુઆરી, ૨૦૨૫ સીડીએસએલ દ્વારા શભિવાર, ૧૫મી ફેલ્યુઆરી, ૧૦૨૫, સોલે ૧૦૫,૦૦ વાગ્યા બાદ તરત જ બંધ કરી દેવાશે. જે ગે શેરારાએક પેના દ્વા-પેને એફ રાષ્ટ્રપ્રસ્ટર કરાવેલ અંગી તેઓને દિવાસી કરવાનો કે તેઓ તેમના ડિપોઝોટરી સલભાગીઓ દ્વારા ડિપોઝોટરીમાં ઘલેકટ્રોનિક સ્વચ્યે રાખેલ ચેરના સંબંધમાં અને ભીલિક સ્વચ્યમાં રાખવામાં આવે લા ચેરના સંદર્ભમાં આ રટીઓ નો તેની વે બસાઇટ https://wisdom.amenoindia.com પ્રસંધક કેવીએ આચાં investor@cameoindia.com પર વ-મેલ મોકલીને તેમનું ઘન્નેલ સરવામું નીધાવી શકે છે. ત્યારબાદ આ સભ્યને પોસ્ટલ બેલેટ માટે વ-તોટીગ સલમ કરવા માટે ચુપ્રસ્ટાયાડી અને પાસવર્ડ સાલે નોટોસની સોફર કોપી સાથે ઘ-વોટિંગ માટેની પ્રક્રિયા મળી શકે છે.
- સંસત્મ કરવા માટ વુઝરભાઇડા અન્મ પાલેવડ નાંન નાટાત્મના સાંક રાપા લામાં ઘ-ચાંદાને માંતના માંકના માની માંકી મંત્રી માંત્રી માટે માંત્ર માંત્ર માં માંત્રી માંકી માંત્રી સ્ટેલી પ્રાપ્ત કરવામાં આવા તે તે પ્રાપ્તી માંત્ર માંત્રી માંત્રી માંત્રી સ્ટેલી પ્રાપ્ત કરવામાં આવા તે તે પ્રાપ્તી સ્ટલા બહ્યું માંત્રી સ્ટેલી પ્રાપ્ત કરવામાં આવા તે વ્યાર સ્ટેલી પ્રાપ્ત કરવામાં આવા તે તે પ્રાપ્તી માંત્ર માંત્રી માંત્ર પ્રાપ્તી સ્ટેલી પ્રાપ્ત કરવામાં આવા તે પ્રાપ્તી સ્ટેલી પ્રાપ્ત કરવામાં આવા તે પ્રાપ્તી સ્વાર્થ માંત્ર પ્રાપ્ત કરવામાં આવા તે તે પ્રાપ્તી સ્ટેલી પ્રાપ્ત કરવામાં આવા તે પ્રાપ્ત કરવામાં આવા તે માંત્ર પ્રાપ્ત કરવામાં આવા તે માંત્ર કરવામાં આવા તે માંત્ર પ્રાપ્ત કરવામાં આવા તે પ્રાપ્ત કરવામાં આવા તે માંત્ર કરવામાં આવા તે માં પ્રાપ્ત કરવામાં પ્રાપ્ત વાર્ગ માં માંત્ર કરવામાં આવા તે માં પ્રાપ્ત કરવામાં આવા તે માં પ્રાપ્ત કરવામાં પ્રાપ્ત કરવામાં આવ્ય તે માં પ્રાપ્ત કરવામાં પ્રાપ્ત કરવા માં પ્રાપ્ત કરવામાં પ્રાપ્ત કરવા માં પ્રાપ્ત કરવામાં પ્રાપ્ત કરવા માં પ્રાપ્ત કરવા આવ્ય પ્રાપ્ત પ્રાપ્ત કરવામાં પ્રાપ્ત કરવા આવ્ય પ્રાપ્ત કરવા માં પ્રાપ્ત કરવા માં પ્રાપ્ત કરવા માં પ્રાપ્ત કરવા પ્રાપ્ત પ્રાપ્ત કરવામાં આવે પ્રાપ્ત સ્ટાપ્ર પ્રાપ્ત કરવા સ્ટાપ્ત સ્વાપ્ત સ્ટાપ્ત કરવા માં સ્ટાપ્ત સ્ટાપ્ર સ્ટાપ્ર સ્ટાપ્ત સ્ટાપ્ય સ્ટાપ્ત સ્ટાપ્ત સ્ટાપ્ત સ્ટાપ્ત સ્ટાપ્ત સ્ટાપ્ય સ્ટાપ્ત સ્ટાપ્ય સ્ટાપ્ય સ્ટાપ્ય સ્ટાપ્ર સ્ટાપ્ય સ્ટાપ્ત સ્ટાપ્ય સ્ટાપ્ત સ્ટાપ્ત સ્ટાપ્ય સ્ટાર સ્ટાપ્ય સ્ટાપ્ય સ્ટાપ્ય સ્ટાપ્ય સ્
- જાટ કે સ્ટામાં આવશ. કેટલાસ્કોને તેમના બામ, પોસ્ટલ એડ્સ, ઇ-મેલ સરનામું, ટેલીકોન / મોબાઇલ નં., પરમેનેન્ટ એકાઉંન્ટ નં. (PAN), આરેલો, નામાંકન, પાવર ઓફ એટની વગેરે સંબંધિત કે સ્ટાનો, બે કોઇ લોતો, અપરેટ કટવા વિનંતી, સાને તેમને બેક ડીટેલાન લેવી કે બેંકનું નામ, ગાખાની વિગ્રત,) ખાતાં નંગર, IFSC કોડ, MICR કોડ, તગેરે પોસ્ટલ બેહેટ નોટોસમાં દર્શાવેલ બ્રદ્ધવિ અને મોડ્સને અનુસરીને અપડેટ કરવા ലപ്പി
- રિમોટ ઘલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનનાં સંદર્ભમાં કોઇપણ પ્રશ્ન / ફરિયાદ હોય તો તેઓ ારબાટ ઇલકદુવાળાંક માસ્યમંચ મંતદાળાળાં સદામમાં કોઇપણ પ્રશ્ન / સારવાદ હોય તો તળાં csjindal@jindaltextiles.com/investor@cameoindia.com/helpdesk.evoting@cdsl.com \_\_uર તેમના સ્પુસ્ટર્ડ ધ-મેલ આઇડી પરથી તેમના નામ અને સુનેલીઓ નંબર/ ડીમેટ ખાતા નંબરનો ઉલ્લેખ કરીને લખી શકે છે અથવા "www.evotingindia.com" પર ઉપલબ્ધ ઇ--વોટીંગ મેન્ચુઅલમાં ના (FAQs')નો સંદર્ભ લેવો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી

જીંદાલ વર્લ્ડવાઇડ લિમીટેડ માટે સહી/ અમિત અગવા

વાદાસ-રોરમેન સાને મેનેજાંગ ડિરેન્ટ DIN : 00169061

સ્થળ ઃ અમદાવાદ તારીખ ઃ ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૫

### WWW.INDIANEXPRESS.COM THE INDIAN EXPRESS, THURSDAY, NOVEMBER 14, 2024



### PROCLAMATION REQUIRING THE APPEARANCE OF ACCUSED PERSON

(SEE SECTION 82 Cr.P.C.)

USEE SECTION 82 Cr.P.C.) Whereas compatin has been made before ms that accused person(s) Kiran Kumar Jethabhal Chaudhary, Prop. of Ms Hanuman Agro Centre, Shop No. 41, Popedry No. 28, 128 Railway Stop Road, Vill. & Teh. Dopdar, Dist. Banaskantha, Gujaral-38350 has committed (or Is suspected to have committed) the offence in Case Reg. No. 2816/2020 US 138 NI Act, PS Model Herupon Issued that the said accused person(s) Kiran Kumar Jethabhal Chaudhary has absconded (or is concealing himsel to avaid the served of the said accused person(s) Kiran Kumar Jethabhal Chaudhary has absconded (or is concealing himsel to avaid the served of the said accused person(s) Act, PS Model the served of the said accused person(s) Jethabhal Chaudhary of Case Reg. No. 2816/2020 Us 138 NI Act, PS Model Town, Delhi Sreguride to appear before the sourt of answer the said compaind on or before dated 24.01.2025 Delay Content Server By Order Himanshu Sehloth

DP/14928/NW/2024 (Court Matter)

### No. Q-15014/01/2023-CPA

Government of India of Environment, Forest & Climate Change 2nd floor, Jal Wing, Indira Paryavaran Bhawan, Jor Bagh Road, New Delhi

Subject: Appointment of one (1) Full-time Member (Technica) in the Commission for Air Quality Management in NCR and Adjoining Areas -reg.

Adjoining Areas -reg. Applications are invited from eighble candidates for selection an appointment of one (1) Full-time Member (Technical) to the Confinision for Air Quality Management in NCR and Adjoining Areas. Eddli. 2. The commission for Air Quality Management in NCR and Adjoining Areas (CAQM) is a Statutory Body established under the Confinision for Quality Management in National Capital Region and Adjoining Areas Act, 2021 (2) of 2021). The Member shall be a full disrip/incumbent. The detailed advertisement is available on the website of the Ministry https://moef.gov.in and website of the CAQM at https://caqm.nic.in SA/

(Ved Prakash Mishra Joint Secretary to the Government of Indi CBC 13101/11/0008/2425

Ld. JMFC-03, Court No. 213 (North) Rohini Courts, Dehi

# Government of Gujarat N.W.R.W.S AND K.DEPT.

Government of Gujarat NVR.WS AND KDEPT. Executive Engineer, Irrigidom Mechanical Division No. 6, Jilla seva stadar.2, Rase. course Road, Rajkot – 380001 Phone No. 2021.4246220) IDENTIFICATION CONTRACTION CONTRACTION OF A State Contraction in SDD. of Gujarat state. Online Autorea are invited for Collowing works in SDD. of Gujarat state. Online Autorea are invited for Collowing works with the Government of Gujarat In Ammada, Yataer of Contractions with the Government of Gujarat In Ammada, Yataer (Contractions Arms assemb), Sammadia, Patrice Markan, Samparating Contractions Arms assemb, Sammada, Sammada, Sammada, Yataer Resources, Water Supply and Kalgear Department or R & B Depart. of Gujarat state. (I) Name of work-. Dismantian, Providing, Fabricating & Errecting Various Component such as Gate Leaf assembly with various approach ladders. Arms assembly, Sammada, Water Resources & pin, Trunion assembly, New SS Cladding plate & New Safey railing at anchor girder book, New SS Cladding plate & New Safey railing at anchor girder box, New SS Cladding plate & New Safey railing at anchor girder box, New SS Cladding plate & New Safey railing at anchor girder box, New SS Cladding plate & New Safey railing at anchor girder box, New SS Cladding plate & New Safey railing at 2000 rist at the office of the superintending engineer irrigizion Schwitzy, Gandhingar, (I) Estimate cost: Rs. 1024,877,50°; (I) A Philder Enginetyricki). And Addl Safe Safey and Nather Resources, Nater Supply and kalgaar department, Block Nos, 4th Floorr, New Sachivsky, Gandhingar, (I) Estimate cost: Rs. 1024,877,80°; (I) A Philder Enginetyricki). And Addl Safe Safey and Safey Resources, Nater Supply and kalgaar department, Block Nos, 4th Floorr, New Sachivsky, Gandbingaar, (I) Latte Horifice of the Aste Resources Raider 2000; (Floors No.-623/21622024) to 16-90 Nnr. 41200; Hist the office of the set office no.2517,81200; Jo 16-90 Nnr.2523/212020; Jo 16-90 Nnr.2523/21200; Jo 16-90 Nnr.2523/21200; Jo 16-90 Nnr.2523/21200; Jo 16-90 Nnr.2523/21200; Jo 16-90 N and www.statetenders.gujarat.gov.in (8) Any kind of amendments will be published only on online & will be final & binding to all.





Indicative Notice for Direct Recruitment in RailTel orporation- Vacancy Notice No. RCIL/2024/P&A/44/63 RailTel Corporation of India Limited, a Navratna Public Sector Undertaking under Government of India, invites applications from Indian Citizens for the following three no. of vacancies in General Administration (CS and Legal)

Department: Assistant Manager/Legal (E-0 Level) (2 vacancies) CTC (approx.) - Rs. 9 Lakh + PRP

: CTC (approx.)- Rs.9 Lakh + PRP Assistant Company Secretary (E-1 Level) (1 vacancy): CTC (approx.)- Rs.12 Lakh + PRP The applications in prescribed proforms should reach that office by post latest by 06.12.2024. The dataled notice and application form for the above vacancy notice may be accessed on RaiTel's website https://www.raitel.in/careers.html under 'current job openings' section. So powed Decared Macancell

Sr. Deputy General Manager/HR

Dakshin Gujarat Vij Company Limited Bardoli Division 66 kV SS Compound, Surat-Bardoli Road, Bardoli 394 601 DGVCL Toll Free No. 19123 (or 1800 233 3003)

DOVCL Toti Free No. 1912 (or 1800 233 3003)
 Tenders (nos. 65 to 78) are invited from registered immiparties for sopply of various types material for TRU. LV brass & bushing aluminum whenground XLPE cable (1958 as mm XLPE to be supplied by DOVCL) with cable one to thermation & straight through jointing kit (to be supplied by contractor) and fault finding. FRP fencing, transformer maintenance, hinning of crans and tower ladder vehicle. supply is maintenance of computer & printer's at various sub-divisions under Bardoll Division jurisdiction. For further details, jaces wilk www. Procence and EE (OSM), Bardoll Division, 20VCL. Lessell MCIF ELCER RCCE & Fareward Lenning Accenter A scientification.

Regd, office of the Andheri East, Mu the mentioned as holder(s) of the s has claim in resp company at its re will proceed to is	mbal 400 scurities aid secu pect of the gistered	0099, Notice of the comp rities have a ne said secu office within	is hereby giv any has bee pplied to the rities should 15 days from	en that the ce n lost / mispl Company. An lodge such c this date else	rtificate(s) fo aced and th y person wh laim with th the compan
Name of the Holder	Distinctive Nos.	Certificate No.			
Hashumatiben Mahendrabhai Shah Sneha Mahendrabhai Shah Sujata Snehai Shah	HLL 272 9621	Equity Rs 1/	450	876064381 to 876064830	5149209
			450		

CHARTERED LOGISTICS LIMITED CN: L7440GJ196PLC026551 REDG.OFF.: B-501, Stellar, Opp. Arisa, Sindhu Bhavan Road, Timled, Ahmedabad, Gujaral-380059. CN: L74140GJ1995PLC026351 REDG.OFF.: B-501, Stellar, Opp. Arista, Sindhu Bhavan Road, Thaltej, Ahmedabad, Gujarat-380059. Tal: 170-26991750 E-melli e-Stellard on in Medicine June Industry of an in

		Quarte	r ended	Half Year ended	(ব in Lakh Year Ender
Sr. No.	Particulars	30/09/2024	30/09/2023	30/09/2024	31/03/2024
140.		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations (net)/Revenue	1663.55	1724.65	3914_29	7364.75
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	36.92	-8.20	188,80	18,98
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	36.92	-8.20	188.80	18,98
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	30,92	-8,20	160,80	66,73
5	Total Comprehensive Income (Comprising profit (loss) after tax and Other Comprehensive Income after tax)	30,92	-8,20	160,80	67,70
6	Equity Share Capital	993.40	993.40	993.40	993,40
7	Reserve (excluding revaluation Reserve) as shown in the Audited balance sheet of the previous year	•	•	-	
8	Earnings Per Share (of Re. 1/each) (not annualised)		-		
	a. Basic:	0.03	-0.01	0.16	0.07
	b. Diluted:	0.03	0.01	0.16	0.07

Note: 1, The above is an netract of the detailed forms of unualitied faceoid results for the quarter and half year endot 6 years 30, 2024 field with the Sock Exchance under Kengdation 33 of the SCHAB (Linking and Other Linkipurve Requirements Regal 2015, The full format of the same are available on the BSE Linkips and Other Detaigurve Requirements Regal Statistical 30, 2024 is and the transmission analodis financial results of the Comparison for the quarter and fall year Statistical 30, 2024 is and the transmission analodis financial results of the comparison of the same are not fall year Statistical 30, 2024 is and here relevant by an Acutif Committee at its meeting held on Network 13, 2024 and and year Statistical 90, 2024 is and beam relevant by an Acutif Committee at its meeting held on Network 13, 2024 and other reconstructions Accounting Standards Reduce 216 pt Adv. 2016 pt Adv. 2016

For and on behalf of the Board of Directors, For Chartered Logistics-Limited, Lalit Kumar Gandhi Managing Director DIN :00618427

Date : November 13, 2024

### JINDAL WORLDWIDE LIMITED JINDAL

 SINDAL WORLDWIDE LIMITED
 Clis: L17110GJ1986PLC008942
 Colis: L18110GJ1986PLC008942
 Colis: L18110GJ1986PLC00894
 Colis: L18110GJ1986PLC0089
 Colis: L18110GJ1986PLC00894
 Colis: L18110GJ1986PLC00894
 Colis: L18110GJ1986PLC00894
 Colis: L18110GJ1986PLC0089
 Colis: L18110GJ198
 Colis: L18110GJ198
 Colis: L18110GJ198
 Colis: L18110GJ198
 Colis: L18110GJ198
 Col Year Ended Year Ended Previous Financia Y. Year ended 23 31" March, 2024 STANDALO 56758.92 51536.56 Total income from operations (ne Net Profit / (Loss) for the perior (before Tax, Exceptional and / or Extraordinary items) 40019.89 108295.48 81856.19 185935.50 2343.2 2327.2 1525.7 3436 2 or Extraordinary Items) Net Profit / (Loss) for the perit before tax (after Exceptional and / or Extraordinary Items). Net Profit / (Loss) for the perit after tax (after exceptional and / or Extraordinary Items) Total Comprehensive income for 2343 22 4670 44 9 528 9 3436.2 1746.6 1217,90 3489.3 7,002.9 and / or Extraordinary items) 5. Total Comprehensive income for the period after share of condit after associates and mixinfly far the period (after tax) and other Comprehensive income (after tax) for the period (after tax) and other Comprehensive income (after tax) 6. Eculity Share Capital 7. Reserves (acculding Revaluation) 6. Eculity Share Capital 7. Reserves (acculding Revaluation) 7. Reserves (acculding Revaluation) 7. Reserves (acculding Revaluation Audited Balance Sheet as at Previous Financial Year ended 31. March 2004 (of Re 1- each filt) for continuing operations) 1. Bate : 2. Dikited 1746.65 1217.90 3489.30 2571.3 6 748 6 1742 6 2005.20 2005.20 2005.20 2005.20 59042.96

0,8 3,4 1.28 ONSOLID/

82.52 105823.69 80252.95 1,81,408.90 . Total income from operations (net) 57080.62 Net Profit / (Loss) for the period (before Tax Exceptional and / o Extraordinary items) 2445,9 4805.2 3556,8 Extraordinary items)
 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)
 Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary items) 2359.31 2445.9 1626.24 4805.23 3556.8 1733.56 1275.51 1806.30 7564.7 2644.8

Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1733.56	1806,30	1275.51	3539.86	2644.80	7310,45
Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended						69902.05

above Un-Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter an year ended on 30° September, 2024 have been reviewed & recommended by the Audit Committed approved by the Board of Directors at their respective meetings held on Wednesday, 13° November The ha**i**f

2024. The Status of the Corea to intercus at a time tespectre treating induct interview of the above Standalone & Consolidated Un-Audited Financial Results of the Company for the quarter and half year ended on 30° September, 2024 in terms of Regulation 33 of the SEI (LORD) Regulations, 2015 and have issued a Limited Review Report Thereon, Bandardis Placet, 2016 (Ind S) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices & policies to the extent applicable and disclose the information regulated to be disclosed interms of Regulation 33 of the SEI (LORD) Regulations, 2015 (as an other recognised accounting practices & policies to the extent applicable and disclose the information regulated to be disclosed in terms of Regulations 33 of the SEI (LORD) Regulations, 2015 (as another and the segment in accounting practices & policies to the extent applicable and disclose the information regulated to be disclosed in terms of Regulations 30 of the SEI (LORD) Regulations, 2015 (as another accounting practices & policies to the extent applicable and disclose the information regulated to disclosed and counting the 30 Operating Segment therefore segment reporting as defined in the AS 10% is not applicable for the Standalprine Financial Results for the Compatils, Segment Anadets Labellities.

IBD Active to the third opportunity of the mean of Consolidated Segment Revenue, Results, Segment Assets and Labilities. The Burres for the corresponding previous periods have been restated/regrouped wherever necessary, to make them comparable, The Burres for the corresponding previous periods have been restated/regrouped wherever necessary, to make them comparable, The Burres for quarter ended on 30° September, 2024 forming part of the statement of Un-Audited Standsbare & Consolidated Financial Rever to the statement figure between the un-audited figures in respect of the half year ended on 30° September, 2024 and the published figures up to the first Standsbare & Consolidated Financial Rever, 2024, which were subject to limited review by the Statements of Case How, 2016, Standabare & Consolidated Financial Results are also available on the website of the band on the website of the advecting of Statements of Case Standabare & Consolidated Financial Results are also available on the website of the advecting of the case and case and case and case are also available. Statement of Un-audited Standabare & Consolidated Financial Results are also available on the website of the company (www.jindatextiles.com), JINOAL WORL MOVEL UNITEd UNITED (UNITED (UNIT

Date : 13" November, 2024 Riace : Ahmedabad

For and On Behalf of the Board JINDAL WORLDWIDE LIMITED

Sd-AMIT AGRAWAL Vice Chairman & Managing Director DIN : 00169961

GNFC	GNFC A After Ta 217 croi 30.09.202	res fo	ces Rs. the Seco or Half	102 ond ( Yea	crores Quarter,	<u>TORIAL</u> Profit & Rs. d on
Gandhinaga	ar.	13th	Durina	the	quarter	under

Gandhinagar, 13th November, 2024, a meeting of the Board of Directors was held today to consider and approve the Unaudited Financial Results for Q-2 / H-1 FY 2024-25.

### review, prices of major inputs remain stable except coal. Production at Dahej complex has resumed at full capacity effective October-2024

5

Shri Pankaj Joshi, IAS, On a YTD basis, fertilizer Managing Director, GNFC, segment results improved mentioned that there has due to higher valume in been mixed sales pattern Neem Urea, reduced input in fertilizer calles improved an article for the sale of the sale sale sale sale and the sale of the sale Managing Director, GNFC, mentioned that there has been mixed sales pattern i.e. fertilizer sales improved cost in complex fertilizer and whereas chemicals sales was to be held back mainly Lower fixed costs in both the fertilizers. due to annual turn around at TDI Dahej plant.

Chemicals in general has been facing realisation pressure impacting both the revenue as well as operating profit. Due to a product our biotection of good combination of products, the company has remained resilient to such remained resilient to such external market conditions which should, going forward, improve the overall results by increase in volume as well as better than before price

realisations.

witnessed the impact due to longer annual turn around of Top Dahej complex which had its ripple impact on upstream production like CNA. Cumulatively, thus, operating profit remained lower to that extent.

With Dahej Complex now producing at full capacity coupled with stable Bharuch operations, the company expects to have better performance over next few quarters of FY 24-25.

### SURAT TRADE AND MERCANTILE LIMITED

(Formerly known as Surat Textile Mills Limited) Regd. Office: Tulis Knya Arada, 6th Floor, Near Ad Mata Chowk, Puna-Kumubhada Road,Dumbhad,Surat 395010 CIN: L1791943PLC000214; Wetsite: www.smulin, e-mail: sharedspantment@smulin Tel/No.(20261) 2311198 EXTRACT OF UNADUTED FINANCALL RESULTS FOR THE QUARTER AND

r u	NAUDITE	FINANC	AL RESUL	ISFOR	INE QU	JARIE

Sr. No.	Particulars	Quarter ended 30.09.2024 (Unaudited)	Six Months ended 30.09.2024 (Unaudited)	Corresponding Quarter ended 30.09.2023 (Unaudited)
1	Total Income from Operations	2993.70	5983.84	2116.03
2	Net Profit for the period			
	(before tax and exceptional items)	424.07	1028.79	269.29
3	Net Profit for the period before tax			
	(after exceptional items)	424.07	1028.79	269.29
4	Net Profit / (Loss) for the period after tax			
	(after exceptional items)	404.74	965.01	183.88
5	Total Comprehensive Income for the period			
	(Comprising Profit for the period (after tax)	0000000	100000000	10000000
-	and Other Comprehensive Income (after tax))	404.74	965.01	183.88
6	Paid-up Equity Share Capital			
	(Face Value of Rs.1/- each)	2220.64	2220.64	2220.64
7	Reserve excluding Revaluation Reserves as at			
	Balance Sheet date	722	-	
8	Earnings Per equity share (Not Annualised)			
	Basic (in Rs.)	0.18	0.43	0.08
	Diluted (in Rs.)	0.18	0.43	0.08

For and on behalf of the Board of Director For Surat Irade and Mercantile Limited Alok P. Shah Managing Director DIN: 00218180

### Mahalaxmi RubTech Limited CIN NO.: L25190GJ1991PLC01632; Regd. Office: 'Mahalaxmi House', YSL Avenue, Opp. Ketar Petro Pump, Połytechnic Road, Ambawadi, M. Ph. No.: 079 - 4000 8000. Email: cs@mahalaxmiarouc.net. Website: www.mrdobb adobad - 380 015. Guis

Date : 13/11/2024 Place: Surat

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024

			(₹in	Lacs, Except EF
		Quarter Ended	Half Year Ended	Quarter Ende
Sr. No.	Particulars	30.09.2024	30.09.2024	30.09.2023
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total income from operations (Net)	2414,58	4516.04	1962.9
2	Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and / or Extraordinary item #)	480.94	874.28	256.5
3	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional and / or Extraordinary Item #)	480.94	874.28	256.5
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional and / or Extraordinary Item #)	349.07	674.96	183.8
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax)]	351.94	680.70	184.1
6	Equity Share Capital (Face Value of ₹ 10/- each)	1062,03	1062,03	1062.0
7	Earnings Per Share			
, I	Basic:	3.29	6.36	1.
, I	Diluted:	3,29	6,36	1.

There was no Exceptional and / or Extraordinary Item during the Second Quarter and Half Year ended on September 30, 2024. tes:-

Interview in Coupling at an UC bacadratery semicancy is decold during an annum new index of sequence 33, 2014. See a shore is an activated of the databatery licenside Friender Real for the Second Quarter and HI there ended on Sequence 70, 2024, under Regulation 53 of the SEE BL (LODB) Regulations 2015, The III format of the Unautider Financial Results for the Second Quarter and HI there and door 2014, and a second box of the SEE BL (LODB) Regulations 2015, The III format of the Unautider Financial Results for the Second Quarter and HI there and endors and the Company's vestellate, or was not endors on the Second Quarter and HI there and endors and the Second Quarter and HI there and a group one by the Second Quarter and HI there are nedeved by the Audia Committee and approved by the Second QUART (China). The Instruction Financial Results in the Second Company's existella for the Second QUART (China). The Instruction Financial Results in the Second QUART (China). The Instruction Company Law Thindian, Amnetabada S, Social Branch, Court , vide Order dated QUART). (China). Li 2010;11917PL: CO15321 (China). China). China Company Law Theregold Company's is and Globale Tressile Limited. (MTI) (Chin). Li 2010;11917PL: CO15321 (China). China Company Law Theregold China China (China). The Scheme Excent edition is an Add (China). Scheme, by alline Companies. With the Respirater Company's is and Globale. Tessalis to the Scheme Varia (China). China China China China (China). China C

Financial Information for the Readual Undertailings of the Demenged Company, Persuant to the Shame, Mahadam Casch Phinals Limite and second the Subdiainy Company of MRILs and also Globali Tessile Private Limite has ceased to be the Subdiainy Company of MRT and that MRT does not have any Subdiainy Company, Accordingh, MRT Intervalide To Jumite And Unite Standaline Financial Results and the Consolidated Financial Results are not recursived to be prepared by the Company. Financial Information for Quarter ended 300/92/023 and Half Year ended 30:092/023 have been restated, pursuant to the Scheme as metalicitation of Information. To Institute comparison, figures of Realicual Undertailing of the Demenged Company of previous periods have been regrouped, installand transmarged, Mereirer mecassary.

To failling comparison, tiggrife or rest-aud Unsummany and Comparison of the Comparison of the Comparison of the Comparison (Comparison of Comparison of Comparison of Comparison of Comparison of Comparison (Comparison of Comparison of Compa

Managing Director (DIN: 00500328)

Place: Ahmedabad Date: November 13, 2024

3.73

Ahmedabad

g Revaluation in the Audited t Previous d				
(of Rs.1/- each) liscontinued c :	0.86	0.90	0.64	
ed	0.86	0.90	0.64	Г

8 (for continuing and operations) : 1. Bas

### કાયનાન્સિયલ એક્સપ્રેસ

		FHI (Personal Guarantor/ Debtor)
1. Name of the Personal Guaran		Utkarsh Malvik Hathi (PAN Number : AAXPH9535L )
2. Address of registered office / P / Residence of the Personal Gua	rincipal Office rantor (PG)	D-1, Janta Nagar Society, B/h. Ruturaj Complex, Vasna Road, Vadodara-390015.
<ol> <li>Details of the order admitting application</li> </ol>	the	Honble NCLT, Ahmedabad Court - I admitted the Insolvency Resolution Process against Utkarsh Mahik HathiPersonal Guarantor of Corporate Debtor (Miku Polymers and Plastics Limited) vide C.P. (IB)/233 (AHM)2022 (vide order dated Nov 8, 2024) (Copy received on Nov 12, 2024)
<ol> <li>Insolvency process commencer respect of Personal Guarantor un</li> </ol>		November 12, 2024
5. Name and registration nur Insolvency Professional Resolution Professional		
6. Address and e-mail of the Professional, as registered with		Add.: 210/B, 21st Century Business Centre, Nr. Udhna Darwaja, Ring Road, Surat- 395002. (Gujarat) Email id: kedia_kedia@yahoo.com
submission of claim	and for	Add.: 210/B, 21st Century Basiness Centre, Nr. Uchna Darweja, Ring Road, Surat-395002. Gujarat. Email id: kedia_kedia@yahoo.com ipsunilkedia@gmail.com
8. Last date for submission of cla		13th December 2024
9. Relevant Forms are available a		https://ibbi.gov.in/en/home/downloads
Order dated 08th November 2024 commencement of an Insolvenic Quarantor on 12th November 2024 The Creditors of Utkarsh Malvil on or before 13th December 2024 Insolvency and Bankruptcy Board to Corporate Debtors/ Regulation against entry No.7. The Creditors deletronic communications of clain	(Order receiver) (Conter receiver) (Conter the second of the second (Conter the second of the second of the second (Conter the second of the s	eby called upon to submit their claims with proof bed form "Form B" under Regulation 7(1) of the encry Resolution Process for Personal Guarantors e Resolution Professional address: mentioned their claims personal information by way of

Place : Ah Date : Nov

### ડોએચ્ચ બેંક - એઝ

પરિષિત-૫' (તિશ્વ + (૧૧) ક- ૦૧-૧૧ નો ટિસ્ટ જન વોચે સાંકે ક્યાર તે તે તેએવ પરં અંગ કળ ભાત ("લેંગ") માં અધિક ન વધિવી તરીકે સિક્યુરીટાઈ ગેલા ને ને ને રીકન્સ્ટ્રકાન ઓક કીના-તીયલ એસેટ્સ એન્-એન્ડોસીમેન્ટ ઓક સિક્યુરીટી ઈન્ટરેસ એક્ટ, ૨૦૦૨ ની કલ્મ ૧૩(૧૨) ને સિક્યુરીટી ઇન્ટેસ્ટ (અનેરોસેન્ટ) ટ્રાપ્સ ૨૦૦૨ સાંદે નિયમ ૨ વાંચવા મુજ્ય આપવામાં બોલેલ અધિકારો સુટેઇ નાશેમ ૧૮-૦૧-૨૦૪૪ ના રોજની સામ- નીટીસ જગ્લાથી કેની જન્સ વેનરે સેસ કેટી સામ દિબેચલના પ્રા. લિ. હન્સ્ટારા, કી બોલ્લે બાજવાથી કેની જન્સ વેનરે સેસ કેટી સામ દિબેચલના પ્રા. લિંગ્લ ૨૦૮ - (સંકે વિધા બાજવાથી કરી જન્સ વાંચે જ્યાલે ૨૨૪ માં ક્રમ ક્રામનાં પ્રેલ્લ અપ્રિયા છે. આ કે ક્યાર બાજ લાખ પંચોરોક લ્લાય અન્સ આસ્ત્રી સાવા દ્વાં અને સોવીચ પૈસા યુછા નેટીસ આવે છે અને સામપ્ય જનતાને સામ દારવા અને સામે ક્રાય કરતા બાજ હરવામાં આવા માં આવેલ અધિકારની દ્વંઅ ગય હોવાથી કરજારત ને માલ જાણ કરવામાં આવવામાં આવેલ અધિકારની દ્વંઅ રાય હોવાથી કરજારત ને માલ જાણ કરવામાં આવા માં આવેલ અધિકારની દ્વંઅ સારદ્વ કાયલની કલ્યા કાર 1 જે ની જે જ્યાલે વિલક્તનાં વચ્ચના કરળ સંત લી પેલ્લ ને સ્ટાર્ પરિશિષ્ટ-Ⅳ (નિયમ ૮(૧)) કબજા નોટિસ

ચિલકતનો સરવાતમાં કબ્પ્લે લાંધે લીધેલ છે. ખાસ કરીને કંસ્જકારને અને જાહેર જનતાને આધી ચેતવણી આપવામાં આવે છે કે, સદરહુ વિશ્વના સંપેધે કોઇપણ વ્યવસાર ગેલે નો કરવો નહિ અને સરંડ્યુ વિશ્વાસ સંબંધે કરવામાં આવેલ કોઇપણ વ્યવસાર ગેલે ના છા. ૨,૧૨૯,૫૮,૯૯,૨૪/ (અકે રૂચિવા છે ક્લેક વા લાળ પાંચીલ રહ્યા આ આ સાંચ સાવાણું અને ચોલીથ પૈસા પુરા ) અને તેના ઉપર વ્યવજા નાળે પોલેસ ને સાધીન રહેશે. અકસ્પારલે દ્વાંતા આ બોલિકામની કલા પા રહી પઠ કલમ (૮) નો સેગવાઇએ તેવર આમંત્રિત કરવામાં આવે છે ઉપરબ્ધરા સમાત્રા સંદર્ભમાં સિક્સો ઇ અરવામાંતે રિકમ કરવા માટે.

બામાત્રત કરવા માટે

સ્થાવર મિલકતનું વર્ણનઃ

સ્થાવર શિલ્કાન્તું વાર્કતા શિલ્કાન તો. ૧: ''એસિ સ.' દર ૦૧, સૌથો મળ, ૧૫૫ ચો.સૂટ (સુપટ વિલ્ટ અપ) મુનિયુવત નવરંગ્યુગા-નોન ટ્રેડિંગ ધોર્ચરાનના સામ તોડી ''અતિવાર ક્રોમપેસ્ટ' તરીકે ઓળપાઇ, જે સ્ટર્નિકકો કોમપેસ્ટેરિ તાઇવિંગ સોસાયટી વિભિટેન તો પરે-પ્લોટ પંચ ૨૮-મી, દર્ગલના દરેવા પ્રચિત્ર ગાંધીએક ૨૫ સાંચિયા આવેલ છે. મુંચે શેપપુર-બાપપુર, તાલુતો સાખરાતી, જિલ્લો અમદવાલ કર્મો નોયક્ષી પર જિલ્લો આમદાલાડ: (પ્રેમરા-ગાં ખારે સ્ટરા કર) વિખેશ ગુમાં પ્રચાર પ્રોચ છે. આમદાલાં સ્ટર્મ (માનગર) ખાતે સિલ્ધ, ગું ગેની સ્ટ્રાપ્રીય: સ્ટાંગ સેસ્ટ્રેસ પ્રિયમમાં સાંતરિક રોડ, ઉત્તરમાં ઓરિસ નાં પાટર, દલિવામાં સ્ટોચ કે સ્ટાંગ સ્ટેસ્ટ પ્રચાર બાદ કર્મો સેરબે કે ૨૫, ૯૨૨ મો, સી, સામેલર શીને પ્રાચિક સંચોરિયોસ્ટનના સામ તા તેરી દરિકર્ટ નં બર ૭૦ સ્ટેટ તાપર ૦૦-૨૦ ટેટ ગે ''જ-લાર'. '' તોડે સાંભાપણ સર પ્ર (સ્ટાપ્ટલ ''બર પ્રટર), દાર્કી પ્રચાર આવે તેરી અંગે તે નં રાટ કર પ્રચાર પ્રચાર કર્મ તો ક્રાયમાં સ્ટાય ને સ્ટ દર પર (સ્ટાપ્યુટ), સ્ટાયો માં સ્ટાય આવે સ્ટાયો પર સ્ટાય ને સ્ટર સ્ટ વેલ્ડ પ્રસ્ટ પ્રચાર પ્રચાર બાદ તેરા છે તે નં તે ટ્રાયસ્ટ), સ્ટારે સ્ટાય પ્રચાર પ્રચાર સ્ટાર (સ્ટાય), દાર્ટી સ્ટાય પ્રચ ક્રિય નં બેસ્ટ ર દર પ્ર (સ્ટાપ્ર), સ્ટાય કે સ્ટાય પ્રચ ક્રિય (સ્ટાર), તરીકે ઓળખાપા છે) જે સર્ચ નંબર દર સ્ટાય સાં સ્ટાય બાદ છે. તેમાં સ્ટાર દર્શ, દિવામાં સ્ટાયમાં કરે સ્ટાર આદિત્ર બાદ ક્રાય ના બ્લોટ, ઉત્તરમાં સ્ટાયી, દલિક્રમાં લિક્સ, બાદ ક્રાય્ય ના સ્ટાર્ક બાદ કરા છે નો સ્ટાય (સ્ટાય મારે કે સ્ટો સ્ટાય દર (દલિયા બાદ બાદસિક જ્યાલીલ), ભા સાં **લ્યુક્રીમાક્યાં** (સ્ટાર), તરીકે આંગળા છો જે સર્ચ નંગર સ્ટાય સાં પ્રચ બાદ કાર (પાયદાદ્રી) છે. **નેના લદ્યુક્રીમાક્યાં** (સાદ્ર) આદાર આતાલા કોએચ લંક એલ્ટ્રાલ્સ બાદ કોએચ લંક - એલ્ટ્ર) સ્ટાય : માન્મચ સ્ટાર (દલાર ક્રોપ્ર સ્ટાય સાર્કર), સ્ટાય સાંગર કરવા સાંગર કરવા કરા કરવા કરા કરો સ્ટર સાંગર કરોય સાર્ટ કરોય સાંગર કરોય સાંગર કરો કરો સાંગ કરાય સાંગર કરવા કરાય સાંગર કરોય સાંગર કરો સાંગર કરવા સાંગર કરો સાંગર કરાય સાંગર કરવા કરાય સાંગર કરાય સાંગર કરવા સાંગર કરો સાંગર કરોય સાંગર કરોય સાંગર કરોય સાંગ બાદ કરાય સાંગર કરાય સાંગર કરોય સાંગર કરોય સાંગ સાંગર કરોય સાંગ કરોય સાંગ કરાય સાંગર કરોય સાંગ કરોય સાંગર કરોય સાંગ કરોય સાંગર કરોય સાં

**U**ULTRACAB

arter Ended	4,418.79 74,418.48 67,246.84	khs except EP3 Year Ended March 31, 2024 (Audited) 1,07,165,70 8,031,35 6,007,55 6,902,96 4,418,79 67,266,147 67,246,84
2024 Unaudited) 22,190.06 (8,772.36) (8,772.36) (6,560.58) (6,566.84) 4,418.79 67,841.07 67,246.84	September 30, 2023 (Unaudited) 29,434.41 3,892.58 3,892.58 2,912.13 2,907.79 4,418.79 74,418.48 67,246.84	March 31, 2024 (Audited) 1,07,165,70 8,031,35 8,031,35 6,007,55 5,962,96 4,418,79 75,691,47
(8,772.36) (8,772.36) (6,560.58) (6,566.84) 4,418.79 67,841.07 67,246.84	3,892.58 3,892.58 2,912.13 2,907.79 4,418.79 74,418.48 67,246.84	8,031.35 8,031.35 6,007.55 5,982.96 4,418.79 75,691.47
(8,772.36) (6,560.58) (6,566.84) 4,418.79 67,841.07 67,246.84	3,892.58 2,912.13 2,907.79 4,418.79 74,418.48 67,246.84	8,031.35 6,007.55 5,982.96 4,418.79 75,691.47
(6,560.58) (6,566.84) 4,418.79 67,841.07 67,246.84	2,912.13 2,907.79 4,418.79 74,418.48 67,246.84	6,007.55 5,982.96 4,418.79 75,691.47
(6,566.84) 4,418.79 67,841.07 67,246.84	2,907.79 4,418.79 74,418.48 67,246.84	5,982.98 4,418.79 75,691.47
4,418.79 67,841.07 67,246.84	4,418.79 74,418.48 67,246.84	4,418.79 75,691.47
67,841.07 67,246.84	74,418.48 67,246.84	75,691.47
67,246.84	67,246.84	
		67 246 84
72.259.86		
	78,837.27	80,110.26
2,04,291.49	2,08,718,74	2,43,101.02
NIL	NIL	NIL
2.83	2.65	3.03
(14.85)	6.59	13.60
NIL	NIL	NIL
NIL	NIL	NIL
NA	NA	NA
NA	NA	NA
rd xo	NIL 2.83 (14.85) NIL NIL NA NA Iance with Ir k Exchange on the we com). ssures have	NIL         NIL           2.83         2.85           (14.85)         6.59           NIL         NIL           NIL         NIL           NA         NA           NA         NA

LENDINGKA₹T LENDINGKART FINANCE LIMITED CIN: U65910MH1996PLC258722 mber PS 40 and PS 41, 3rd Floor, Birla Centurion, Pandurang Budhkar Marg, Worli M

On behalf of the Board of Directors of Lendingkart Finance Limited

કશન ઓફ

### Harshvardhan Lunia Chairman & Managing Director DIN: 01189114

 توقع عالية متركز الله المعالية المعاملية ( 2014) المعاملة المعاملة المعاملة المحتولية ال ાખા, <u>ડિમાન્ડ નોટીસ</u> સિલ્પુરીટાઇઝેરાન એન્ડ રીકન્સ્ટૂકરાન એ ફાઇનાલ્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ m સિક્યુરીટી એક્ટ ૨૦૦૨ની કલમ ૧૩(૨) ટે कि ऑफ़ बड़ौदा Bank of Baroda

1. બેંદ્ર હાર અપાએ ભિગિલ વિરાજ સુવિધાઓ મંદ્ર કરેત હતી. ચેની મોટીસ આપ્યા લાગેમ સુવીમાં તેના લાકી રહેશાં મું પ્રકંત મેં સુવી છે લો ખાતો કરે છે લો ખાતે છે લ

ભુપ્રવાનું 'પૂર્વાને માર્ગેન, પશ્ચિમનાં ફોટેન તે. છે. (૦૦, ૧૦૦૧ મારા દારાપ્યત્ર વા ભાગ શાયર કારાપ્યને છુપ્રભુમાં સાથીનો માંદીલીનાં મિંદલ. તે ' ભુરાવતું 'પૂર્વાને માર્ગેન, પશ્ચિમનાં ફોટેન તે. છે. (૦૦, ૧૦૦૧ માંગ પ્રેલ અંગ ફોટે તે તે. ઉપર દાવિધાને માંદુલે અંગ કોરે તે તે છે. (૦૦, ૧૦૦૧ માંગ કોર્પ્સ અંગ કોર્પ્સ તે છે. ગાયર કારાપ્ય કાર્યું અંગ કોર્પ્સ તે છે. ગાય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કાર્યું અંગ કોર્પ્સ તે છે. ગાય કારાપ્ય કાર્પ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કાર્ય કાર્પ્ય કારાપ્ય કારા કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારાપ્ય કારા કાર્ય કાર્પ્ય કાર્ય કારાપ્ય કારા કાર્ય ક

આવો એને તેને છે. છે. - બોબાવું ને તેને છે. છે. - બોબાવું ને તેને છે. છે. - આપને સાવારાન્સું કે વેઓસ કારવા સુવિધાના નાણાંની પુકલાની ત્વા મારા પ્રયુત કે બોબાવું ને પ્રોતા છે. આપને સાવારા - આપને સાવારાન્સું કે વેઓસ કારવા સે લાગ અને પે પ્રકાર પ્રયુ સાવારા પ્રયુત કે બોબાવું મેટ્ટી બાબ વધા અને પ્રોતા ને આ નાંચ - પુરુષના કારાના તે તેવા ચાળ, તોના સબાય આવી મોટે છે. (આપના બેદા ને પ્રોતા મારા બોબાવું સાવે પ્રોતા ને આ નાંચ બાલ - બોબાવું ચાળાત્મતું કે વેઓસ કારવાની લગ્ભ 1.3 (૧૩) એ ઉપર પ્રાપ્યેલા વિખાની અભગણાના કરશે તો તે ઉપરોધના કારાના કલગ ૨૯ કેઠ હેતાની અપરાસ કરશો.

ટ. બલા બ કલાવગાનુ કાર્ય તેના બાકી ત્વેણાં સંદર્ભે માટે તારીખ : ૧૪.૧૦.૨૦૨૪ સ્થળ : ઈન્ફ્રોસીટી, ગાંધીનગર સહી/– વિક્રાંત શર્મા, ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી બેંક ઓફ બરોડા, ગાંધીનગર

_										
-	IINDAL JINI	DAL W	ORLD	WIDE I	LIMITI	ED				
CIN: L171105/1986PLC008942 Regd.& Corp. Office : "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad -380015										
	Regd.& Corp Pump Lane, Shivranian	i. Office : ". ii Shvamal	Jindal Hous 132 Ft Rin	se", Opp. Di a Road. Sa	nart, I.O.C. tellite. Ahm	Petrol edabad -38	0015			
	Phone: 079-71001500 • Emai	il ld: csjind	al@jindalte	xtiles.com	Website :	www.jindalt	extiles.com			
	STATEMENT OF STANDA	LONE & CO	NSOLIDATE	D UN-AUDIT	ED FINANCI	AL RESULTS				
	(AS PER SCHE For the Qu	arter & Hal	f Year Ende	d 30" Septer	nber, 2024	<i>''</i>				
	{Pursuant to Reg	gulation 47	1)(b) of SEE	II (LODR) Rej	ulations, 20 Re	15} In Lakhs c	xcept EPS)			
			Quarter End	ed	Half Yea		Year Ended			
		3 months	Preceding 3 months ended	Corr. 3 months	6 months	6 months	Previous Financial			
Sr. No.	Particulars	ended of C.Y.		ended in P.Y.	ended of C.Y.	ended of P.Y.	Year ended			
		30° Sept., 2024	30" June, 2024 (Un-Audited)	30" Sept., 2023 (Un-Audited)	30" Sept., 2024	30" Sept., 2023	31" March, 2024 (Audited)			
-			TANDALON		[[UII-Hudilled]	(on-Addited)	(Addited)			
1.	Total income from operations (net)	56758.92	51536.56	40019.89	108295.48	81856.19	185935.50			
2.	Net Profit / (Loss) for the period	2343.22	2327.22	1525.75	4670.44	3436.21	9,528.99			
	(before Tax , Exceptional and / or Extraordinary items)									
3.	Net Profit / (Loss) for the period	2343.22	2327.22	1525.75	4670.44	3436.21	9,528.99			
	before tax (after Exceptional and / or Extraordinary items).									
4.	Net Profit / (Loss) for the period	1746.65	1742.65	1217.90	3489.30	2571.30	7,002.94			
٦.	after tax (after exceptional and / or Extraordinary items)									
5.	Total Comprehensive income for	1746.65	1742.65	1217.90	3489.30	2571.30	6,748.61			
	the period after share of profit after associates and minority									
	interest (Comprising Profit / (Loss)									
	for the period (after tax) and other Comprehensive Income (after tax)]									
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20			
7.	Reserves (excludion Revaluation						69042.96			
	Reserve) as shown in the Audited Balance Sheet as at									
	Previous Financial Year ended									
8.	31" March 2024 Earnings per share (of Rs.1/- each)	0.87	0.87	0.61	1.74	1.28	3.49			
v.	(for continuing and discontinued	0.07	0.07	0.01	1.74	1.20	3.45			
-	operations) : 1. Basic : 2. Diluted	0.87	0.87	0.61	1.74	1.28	3.49			
	2. Diluted		ONSOLIDA		1.74	1.20	3.48			
1.	Total income from operations (net)	57080.62	48743.07		105823.69	80252.95	1,81,408.90			
2.	Net Profit / (Loss) for the period (before Tax Exceptional and / or	2359.31	2445.91	1626.24	4805.22	3556.80	10249.58			
	(before Tax Exceptional and / or Extraordinary items)									
3.	Net Profit / (Loss) for the period	2359.31	2445.91	1626.24	4805.22	3556.80	10249.58			
	before tax (after Exceptional									
4.	and / or Extraordinary items). Net Profit / (Loss) for the period	1733.56	1806.30	1275.51	3539.86	2644.80	7564 78			
7.	after tax (after exceptional									
5.	and / or Extraordinary items) Total Comprehensive income for	1733.56	1806.30	1275.51	3539.86	2644.80	7310.45			
			1000.30	12/5.51	3539.00	2044.00	7310.45			
0.	the period after share of profit									
0.	the period after share of profit after associates and minority									
0.	the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other									
	the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]									
6.	the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20			
	the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation		2005.20	2005.20	2005.20	2005.20	2005.20 69902.05			
6.	the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (ackluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous		2005.20	2005.20	2005.20	2005.20				
6.	the period after share of profit after associates and minority interest [Comprising Profit /(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audided Balance Sheet as at Previous Financial Year ended 31 <sup>4</sup> March 2024		2005.20	2005.20	2005.20	2005.20	69902.05			
6.	the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audiad Balance Sheet as at Previous Financial Year ended 31 <sup>th</sup> March 2024 Earnings per share (of Rs. 1/- each)		2005.20	2005.20	2005.20	2005.20				
6.	the period after share of profit after associates and minority interest [Comprising Profit /(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audided Balance Sheet as at Previous Financial Year ended 31 <sup>4</sup> March 2024	2005.20					69902.05			
6.	the period after share of profit after associates and minority interest (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive income (after tax)) Equity Share Capital Reserves (accluding Revaluation Reserve) as a shown in the Audide Balance Sheet as at Previous 31 <sup>1</sup> March 2024 Earnings per share (of Rs.14- each) Earnings per share (of Rs.14- each)	2005.20	0.90	0.64		1.32	69902.05			
6. 7. 8.	the period after share of profit after associates and minority interest [Comprising Profit (Loss) Comprehensive (Income (after tax)] Equity Share Capital Reserves (accutang Reinhulden Reserves) as shown in the Audiod Balance Sheet as it Previous Financial Year ended 31 <sup>1</sup> Match 2020 End (of IRs 11- each) End discount of the Sheet End Sheet End Sheet End Sheet End Sheet End Sheet 2. Diuted	0.86	0.90	0.64	1.77	1.32	69902.05 3.77 3.77			
6. 7. 8.	the period after share of profit after associates and minority interest [Comprising Profit (Loss) Comprehensive (Income (after tax)] Equity Share Capital Reserves (accutang Reinhulden Reserves) as shown in the Audiod Balance Sheet as it Previous Financial Year ended 31 <sup>1</sup> Match 2020 End (of IRs 11- each) End discount of the Sheet End Sheet End Sheet End Sheet End Sheet End Sheet 2. Diuted	0.86	0.90	0.64	1.77	1.32	69902.05 3.77 3.77			
6. 7. 8.	the period after share of profit after associates and minorfly, cost fart associates and minorfly, cost for the period (after tax) and other Comprehensive (none) (after tax) Equity Share Capital Reserves (accutang Revaluated Reserves) as shown in the Audided Bainnos Sheet as a Previous 31° Merch 2024 Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations): 1: Basic 2: Duning Hes 2: Duning Hes 2	2005.20 0.86 0.86 e & Consol	0.90 0.90 Idated Fina	0.64 0.64 ncial Results iewed & rec	1.77 1.77 of the Com	1.32 1.32 pany for the by the Audi	69902.05 3.77 3.77 quarter and t Committee			
6. 7. 8.	the period after share of profit after associates and miority interest [Comprising Profit (1.0es) (Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (arcuickong Reinkulacito Reserves (arcuickong Reinkulacito Reserves) as shown in the Audided Balance Sheet as at Previous Financial Year ended 31 <sup>4</sup> March 2022 (or continung associationad operations): 2 Dituted 49: 17 The above Un-Audited Standalon hard year ended on 30 <sup>5</sup> September and sproved by the Board of Dir 2024.	2005.20 0.86 0.86 e & Consol ar, 2024 ha actors at the	0.90 0.90 idated Fina ve been rev air respectiv	0.64 0.64 ncial Results riewed & rec re meetings	1.77 1.77 of the Com ommended neld on Weo	1.32 1.32 pany for the by the Audi inesday, 13	3.77 3.77 3.77 quarter and committee November,			
6. 7. 8.	the period after share of profit after associates and minorft, you after associates and minorft, you for the uperool (after tas) and other Comprehensive Innone (after tas) Equity Share Capital Reserves (accluding Revaluate Reserves (accluding Revaluate Reserves (accluding Revaluate Reserves (accluding Revaluate Reserves (accluding Revaluate Reserves) as shown in the Audiod Bainco Sheet as at Previous Part Capital Revaluates and acceleration of the Sheet Reserves (accluding Revaluates (for continuing and discontinued coperations): 1 Basic : 2. Dikited Et al: The above Un-Audited Standalon And year ended on 30° September and account of Dire Tas Statutor Auditors of the Co	2005.20 0.86 0.86 e & Consol ar, 2024 ha ectors at the	0.90 0.90 idated Fina ve been rev sir respectiv ve carried o	0.64 0.64 ncial Results riewed & rec re meetings out Limited	1.77 1.77 of the Com ommended held on Wec Review of th	1.32 1.32 pany for the by the Audi inesday, 13 ne above Si	3.77 3.77 quarter and Committee November, tandalone &			
6. 7. 8.	the period after share of profit after associates and minorft, you have still Coonryleing to an of other Coonryleines to an other coordinates and other Comprehensive Linoone (after taxit) Equity Share Capital Reserves (accutaling Revaluates Reserves) as shown in the Audied Baince Sheet as the Previous Franchild Year ended Emings per Henre of T8.11- each) (for continuing and discontinued ceparitions): 11- Basic : 2. Dikited Ets : The above Un-Audited Standalon hard year ended on 30° Septemb and sapproved by the Baerd of Dir The Statutory Auditors of the CO consolidated Un-Audited Finand September, 2020 in terms of Res.	2005.20 0.86 0.86 e & Consol ar, 2024 ha ectors at the	0.90 0.90 idated Fina ve been rev sir respectiv ve carried o	0.64 0.64 ncial Results riewed & rec re meetings out Limited	1.77 1.77 of the Com ommended held on Wec Review of th	1.32 1.32 pany for the by the Audi inesday, 13 ne above Si	3.77 3.77 quarter and Committee November, tandalone &			
6. 7. 8. 1. 2.	the period after share of profit after associates and minority, cost fart associates and minority, cost for the period (after tax) and other Comprehensive Incone (after tax) Equity Share Capital Reserves (accluding Revaluated Reserves (accluding Revaluated Reserves) as shown in the Audida Financial Year ended 31° March 2024 Earnings per share (of Rs. 1/- each) (for continuing and decontinued Committee) 2. Ditudei Les I: The above Un-Audited Standation half year ended on 30° Septembe and approved by the Board of Dir 2024. 2024 in terms of Re. 1/- September. 2024 in terms of Re. Limited Review Report thercon.	2005.20 0.86 0.86 e & Consol ar, 2024 ha actors at the ompany have al Results julation 33	0.90 0.90 idated Fina ve been reveir respectiv ve carried of the Com of the SEB	0.64 0.64 iewed & rec re meetings but Limited I pany for the I (LODR) Re	1.77 1.77 a of the Com ommended neld on Wec Review of ti quarter and egulations, 2	1.32 1.32 pany for the by the Audi Inesday, 13' ne above Si half year ei 2015 and ha	69902.05 3.77 3.77 quarter and t Committee November, landalone & nded on 30 <sup>th</sup> ave issued a			
6. 7. 8.	the period after share of profit after associates and minorft, use lafter associates and minorft, use factor associates and minorft, use for the period (after tax) and other Comprehensive (none) (after tax) Equity Share Capital Reserves (accutom Revaluated Reserves (accutom Revaluated Reserves) as shown in the Audids Baining Sheet as it Privious 311 March 2024 Earnings per share (cFRs.11- each) (for continuing and discontinued operations). <sup>-1</sup> Basic 2. Disting and approved by the Board of Dira 2024. In termica of Re- Stantomy Auditors of the CC Consolidated Un-Audited Financia Stantomy Auditors of the CC Consolidated Un-Audited Financia Standards, Puelos (21) forth 435.	2005.20 0.86 0.86 e & Consol rr, 2024 ha actors at the mpany havalal Results gulation 33 been prepar prescribec	0.90 0.90 idated Fina ve been rev eir respectiv ve carried of the Com of the SeB ared in accc under sec	0.64 0.64 ncial Result iewed & rec re meetings but Limited I pany for the I (LODR) Re ordance with tion 133 of the	1.77 1.77 to f the Com ommended reld on Wec Review of th guartier and guations, 2 the Compa	1.32 pany for the by the Audi inesday, 13' half year ei 2015 and ha nies (Indiar ies Act, 20'	69902.05 3.77 3.77 quarter and t Committee November, landalone & nded on 30 <sup>th</sup> we issued a Accounting 3 and other			
6. 7. 8.	the period after share d profit after associates and miorifty, osci interest [Comprising Profit (Loher Comprehensive Income (fafter tax)] Equity Share Capital Reserves (accutating Revenuted Reserves) as shown in the Audiod Balance Sheet as a Previous Financial Year ended 31 <sup>th</sup> Interh 2020; The show Un-Audited Standalon half year ended no 30° Septemb and yaperved by the Board of Din 2024. The Statutory Auditors of the Co Consolidated Un-Audited Financial Financial results and on 30° Septemb and suproved by the Board of Din 2024. United Review Report Intercon. The above financial results have Standards; Rulea, 2015 (Ind AS)	2005.20 0.86 0.86 e & Consol ar, 2024 ha actors at the mpany have all Results julation 33 been prepa prescribec & policies to	0.90 0.90 idated Fina ve been rev sir respectiv ve carried of of the Com of the SEB ared in accc 1 under sec t under sec	0.64 0.64 ncial Results fewed & rec re meetings but Limited I pany for the I (LODR) Re ordance with tion 133 of t applicable a	1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77	1.32 1.32 pany for the by the Audi inesday, 13' ne above Si half year ei 2015 and ha nies (Indiar nies Act, 201 the informat	69902.05 3.77 3.77 quarter and Committee November, landalone & nded on 30 <sup>th</sup> vie issued a Accounting 3 and other ion required			
6. 7. 8. 1. 2.	the period after share of profit after associates and minorft, you after associates and minorft, you for the spenol (after tas) and other Comprehensive Linone (after tas) Equity Share Capital Reserves (accluding Revaluation Reserves) as shown in the Audiot Bainces Sheet as et Previous 31 <sup>1</sup> March 2024 Earnings per hatter (of Rs.11- each) (for continuing and disonitinued operations): 1: Basic : 22. Diuted Es : 22. Diuted Es : 22. Diuted Standard Standalon half year ended on 30° Septembre 2024. The Statutory Auditors of the C2 Consolidated Un-Audited Standalon The Statutory Auditors of the C2 Consolidated Un-Audited Finand Septembre, 2024 in terms of Real Eurinitia Review Report Intereor. The above financial results have Standards Rules, 2015 ((m AS))	0.86 0.86 0.86 e & Consol er, 2024 ha actors at the mpany hav ala Results gulation 33 been prepa prescribec \$ policies tt ion 33 of the	0.90 0.90 idated Fina we been reveil in respectiv we carried of the Com of the Com of the SEB ared in accord under sect the extent e SEBI (LO	0.64 0.64 ncial Result iewed & rec e meetings sout Limited I pany for the ( LODR) Re ( LODR) Re ( LODR) Are applicable a DB Regulate	1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77	1.32 pany for the by the Audi Inesday, 13' half year ei 015 and he inies (Indiar ies Act, 201 the informat as amender	69902.05 3.77 3.77 quarter and Committee November, landalone & nded on 30° we issued a Accounting 3 and other ion required []).			
6. 7. 8. No 1. 2. 3.	the period after share of profit after associates and minorft, you after associates and minorft, you for the spenol (after tas) and other Comprehensive Linone (after tas) Equity Share Capital Reserves (activiting Revinauleon Reserves) as shown in the Audiot Baince Sheet as at Previous 31 <sup>1</sup> March 2024 Earnings per harder of Tas 1- each (for continuing and disontinued operations): 1- Basic : 22. Diuted <b>Es</b> : 10 - 2000 Es : 10 - 2000 Un-Audited Standalon hard year endor a 03 <sup>1</sup> September 2024 The Statutory Auditors of the C2 Consolidated Un-Audited Financi September, 2024 in terms of Regular Standards Rules, 2015 (for AS) Standards Rules, 2015 (for AS) Astational Association (for AS) Astational Association (for AS) Standards Rules, 2015 (for AS) Astational Association (for AS) Astational Association (for AS) Astational Astation (for AS)	0.86 0.86 0.86 0.86 0.86 0.86 0.86 0.86	0.90 0.90 idated Fina ve been reveir respectiv ve carried c of the Common of the SEB ared in accor Lunder sec Lunder sec	0.64 0.64 ncial Results iewed & rec re meetings but Limited aany for the (ILODR) Re- valance with tion 133 of f applicable a DR) Regulator applicable a DR) Regulator	1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77	1.32 pany for the by the Audi inesday, 13' ne above SI half year ei 2015 and he nies (Indian ies Act, 201 the information as amendec as only onit it reporting a	69902.05 3.77 3.77 quarter and Committee November, landalone & nded on 30° we issued a Accounting 3 and other ion required ). reportable s defined in			
6. 7. 8. No 1. 2. 3.	the period after share of profit after associates and minority, use lister associates and minority, use for the period (after tax) and other Comprehensive Lincome (after tax) Equity Share Capital Reserves (accluding Revaluated Reserves (accluding Revaluated Reserves) as shoren in the Audide Thinacial Year ended 31 <sup>th</sup> March 2024 Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued Coperitors): 1 abatic Coperitors): 2 Dataci 2 Dataci	0.86 0.86 0.86 0.86 0.86 0.86 0.86 0.86	0.90 0.90 idated Fina we been rev ir respectiv we carried of of the Com of the SEB ared in accc the extent e SEB (LO 0ged in bus rating Seg lone Financ	0.64 0.64 ncial Result iewed & rec e meetings but Limited I pany for the I (LODR) Re ordance with tion 133 of t applicable a DR) Regulatorial iness of Te ments' there ial Results	1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77	1.32 1.32 pany for the by the Audi Inesday, 13' he above SI half year ei 2015 and ha nies (Indiar ise Act, 201 the informat as amendeo as only on the reporting a pany. For C	69902.05     3.77     3.77     3.77     quarter and     Committee     November,     tandalone &     nded on 30 <sup>o</sup> vive issued a     Accounting     3 and other     ion required     ),     s reportable     ss defined in     onsolidated			
6. 7. 8. No 1. 2. 3.	the period after share of profit after associates and minorft, you after associates and minorft, you for the spenol (after tas) and other Comprehensive Linone (after tas) Equity Share Capital Reserves (activiting Revinauleon Reserves) as shown in the Audiot Baince Sheet as at Previous 31 <sup>1</sup> March 2024 Earnings per harder of Tas 1- each (for continuing and disontinued operations): 1- Basic : 22. Diuted <b>Es</b> : 10 - 2000 Es : 10 - 2000 Un-Audited Standalon hard year endor a 03 <sup>1</sup> September 2024 The Statutory Auditors of the C2 Consolidated Un-Audited Financi September, 2024 in terms of Regular Standards Rules, 2015 (for AS) Standards Rules, 2015 (for AS) Astational Association (for AS) Astational Association (for AS) Standards Rules, 2015 (for AS) Astational Association (for AS) Astational Association (for AS) Astational Astation (for AS)	0.86 0.86 0.86 0.86 0.86 0.86 0.86 0.86	0.90 0.90 idated Fina we been rev ir respectiv we carried of of the Com of the SEB ared in accc the extent e SEB (LO 0ged in bus rating Seg lone Financ	0.64 0.64 ncial Result iewed & rec e meetings but Limited I pany for the I (LODR) Re ordance with tion 133 of t applicable a DR) Regulatorial iness of Te ments' there ial Results	1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77	1.32 1.32 pany for the by the Audi Inesday, 13' he above SI half year ei 2015 and ha nies (Indiar ise Act, 201 the informat as amendeo as only on the reporting a pany. For C	69902.05     3.77     3.77     3.77     quarter and     Committee     November,     tandalone &     nded on 30 <sup>o</sup> vive issued a     Accounting     3 and other     ion required     ),     s reportable     ss defined in     onsolidated			
6. 7. 8. 1. 2. 3.	the period after share d profit after sexcelase and minority, use lafter sexcelase and minority, use for the period (after tax) and other Comprehensive Income (after tax) Faulty Share Capital Reserves (sexculand) Revaluated Reserves (sexculand) Revaluated Reserves (sexculand) Revaluated 31° March 2024 Earnings per antere (aft Rs. 11- each) operations) : 1. Basis : 2. Diluted Comprehensive Comparison (Comparison) 2. Diluted Comparison (Comparison) 2. Diluted Consolidated Un-Audited Standakon half year ended on 30° Septembe and approved by Board of Dir The above Un-Audited Standakon September, 2024 in terms of Reg Limited Revare Megort thereon. The above financial results have The Statuory Auditors of the Co Consolidated Un-Audited Financial September, 2024 in terms of Regula A standatore level, the Compa- segment in accordance with IncA tandashi carbon the Staten Limit Revare Mey terms Staten Tue States and the corresponding	2005.20 0.86 0.86 e & Consol or, 2024 ha actors at the mpany hava clors at the mpany hava clors at the mpany hava clores	0.90 0.90 idated Fina ve been rev pir respectiv ve carried c of the Com of the SEB ared in acco under sec the extent e SEB (LO ged in bus rrating Segr roone Finance solidated S	0.64 0.64 ncial Result iewed & rec re meetings but Limited I pany for the ut Limited I pany for the ( (LODR) Re ut Limited I papficable a DR) Regulat iness of Te nents' there ial Results egment Rev	1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77	1.32 pany for the by the Audi Inesday, 13' he above Si half year ei 2015 and he nries (Indiar iss Act, 20' the informat as amended as a a a amended as a a a a a a a a a a a a a a a a a a	G9902.05     G9902.05			
6. 7. 8. No 1. 2. 3. 4. 5.	the period after share of profit after associates and minorft, you after associates and minorft, you for the spenol (after tas) and other Comprehensive Linone (after tas) Equity Share Capital Reserves (activiting Revinauleon Reserves) as shown in the Audied Baince Sheet as et Previous 31 <sup>1</sup> March 2024 Earnings per hatter (of Ra.1- each) (for continuing and disontinued operations): 1: Basic : 22. Diuted Es : 22. Diuted Es : 22. Diuted Standard 10 <sup>2</sup> Statuty Auditors of the CC Consolidated Un-Audited Standalon hard year endo a 0 <sup>3</sup> September 2024. The Statuty Auditors of the CC Consolidated Un-Audited Financi Standards Rules, 2015 ((m AS) Standards) Rules, 2015 ((m AS) And Ard As) and and and the sement of the Statuty Auditors of the CC Consolidated Un-Audited Financi Standards Rules, 2015 ((m AS) Att Asidone level, the Compa segment in accordance with InAA Ind AS 108 is not applicable for 1 Financial Results, refer the Staten Labilities.	2005.20 0.86 0.86 0.86 0.86 0.86 0.86 0.86 0.8	0.90 0.90 idated Fina ve been reveal in respective carried of of the Common of the SEB ared in accc ared in accc the extent e SEBI (LO estent) segred in bus rating Segred in the set one Finance solidated S eeriods have	0.64 0.64 ncial Results iewed & rec e meetings but Limited I pany for the I (LODR) Re ordance with tion 133 of the Regulation 133 of the Regulation 133 of the Regulation 133 of the result there is all Results egment Rev a been resta	1.77 1.77	1.32 1.32 pany for the by the Audi Inesday, 13' ne above SI half year ei 2015 and he inies (Indiar ies Act, 20' the informat as amendec as only on as only on as only on the reporting a pany. For ts, Segmen ed whereve	69902.05 3.77 3.77 quarter and Committee November, tandalone & Accounting 3 and other ion required Proportable as defined in consolidated Assets and r necessary.			
6. 7. 8. 8. 1. 2. 3. 4. 5. 6.	the period after share of profit after associates and minorft, you after associates and minorft, you for the uperool (after tas) and other Comprehensive Linone (after tas) Equity Share Capital Reserves (accluding Revaluated Reserves (accluding Revaluated Reserves) as shown in the Audiold Balance Sheet as et Previous 11 March 2020 11 March 2020 12 Distant 12 March 2020 12 Distant 2020 12 Distan	2005.20 0.86 0.86 0.36 e & Consol er, 2024 ha actors at the morpany have prescribed \$ policies to sol of the sol of the s	0.90 0.90 0.90 Idated Fina ve been rev sir respectiv ve carried ( of the Com of the SEB ared in accc the extent e SEB (LO ged in bus grating Segr rotone Financ solidated S verices Finance services finance servi	0.64 0.64 0.64 0.64 0.64 0.65 0.65 0.65 0.65 0.65 0.65 0.65 0.65	1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77	1.32 1.32 pany for the by the Audi inseday, 137 half year ei 2015 and he nies (Indian ies Act, 201 the informat as anly on as only on as only on t reporting a pany. For C ts, Segmen ed whereve tatement of etween the	69902.05 3.77 3.77 3.77 quarter and Committee Kovember, iandalone & nded on 30° we issued a Accounting 3 and other ion required b, a reportable is defined in consolidated LAssets and r necessary. Un-Audited un-audited			
6. <u>6.</u> <u>7.</u> 8. <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u> <u>8.</u>	the period after share of profit after associates and minorft, you after associates and minorft, you for the uperool (after tas) and other Comprehensive Linone (after tas) Equity Share Capital Reserves (accluding Revaluated Reserves (accluding Revaluated Reserves) as shown in the Audiold Balance Sheet as et Previous 11 March 2020 11 March 2020 12 Distant 12 March 2020 12 Distant 2020 12 Distan	2005.20 0.86 0.86 0.36 e & Consol er, 2024 ha actors at the morpany have prescribed \$ policies to sol of the sol of the s	0.90 0.90 0.90 Idated Fina ve been rev sir respectiv ve carried ( of the Com of the SEB ared in accc the extent e SEB (LO ged in bus grating Segr rotone Financ solidated S verices Finance services finance servi	0.64 0.64 0.64 0.64 0.64 0.65 0.65 0.65 0.65 0.65 0.65 0.65 0.65	1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77 1.77	1.32 1.32 pany for the by the Audi inseday, 137 half year ei 2015 and he nies (Indian ies Act, 201 the informat as anly on as only on as only on t reporting a pany. For C ts, Segmen ed whereve tatement of etween the	69902.05 3.77 3.77 3.77 quarter and Committee Kovember, iandalone & nded on 30° we issued a Accounting 3 and other ion required b, a reportable is defined in consolidated LAssets and r necessary. Un-Audited un-audited			
6. 7. 8. No 2. 3. 4. 5. 6.	the period after share d profit after associates and minorft, use lafter associates and minorft, use factor associates and minorft, use factor associates and minorft, use for the period (after tax) and other Comprehensive Linone (after tax) Equity Share Capital Reserves (accution Revaluated Reserves (accution Revaluated Reserves) as shown in the Audids Baines Sheet as at Previous 311 Merch 2024 Earnings per share (cFR s.1-each (dr continuing and discontinued operations). <sup>1</sup> Basic 2. Disting and approved by the Board of Dira 2024. In terms of Regulation and approved by the Board of Dira 2024. The Shatubary Auditors of the Cc Consolidated Un-Audited Standards Auditation Lines (and Lines) and Standards Prude (and Lines) and Standards Reserves financial results have Standards Reute, 2015 (dn 43), recognised accounting practices is to be disclosed in terms of Regula At standardone level, the Corras Standards Reute, 2015 (dn 43). Financial Results, refer the State Liabilities.	2005.20 0.86 e. & Consolo e. & Consolo mpany hat al Results prescribes policies to policies to policies to policies to policies to policies to policies to policies to policies to previous p previous p p previous p p p previous p p p p p p p p p p p p p p p p p p p	0.90 0.90 idated Fina we been rev we been rev we been rev of the SEB ared in accc the extent e SEBI (Lo ged in bus rardin solidated S solidated S wereinds haw wereinds haw ember, 202 ements are the SeB (Lo Solidated S solidated S so	0.64 0.64 ncial Results iewed & rec re meetings Jut Limited I papy for the I (LODR) Re ordance with tion 133 of t applicable a DR) Regulation 133 of t applicable a to been resta 4 forming p the balance ber, 2024 are, 2024, while	1.77 1.77	1.32 pany for the by the Audi Inesday, 13' he above SI half year e 2015 and he construction of the iss Act, 201 the informata as amended as only one the entry of the samended as amended as a as amended as a as amended as a as a as a as a as a as a as a as	3.77     3.77     3.77     quarter and     Committee     November,     Inandalone &     Accounting     3 and other     iso required     Accounting     3 and other     iso required     Accounting     a necessary,     Un-Audited     Un-audited     un-audited     un-audited     upto the first			
6. 7. 8. No 2. 3. 4. 5. 6.	the period after share of profit after associates and minorft, you after associates and minorft, you for the uperool (after tas) and other Comprehensive Linone (after tas) Equity Share Capital Reserves (accluding Revaluated Reserves (accluding Revaluated Reserves) as shown in the Audiold Balance Sheet as et Previous 11 March 2020 11 March 2020 12 Distant 12 March 2020 12 Distant 2020 12 Distan	2005.20 0.86 e & Consolo 0.86 e & Consolo 0.86 e & Consolo 18 Results gulation 33 these prepare prescribes prescribes 5.08° Ope Prescribes 5.08° Ope the Standa 5.08° Ope the Standa 5.08° Ope the Standa 18 results 5.08° Ope the Standa 18 results 5.08° Ope the Standa 18 results 5.08° Ope the Standa 18 results 18	0.90 0.90 0.90 Idated Fina ve been reverse ve been reverse ve carried ( of the Comp of the SEB ared in accc under sec Under Sec Und	0.64 0.64 neial Result reiewed & rece re meetings put Limited I pany for the applicable a DR) Regulat any so the applicable a DR) Regulat aness of TE nearly the source of	1.777 1.7777 1.7777 1.7777 1.7777 1.7777 1.7777 1.7777 1.7777 1.7777 1.7777 1.	1.32 pany for the by the Audi Inseday, 13' ne above SI half year ei 2015 and ha nies (Indiar ies Act, 201 the informal as amendec as only one the pany for C the second the pany. For C the second the	G9902.05     G9902.05			

Statisments of case in-systemic and a consolicated or the advance of a consolicated or set of the advance of a consolicated or set of the advance of a consolicated or set of the advance For and On Behalf of the Boar JINDAL WORLDWIDE LIMITE

: 13" November, 2024 : Ahmedabad : 13" No

AMIT AGRA Vice Chairman & Managing Dire DIN : 00100

### TGB BANQUETS AND HOTELS LIMITED CIN: L55100GJ1999PLC036830

тGв THE GRAND BHAGWATTI Regd. Office : "The Grand Bhagwati", Plot No. 380, S.G. Road, Bodakdev, Ahmedabad - 380054 E-mail: info@tgbhotels.com Website: www.tgbhotels.com Tel. 079-26841000 /

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALFYEAR ENDED ON 30TH SEPTEMBER, 2024 (Rs In lakhs except EPS) Standalone Quarter Ended Half Year Ended Year Ended Sr. No Particulars 30.09.2024 30.06.2024 30.09.2023 30.09.2024 30.09.2023 31.03.2024 Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited Total Income from Operation (net) 882.42 736.45 1618.87 4,026.01 912.03 1703.78 Net Profit / (Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items) 2 21.07 13.59 17.98 34.66 34.79 -354.20 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 3 21.07 13.59 17.98 34.66 34.79 -354.20 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) 21.07 13.59 17.98 34.66 34.79 -356.01 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income 5 after tax and other comprehensive) 21.07 13.59 17.98 34.66 34.79 -348.53 Equity Share Capital (Face Value of 6 Rs. 10 each) 2928.64 2928.64 2928.64 2928.64 2928.64 2928.64 Other Equity Earnings Per Share (of Rs. 10/- each) for 8 continuing / discontinuing operation 1) Basic 0.07 0.05 0.06 0.12 0.12 -1.22 Diluted 0.07 0.05 0.06 0.12 0.12 -1.22

Notes:

The above is an extract of the detailed format of Standalone Financial Results for the Quarter and half year ended on 30th September 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full Isrnat of the Standalone Financial Results for the Quarter and half year ended on 30th September 2024 are available on the Stock Exchange websites i.e. www.nseindia.com, www.bseindia.com and on the company's website www.tgbhotels.com.

For, TGB Banquets and Hotels Limited Narendra G. Somani Chairman & Managing Director (DIN: 00054229)

GHAR SURAKSHIT - AAP SURAKSHIT Dist Rajkot Gujarat web : www.ultracabwires.com CIN: L31300GJ2007PLC052394												
	EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30th SEPTEMBER, 2024											
						(Ar	mt Rs. in Lakhs)					
Sr.		0	QUARTER ENDE	:D	SIX MON	TH ENDED	YEAR ENDED					
No.	Particular	30.09.2024 UNAUDITED			30.09.2024 UNAUDITED	30.09.2023 UNAUDITED	31.03.2024 AUDITED					
1	Total Income from Operations	5554.70	5369.45	3122.62	10924.14	5744.37	12405.56					
2	Net Profit before Extra-Ordinary and Exceptional Items	328.77	292.26	194.79	621.03	337.86	853.26					
3	Net Profit before Tax (PBT)	328.26	292.15	195.58	620.41	338.65	843.45					
4	Net Profit after Tax (PAT)	250.64	212.74	153.32	463.38	256.44	597.83					
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	250.64	212.74	153.32	463.38	256.44	597.83					
6	Paid-up Equity Share Capital	1908.45	1908.45	1908.45	1908.45	1908.45	1908.45					
7	Other equity / Reserves (excluding Revaluation Reserve)	•	•	•	•	•	1887.75					
8	Earnings per Share (Face Value Rs. 02 per share) (not annualised) a) Basic b) Diluted	0.26 0.26	0.22 0.22	0.16 0.16	0.49 0.49	0.27 0.27	0.63 0.63					
Regu Unau (www 2. Th meet For : ULT sd/- Mr. Cha	he above is an extract of the detailed utation 33 of the SEBI (Listing Oblig utation Statistics Francial Results i wuthracabwires.com) he above results are reviewed by the. stingheld on 12.11.2024. and on behalf of Board of Direct IRACAB (INDIA) LIMITED - Nitesh P. Vaghasiya sirman & Managing Director - oragone frances.	gation and Oth is available on Audit Committe	the stock excha	Requirements; ange website (v proved and tak	<ul> <li>Regulations, www.bseindia.c</li> </ul>	2015. The full com) and Comp	I format of the pany's website					


00555500


ULTRACAB (INDIA) LIMITED

Tel No. : +91 2827 - 253122 / 23 Fax : +91 2827 - 252725 E-mail : cs@ultracab.in

Survey No. 262, B/h. Galaxy Bearings Ltd., Shapar (Veraval) - 360024 Diet - Rolling Colored

### Place : Ahmedabad Date : November 13.2024





HI BOOODOOOOOO7953

arges Etc., W.e.f. October 14,2023. Date Of Demand Notice All That Piece And Parcel Of Land Owned By: HLHU000000007953 Mr, Kamisch Kumar Prajapati S/o Mr. Bhudarbhai Ilerrower) Mrs. Sumitreben Prajapati IV/o Mr. Kamlesh Kumar Prajapati ICo-Borrower) Mr. Fatahimh Singh Shivbhai Solanki S/o Mr. Shivbhai Solanki (Guaranter) 1. Data Of Demand Notice
 All That Proc A Aff Proc. 2014 (1994)
 Content 11, 2023
 In The Name Data
 Chart Of Synthesis Procession
 Propage So Mc Bunchmark Harring Market
 So Chart Romand Afree
 Content 11, 2023
 Chart Of Synthesis
 Content
 Content 11, 2023
 Chart Of Synthesis
 Content
 d By:- Ea Authorized Officer, SRG Housing Finance Limited

For and on behalf of the Board Of JINDAL WORLDWIDE LIMITED Sd/-MR. AMIT AGRAWAL Managing Director DIN : 90169061

PLAC

DATE: 14-08-2024

Ahmedabad

1 380015, Gujara

631.53

631.53

1,647.34 4,746.00

3.83 3.83

30.06.2023


390.5

390.54

339.1

339,45

(Unudited)



50

### WWW.INDIANEXPRESS.COM

THE INDIAN EXPRESS, WEDNESDAY, MAY 29, 2024

14

Place: New Delhi Date: 28.05.2024

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

WESTERN RAILWAY-BHAVNAGAR DIVISION
ANNUAL MAINTENANCE
CONTRACT FOR TOWER
WAGONS
Notice for inviting E-Tender, No. DRM/
TRD/BVP/2024-25/01 Dt. 22.05.2024;
The Divisional Railway Manager (TRD)
Western Railway, Bhavnagar Para Invites
E-tender on behalf of President of India
for the following work: Tender No. 03
TRDBVP-2024-25; Name of Work:
Annual Maintenance Contract for Tower
Wagons - 220056, 257, 220036, 210075
(Diese Electric Tower Car) at Dhasa,
Jetalsar, Bhavnagar para and Wansjaliya
for 2 years; Tender amount: ₹
1,09,17,505.91/-; Tender Fee: NIL; EMD
Amount: ₹ 2,04,600/-; Address: DRM
(Traction) BVP, DRM Office, Bhavnagar
Para 364003; The bidders have to apply
online through link i.e. www.ireps.gov.in
only. For further details please visit
website www.reps.gov.in. Last date to
apply online will be 25.06.2024 up to
15:00 hrs for above mentioned tenders,
Like us on: 👎 facebook.com/WesternRly 17

WESTERN RAILWAY-RAJKOT DIVISION PROVIDING RELEASED SLEEPER BOUNDARY MATTAM AND Colour Wash, distempering, APEX AND PAINTING Tender Notice No. 07 of 2024-25 da (05/2024; Office Address: Division ilway Manager (Engg.), Wester ilway, Kothi Compound, Raikr ularzi Railway Manager (Engs), Wester-cours rat. 8: 30 (01): Wester-cours rat. 8: 30 (01): Wester-sense (01): Wester-ausser (01): Wester-Hander (12): Self-strift Name of Helsase Steeper Boundary Mattan under 56. Beden Engewer (HW) Raijet (150al 56,26 km); 2020 Noi-Approximate III (2021 km); 2020 Noi-Approx Like us on: f facebook.com/WesternRly

 WESTERN RAILWAY

 Name of the second secon

WESTERN RAILWAY-AHMEDABAD DIVISION 

Like us on: facebook.com/WesternRly+Follow us on: X twitter.com/WesternRly

### RAJASTHAN STATE HIGHWAYS AUTHORITY, JAIPUR GOVERNMENT OF RAJASTHAN 5. F.7(540)/SHA/PPP/2020-21/D-208 Date: 24/05

### NIT No. 02/2024-25 INVITATION OF BIDS FOR TOLL COLLECTION

likh for collection of user for or "Korwas-Khunger-Atlens Sections of berl-Karwas Section of SI-FAA and Abc-MPC-diagnabac-swamast, (MP S 81-1976 in the State of Rajashtari under RSHIP Tranchet, Package-0.07 are invi-neerated biddes gauge 11:63 AM on 06/65-020-4. Other particulars of bid may be visited on the proverence of Annual Kentinates is ke. 277 (spc. justicing.gov.in) of the state. The estima of Annual Kentinates is ke. 277 (spc. justicing.gov.in) of the state. The estima 10 No KerWD 22:255.0400 (0).

# 50 V. L. Dhankha Member (WC&O RSHA, Jaipt ovin Tel: +91-141-22235

### Gujarat Water Supply & Sewerage Board 2<sup>nd</sup> Attempt Tender Notice No. 01 of 2024-2025

(I D No. 71628) (10 No.71628) Executive Egnineer, Public Health Works Division, Mamlatdar Office Compound, DEESA-385535, District: Banaskantha, Phone No. 02744-220031 invites E-Tender of civil work sunder. (1) Name of works- For Daritwada, Deesa, Palanpur Taluka of Banaskantha District. O & M & Repairs of 40 MLD WTP @ Dantiwada & Proper Supply 0 Potable water in 124 Villages covered Under Dantiwada, Ranavas, Madana, Dhuva, Bhoyan, Shergadh, Dhaneri, Vithodar-Agdol Sub-HW, Incl. with Man Power, Civil-Electro-Nech Assetal Structures, Intake well structures, WTP, Sump, HGLR, ESR, Staff Cirs., PH., all Pipeline Network, Electricals equipment etc. Under BK-5, Jegol & Vithodar-Agdol RWSS for 60 Months (2) Estimated cost Rs. 2204.53 Lah (3) Eligbility of contractor- Bidder hav-ing Registration with R&B/GWSSB/WRD in "A" Class and above, however the bidder will have to post quality as per biologication with hob/consistence of the class and above, however the bidder will have to post qualify as per Financial & Technical criteria given in the bid documents 4) Last date of submission online tender: 26/06/2024 up 4) Last date of submission online tender-26/05/2024 up to 18:00 Hrs. GWSSB reserves the right to accept/reject any or all tenders without assigning any reason. For defail information & conditions, contact office mentioned above during office hours and is binding to all. & website w w.s.tatteten ders.gujarat.gov.im, & www.atersuppy.gujarat.gov.im, & www.atersuppy.gujarat.gov.im, & www.atersuppy.gujarat.gov.im, & 2010/602 This fue to 10:04 for Disbute Metast.

"GWSSB Toll free Help line 1916 for Drinking Water Supply for Rural Area"

Date : 27" May, 2024 Place : Ahmedabad No,DDI/PAL/41/2024-2025

1			Standalone	(All amou	inc in redpeets to	khs, unless oth Conso	
		Quarter ended		Year e	nded	Year	
Particulars	March 31, 2024	December 31, 2023	March 31, 2023	March 31, 2024	March 31, 2023	March 31, 2024	March 31, 2023
	Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Audited
Total Income from Operations	49,061,63	293.32	25,041,86	65,759.73	41,956.76	9,601.05	1,922.4
Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	37,494,87	(10,476.90)	16,511,52	25,590.74	7,808.09	56,387,64	53,346,0
Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/ or Extraordinary items/)	37,494,87	(10,476.90)	16,511,52	25,590.74	7,808.09	56,387.64	53,346.0
Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/ or Extraordinary items*)	25,876.18	(10,664.70)	11,428,83	10,336.35	(4,816.04)	31,179,72	29,618,6
Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	25,876.18	(10,664.70)	11,428.83	10,336.35	(4,816.04)	31,179.51	29,617.8
Paid up Equity Share Capital	17.06	17.06	17,06	17,06	17.06	17.06	17.0
Other equity (excluding Revaluation Reserve)	3,13,572,58	2,87,696.39	3,03,236,23	3,13,572,58	3,03,236,23	4,52,931.29	4,18,484.7
Securities Premium Account	1,33,995,94	1,33,995,94	1,33,995,94	1,33,995,94	1,33,995,94	1,33,995,94	1,33,995,9
Net worth	3,13,589,64	2,87,713.45	3,03,253,29	3,13,589,64	3,03,253,29	4,52,948,35	4,18,501,8
Paid up Debt Capital/ Outstanding Debt	7,67,953,69	7,52,429,70	7,22,783,84	7,67,953,69	7,22,783,84	7,67,954,59	7,22,785,3
Outstanding Redeemable Preference Shares	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicab
Debt Equity Ratio	2,42	2,56	2,37	2,42	2,37	1,68	1,7
Earnings Per Share (of Rs 100/ each) (for continuing and discontinued operations)							
Basic (in Rs.)	1,51,659,71	(62,505,59)	66,984,14	60,581,12	(28,226,68)	2,01,890,28	1,74,622,2
Diluted (in Rs.)	1,51,659.71	(62,505.59)	66,984,14	60,581.12	(28,226.68)	2,01,890.28	1,74,622.2
Capital Redemption Reserve	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicabl
Debenture Redemption Reserve	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicabl
Debt Service Coverage Ratio	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicabl
. Interest Service Coverage Ratio	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicable	Not applicab

Bahadur Chand Investments Private Limited

Correspondence. Eav: 011-26152453 Tel No: 0

Requirements) Regulator, 2015. The full format of the financial results are available on the websites of the tack exchange alware transmuser are available on the websites of the tack exchange alware tack the Company is a website of the parties of the tack exchange and parties of the tack exchange re issued/ applicable. ade to the Stock Exchange and can be acc

Bank of India

JINDAL JINDAL WORLDWIDE LIMITED CIN:L17110GJ1986PLC008942 Regd. & Corp. Office: 'Jindal House', Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjan Shyamal 132 F Ring Road, Salellite, Ahmedabad - 380015, Gujar Ph: 079-71001500 • Email Id : csjindal@jindaltextiles.com • Website : www.jindaltext

STATEMENT OF STANDALONE & CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS As per Regulation 33 of SEBI (LODR) Regulation, 2015, Schedule III of Companies Act, 2013 and IND-A: (Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (Rs. in Lakhs except EPS

Quarter Ended

For and on behalf of the Board of Directors of Pahadur Chand Investments Private Limited

Head Office, Star House 2, Risk Management Department, Intermation Security Cell, 7th Floor, C-5 - G Block, Bandra-Kurla Complex, Bandra (East), Mumbal 400 051. E-mail: security.information@handroffici - c 1:-

Tender Notice

Bank of India invites response to Request for Proposal (RFP) for Procurrent of Lionnest for Trend Micro Deep Society and Trellin Lionate in the Constant of Trend Micro Deep Society and Trellin Liotateia prosinghistican (Request for Proposal's 15,62,224,930 pm. Full details are available on the Bank's Corporate Webble www.bankofindia.co.in under Trender Section and on GeM porta https://gem.gou.in.form.27,05,2024, Americanter (Section and Constant) and Section and Constant Section and Section and Constant Section and Constant Sect

Nav

INF/72/2024-25

DIN 00227685

Advertorial GNFC Announces Rs. 127 crores Profit After Tax for the Fourth Quarter and GNFC Rs. 485 crores for the FY 23-24 CNA-IV Plant: The newly operational Concentrated Nitric Acid (CNA-IV) plant achieved an impressive ~90% capacity

Bharuch, Gijara, May 28, 2024 – GNCC (Gujarat Narmada Valley Fertilizers & Chemicals) released its financial results for the fourth quarter and for the Financial Year 23-24 today. Mr. Pankaj Joshi, IAS, Managing Director of GNFC, outlined the key developments and challenges experienced during this period.

during this period. Improved Revenue in Chemical Segment The chemical segment saw a commendable "13% increase in revenue, attributed to obth higher ovolume and favorable growth, the overall performance was hindered by a decline in the fertilizer segment due to reduced volumes and a downward revision of subsidies affecting the comples fertilizer segment.

revision of subsolies antecing the complex fertilizer segment. Year-on-Year Analysis in Q4, the chemical segment faced lower realizations, leading to a significant margin shrinkage. showed volume improvements, it experienced margin ensoin due to ongoing reductions in nutrient-based subsidies. Over the full year, both buik chemicals and complex fertilizers encountered considerable challenges, with a buyers' market. An annual shutdown also limited the availability of saleable volumes, impacting overall results. Doerational tichildens : Dabel

Operational Highlights : Dahej TDI Operations: Achieved the highest-ever production of ~53 TMT, surpassing the plant's rated capacity of 50 TMT.

meeting held on May 28, 2024. Financial Activities: GNCF noted the highest-ever dividend Buyback Program, totaling "46d. respectively, contributing to significant cash outflow under insancing activities. Positive investment activities were driven by the liquidation of cash deposit positions to meet financing needs.

impressive ~90% capacity utilization in its first year. Dividend Recommendation: The Board of Directors has recommended a dividend of \$16.50 per share (165%) in its meeting held on May 28, 2024.

Strategic Pathways Ahead: GNFC is focusing on strategic management inputs to define value-accretive moves for the future, leveraging its capacity for further capital expenditure.

further capital expenditure. Outlook: The Government of India is reviewing urea-related sapects, including energy norms and fixed costs evaluation. GNFC has presented fits actual position to reduce under-recoveries in these critical areas. The outlook remains cauliously optimistic, volume availability and realizations expected to drive gradual positive change in the current cycle.

### Advertisement

In accordance with the provision of Section-15 (5) of the Right to Information Act-2005, applications are invited from the candidates desiring to be appointed to fill up the vacan-cies as per the table below in the Gujarat State Information Commission, in the pre-scribed form and notice. More details are available on website https://ardt.gujarat.gov.in. Number of vacancies Sr. No. Post 1 State Chief Information Commissioner 2 State Information Commissioner 02 Le 2 Istate mormation Commissioner 022 Persons fulfilling the oriteria and interested for appointment to the State Chief Information Commissioner and 02 (Two) State Information Commissioners may send their particulars in the enclosed proforma to Under Secretary (TRI). General Admin. Department. Sardar Bhavan, Block No,7, 1st Fbor, Sachivalaya, Gandhinagar through email to so-rti-gad@gujaral.gov.in and a physical copy by post so as to reach latest by 6:10 PM - 7th June, 2024.

### Additional Secretary (RTI Cell) General Administration Department,

Government of Gujarat

 
 Quarter Ended
 Year Ended

 Preceding 3 (Corr, 3 months months dvd C, i ended in PY.
 Current Financial Previous Financial Vere Ended

 31 'Dec, 2023
 31'March, 2023
 31'March, 2023

 31 'Dec, 2023
 31'March, 2023
 31'March, 2024

 31 'Dec, 2023
 31'March, 2023
 31'March, 2024
 3 months ended of C.Y. Particulars Total income from operations (net)
 Net Profit / (.cos) (or the period (before Tax.
 Net Profit / (.cos) (or the period (before Tax.
 NetProfit / (.cos) (or the period before Tax.
 NetProfit / (.cos) (or the period after tax
 NetProfit / (.cos) (or the period after tax
 NetProfit / (.cos) (or the period after tax
 NetProfit After tax
 NetProfit
 NetP DNE 
 14624.25
 56616.24
 185935.50
 214902.04

 2791.37
 3448.17
 9528.99
 15195.72
 3301.41 3301,41 2791,37 3448.17 9528,99 15195.72 2334.94 2096.70 2565.93 7002.94 2080.61 2096.70 2616.34 6748.6 11461.50 Comprohensive Income (after tax); Equity Share Capital Rearves (acutading Reveluation Reserve) is shown in the Audited Salarce Senet as a Photon Instance Ware index 31 March 2023 and Current Franced Variant Salarce (Jor Rach 2024); Carminga Per Salare (Jor Rach 7, Faach) (for continuing and discontinued operations); J. Basic 2, Diluted NA NA NA 69042.96 62695.3 1.16 1.0 1,28 3,4 5.6 1.28 5.69 CONS DATED Total income from operations (net)
 Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items) 57 
 80
 54945.84
 181408.90
 207001.40

 32
 3559.23
 10249.58
 15405.05
 3893.46 2799.32 Exceptional and/or Extraordinary lentity, Net Profit (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit (Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items) Total Comprehensive income for the period after share of profit after associaties and minority interest (Comprising Profit(Loss) for the period (after tax) and ofter Comprehensive Income (after tax) 15405.0 3893.46 2799.32 3559.23 10249.58 2817 30 2102.68 2653.01 7564.78 11571.63 Equity Share Capital Reserved (schadrig Revaluation Resorve) as shown in the Auditate Beatmon Shoet as al Previn Financial Vare model 31 March 2023 and 204 Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations). 1. Basic 2, Diluted NA NA NA 69902.05 62992.5 1.41 1.05 1.32 5. 1.41 1.05

 Detect
 1, 20 bits
 1, 41
 1, 05
 1, 32
 3, 77
 5, 77

 Notes
 Anoto Stanishone & Consolidated Financial Results for the quarter and financial year ended 31" March, 2024 have become services and normanical by the Audit Committee in its meeting held on 27" May, 2024 and approved by the Board Olinectors in their meeting held on 27" May, 2024 and approved by the Board Olinectors in their meeting held on 27" May, 2024 and approved by the Board Olinectors in their meeting held on 27" May, 2024.

 1. The Board Olinectors in their meeting held on 27" May, 2024.
 The approvement of the Company (u. Rs. 0.20 pass per Equity Share of Rs. 14-each) for the meaning were 2024.
 The approvement of the Company (u. Rs. 0.20 pass per Equity Share of Rs. 14-each) for the meaning were 2024.
 The approvement of the Company (u. Rs. 0.20 pass per Equity Share of Rs. 14-each) for the meaning were 2024.
 The approvement of the Company (u. Rs. 0.20 pass per Equity Share of Rs. 14-each) for the meaning were 2016 and and the the Company (s. Rs. 2016) for AS) prescribed under section 133 of the Companies, And 2013 and other meaning were company (s. Rs. 2016) for AS) prescribed under section 133 of the Companies and Directosures Requirements) in a papelable is a standabone level for the Company For companies and level, refer the Statement of Consolidated Segment Revenue, Results, Segment Assets and Labelines.
 The figures for the the company for the Statement of Consolidated Segment Revenue, Results, SegmentAssets and Labeline.
 The figures for the company for the Statement of Consolidated Segment Revenue, Results, SegmentAssets and Labeline.
 The figures for the company for the Statement of Consolidated Consolidated Segment Revenup

latextiles.com) For and On Behalf of the Board For JINDAL WORLDWIDE LIMITED

SD/-(MR. AMIT AGRAWAL) Vice Chairman & Managing Director DIN : 00169061

SRG HOUS	CIN. L65922RJ1999PLC015440) (CIN. L65922RJ1999PLC015440) 2001(Rejestion), Phone 0294-2561882 E-mail: info@sriphousing.com Website: www.srghousing.com
PUBLIC NOTICE FOR A	0010/Informal, Prove CoH-201802 E-mith info@inpointaion Webster, investigationality, on UC_TION_SSALE_OFINITAION_VARIALE_DENDOTEST DOVISO TO RULE 8(6) OF SECURITY pHTEREST (ENFORCEMENT) RULES) the Limited for physicality of the SecURITY SecURITY SecURITY information And Resourcitude in Financia Assist and Enforcement Discourch Interest Ac- cented to Dynamic contends under section 1312(2) the Ad-US of SecURITY Interest the Real's Sussed Security Officer and Ad-US of SecURITY Interest the Real's Sussed Security Officer and Ad-US of SecURITY Interest the Real's Sussed Security Officer and Ad-US of SecURITY Interest the Real's Sussed Security Officer and Ad-US of SecURITY Interest the Real's Sussed Security Officer and Ad-US of SecURITY Interest Security Officer and Ad-US of SecURITY Interest (SecURITY Ad-US of SecURITY Interest SecURITY Officer and Ad-US of SecURITY Interest SecURITY OF SecURITY
Notice is hereby given to the public in general and in amount within the specified period, the authorized o of the Act read with the said rules, which is to be so basis, and "No Recourse basis" for realization of fit muchan schedule.	tabledea in the both scalar area put at octs, compare not inclusive approximate a possible of the temperature of the source of t
Description Of Properties: 1	Equitable Mortgage Of Land & Building, Together With Buildings And Structures
	Contracted, Ta Be Constructed Thereon Along With Finanse And Fiftings Attached To Her farth Add Anything Attached To The Earth Add Mad Thermon, The Maren Of M. Sanderg Sharma Sid M. Attanuara Sharm Hering Property Pfo INc. 202, Adressaring About 58,42 Sander, With Contraction Of Consult-7 of More Profiles. 2018; Advan- Sander 47,57 Sa, Mitt, Ol Arsyne Of Lew Ashith Napar Comparison Houring Solority (L. Onganied Of Land Barbarg Thermon Sarwy New, 2-2, Sin, 84 And 165 Ja Salex, No126 With Along Bears OF Hering Pfo Inc54 (see Find) Pfo Inc. 48 64 01 (12 Schuller Montal Consultation Distruct-Saret Callerial Starendord Hering Tacher (J. A. 2033, West–Society Read, North–Pfot No, A - 203, South–Pfot No. A. 201
leserve Price (in₹)	₹ 16,00,000i (ruppes Sixteen Lakh Only)
arnest Money Deposit (₹) Through D.D. In Favor Of Iousing Finance Limited, Udaipur (Rajasthan)	Srg ₹1,60,000) (rupees One Lakh And Sixty Thousand Only) Date – Till July 03, 2024 Before 04,00 Pm)
escription Of Properties: 2	Equitable Morrageo O'Land S Badring. Sopher With Bailding And Structures Constructed. Too Boo Scatteristical Theorem Apple Mit France And Iriging Attached To The Earth And Anything Attached To The Earth And Madd Theorem In The Karon OM Demonsol Shames State State Association of Banari 2 and Hone Pakes Board Hone States States and Angenetic States and States States and States States and Honessing Manari 2 and ASS Soc. Mat. Character States and Apple O Dav Ashink Banari Hone Honessing States and ASS Soc. Mat. Character States and Apple O Dav Ashink Banari Hone Honessing States and ASS Soc. Mat. Character States and Apple O Dav Ashink Banari Angenetic States (State States Associations) and Banaring Honessing Ashine Angel Yulia Ashing Angel States States and Apple Ashing A
leserve Price	₹ 15,00,000)- (Rupees Fifteen Lakh Only)
In Rupees)	1
ind Amount In Rupees)	₹ 1,50,000/- (rupees One Lakh And Fifty Hundred Only) (Date – Till July 03, 2024 Before 04,00 Pm)
In rupes) Inown Encumbrances (if Any)	Not Known To The Secured Creditor
Rid incremental Amount	30,000 (in Words (rupees Thirty Thousand Only)
Pate, Time And Venue For Bidding	Date – July 05, 2024, Time – 11:00 Am To 1:00 Pm, Venue – Office Of Srg Housing Finance Limited, Office No. 218 And 219, 2nd Floor, Times Square Building, Kadodara Bardoli Road, Magob Surat, Gujarat : 395010
nspection Of Properties	As Per Prior Appointment Of Authorized Officer (anytime Between 10:30 Am 4:00 Pm)
letum Of Emd Of Unsuccessful Bidders ast Date For Payment Of 25% Of Accepted Highes:	Within 15 Working Days From The Date Of Auction Bid The Payment Should Be Made Latest By Next Working Day From The Date Of Bid
or Confirmed Successful Bidders (inclusive Df Emd)	Confirmation
ast Date For Payment Of Balance 75% Of Highest Bi	
Party Details	LOAN DETAILS
	1. Mr. Devanand Atma Ram Sharma S/o Mr. Atma Ram Sharma 2. Mr. Sandeep Atma Ram Sharma S/o Mr. Atma Ram Sharma
Date Of Demand Notice U/s 13(2) Of Act	3. Mr. Vishal Zansiwala S/o Mr. Naresh Zansiwala 16-12-2019
Amount Of Demand Notice U/s 13(2) Of Act	₹ 17,30,590 (+ (Rupees Seventeen Lakh Thirty Thousand Five Hundred And Ninety
	Only) As On 09-12-2019 Along With Future Interest At Contractual Rates And Rests,
	Besides Costs/charges, Incidental Expenses, Penal Interest, Etc., W.e.f 10-12-2019 Incurred Till The Date Of Repayment in Full.
late Of Possession	13-09-2023
ublication Date Of Possession Notice	18-09-2023
Dutstanding Dues (국)	Cost, 85, 800 F. Rupees Sixty-two Lakh Eighty-five Thousand And Eight Hundred Only As On May 23, 2024 Along With Future Interest At Contractual Rates And Rests, Besides Costs/charges, Incidental Expenses, Penal Interest, Etc., W.e.f. May 24, 2024 Incurred
<ul> <li>For the second se second second s second second se</li></ul>	Till The Date Of Repayment in Full.
<ol> <li>The sale shall be subject to rules/conditions prescrinterest Act, 2002</li> <li>The Notice is also applicable to Borrower(s), Guaran 4. Mode or payment: By D.D. (Demand Draft) in the authorized officer through auction.</li> </ol>	name of SRG Housing Finance Limited at, Udaipur (Rajasthan). Sale will be conducted by the
<ol> <li>Bidders are advised to go through the web portal of NOTE – 1. THIS NOTICE CAN BE VIEWED ON www.ss 2. For detailed terms and conditions, bid form etc</li> </ol>	ghousing.com , logan to www.srahousing.com
PLACE:- Udaipur DATE of Publication :- 29/05/2024	Authorized Officer SRG Housing Finance Limited
The borrower(s)/Guarantor(s)/ Mortgagors are hereb	S AUCTION-SALE NOTICE UNDER SARFAESI ACT, 2002 y noticed to pay the sum mentioned as above within 30 days from the date of publication of isell the property as per the provision laid down in the SARFAESI ACT, 2002.

### ફાયનાન્સિયલ એક્સપ્રેસ

૧૫	
----	--

ઝમદાવાદ, બુધવાર, તા. ૨૯ મે, ૨૦૨૪	
પોરબંદર શાળા इંદિયતર્વેક્ટ 🔊 Indian Bank દુકાબ લં. ૧, ૨, ૩, ચાર ૨૨લા ચેમ્બર,	Hall No. : M-01, Old Administrative Bu
▲ इनगहनाद माम्मक्षक पोर्ट्स्टर (ग्रेस्ट) लिखम, रोप्ट, टोर्ड्स, अभ, ग्रा. रोड, पोर्ट्स्टर, २९९२१त - ३५०७७५ (सिडयोरीटी एडटरेस्ट (ग्रेस्ट) दिमेल्ट) लिखमे, १०००२ ना लिखम (२९५) ठेठल)	NOT1           Ref. No. : BPSCL/MM/24-25/Paper Advt./004/1           SN         NIT No. / Date           01.         BPSCL/MM/23-24/PUR-114/MIT-011 dt. 23/05/0224
<b>કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)</b> આથી નીચે સહી કરના <b>ર ઇન્ડિયન બેંક</b> ના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાચનાન્સિયલ એસેટ્સ એન્ડ	02. BPSCLMM/24-25/PUR-031MIT-012 dl. 27/05/2024 Procure 03. BPSCLMM/23-24/PUR-061/MIT-013 dl. 24/05/2024 Procure For Tender documents kindly visit Website :
સારુવારાદાઇઝલાને અન્ડ રાકબ્લ્ટ્રકલના આફ સવનાવિત્વવ અસર્સ અન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ની નિરામ ૮ અને ૯ સાથે વંચાતી કલમ	
૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ <b>તા. ૨૩.૧૧.૨૦૨૩</b> ના રોજ માંગણા નોટિસ જારી કરી આમારી <b>એમજી રોડ પોરબંદર શાખા</b> સાથેના દેવાદાર <b>શ્રીમતી જચશ્રીબેન</b>	ठिम्लावर्च
રાજુભાઈ સુડા (દેવાદાર અને ગીરવેદાર), શ્રી રાજેશ શાંતિલાલ સુડા (મૃત્યુ પામ્યા ત્યારથી) (દેવાદાર અને ગીરવેદાર), તેમના વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ શ્રીમતી જયશ્રીબેન રાજુભાઈ સુડા મારકૃત રજૂઆત કરી હતી (સ્વ. રાજેશ	EXTRACT OF AUDITED THE QUARTER AN
ગાંગલા પંચગાળના રાયુભાગ સુપ્ર માર્ટ્સ રાષ્ટ્રિય રાયુભાદ કરા હતા (સ્વ. સપર) શાંતિલાલ સુદ્રાના વિદ્યવા), શ્રી થશ (સ્વ. રાષેશ શાંતિલાલ સુદ્રાના પુત્ર) અને શ્રી નિલેશ શાંતિલાલ સુદ્રા (ભાગીનદાર)ને નોટીસમાં વખ્યાવેલ તા. ૨૩.૧૧.૨૦૨૩	Sr. Particulars
મુજબની ૨કમ <b>રૂા. ૧૩,૧૦,૫૯૪.૦૦ (રૂપિયા તેર લાખ દસ હજાર પાંચસો ચોરાણું</b> <b>પુરા)</b> અને તેની પરનુ વ્યાજ નોટીસ મળ્યાની તારીખથી દૃ૦ દિવસની અંદર સુકવવા	
બણાવ્યું હતું. દેવાદાર/ગીરવેદાર/બામીનદાર આ રકમ પરત ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/ગીરવેદાર/બામીનદાર અને બહેર બનતાને આ નોટિસથી બણ કરવામાં	1         Total Income from operations (net)           2         Net Profit / (Loss) for the period before
આવે છે કે નીચે સહી કરનારે સદરહુ નિયમોના નિયમ ૮ અને ૯ સાથે વંચાતી સદરહુ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત થયેલી સત્તાની રૂએ નીચે દશવિલી	and Exceptional items 3 Net Profit / (Loss) for the period before after Exceptional items
મિલકતનો <b>તા. ૨૮મી મે, ૨૦૨૪</b> ના રોજ કબજો લઇ લીધો છે. આથી ખાસ કરીને દેવાદાર/ગીરવેદાર/જામીનદાર અને જાહેર જનતાને મિલકત	4 Net Profit / (Loss) for the period after tax and Exceptional items
સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો <b>ઇન્ડિયન બેંક, એમજી રોડ શાખા</b> ની <b>તા. ૨૩.૧૧.૨૦૨૩</b> મુજબની ૨કમ <b>રૂા. ૧૩,૧૦,૫૯૪.૦૦ (રૂપિયા તેર લાખ દસ હજાર પાંચસો ચોરાણું પુરા)</b> તરીકેની	5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (a and Other Comprehensive Income (after tax)
સ્ક્રમ અને તેના પરના વ્યાલને આધિન રહેશે. અમે સરફૅસી એક્ટની કલમ ૧૩(૮) અને તેની દ્વેઠળ ઘડવામાં આવેલા નિયમો ની	6 Paid up Equity Share Capital     7 Other Equity excluding Revaluation Re
જોગવાઈઓ તરફ તમારૂ ધ્યાન દોરીએ છીએ જે સિક્યોરિટીઝ પર તમારા ગીરોમુક્તિના અધિકારો સાથે સંબંધિત છે.	8 Earnings Per Share (of Rs. 10/- each not an (for continuing and discontinued operations)
સ્થા <b>વર મિલકતની વિગત</b> પોસ્બંદર તાલુકા હેઠળના બોખીરા ગામ ખાતે આવેલ રહેશાંક મકાનના તમામ પીરા અને પાર્શલ રેવન્થૂ સર્વે નં. ૪૩/૧ અને ૭૩ પૈકી પ્લોટ નં. ૬૩ ધરાવે છે તેની જમીન	1. Basic 2. Diluted
થો.મી. ૮૭.૫૦ અને પ્લોટ નં. ૬૪ છે અને તેની જમીન ૮૭.૫૦ થો.મી. જેટલી કુલ જમીન છે જે ૧૭૫.૦૦ પૈકી ભાગ ૬૩ એ અને તેની જમીન અને શિવાલિકના	NOTE :- 1. The above is an extract of the detailed format of Aud Exchange(s) under Regulation 33 of the SEBI (Listi
અંદાજીત માપ ૪૪.૩૭૫ ચો.મી. ભેટલા અને ઢાલના માળખામાં તેમની પોતાની અને ચતુ:સીમા નીચે મુજબ છે : બોખીચા, તા. અને જી. પોરબંદર, ગુજરાત-૩૬૦૫૭૫. <b>ચતુ:સીમા : ઉત્તર :</b> પ્લોટ નં. દુર ની જગ્યા, <b>દક્ષિશ :</b> પ્લોટ નં. દુરૂ પૈકી ભાગ દુરૂ-	Financial Results are available on the website of the to the Company: www.sumeetindustries.com. 2. The above Audited Financial Results for the quarter and
બીની ૧૦ચા, પૂર્વઃદ્ મી.કમ્પાઉન્ડ રોડ, પશ્ચિમઃ પ્લોટ નં.૭૨ ની ૧૦ચા માલિકના નામ : શ્રીમતી જયશ્રીબેન રાજુભાઈ સુદ્રા અને સ્વ. રાજેશ	(Suspended) and taken on records by Resolution Prof 3. The Corporate Insolvency Resolution Process of Sun Anmedabad Bench vide order dated 20.12.2022, und
શાંતિલાલ સુદ્રા તારીખ : ૨૮.૦૫.૨૦૨૪ થીફ મેનેજર અને અધિકૃત અધિકારી સ્થળ : પોરબંદર ઇન્ડિચ્સન બેંક વતી	Satyendra P. Khorania (Reg. No. IBBI/IPA-002/IP-N00 PLACE : Surat DATE : 28/05/2024
નોંધ : વિવાદની સ્થિતીમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે.	CIN No
TECH	Regd. Office : 504, Trividh Chambe E-mail : corporate@sumeetind
mahindra	
TECH MAHINDRA LIMITED Registered Office: Gateway Building, Apollo Bunder, Mumbai - 400 001. Tel: + 91 20 4225 0000 • Website: www.techmahindra.com	
Email: investor.relations@techmahindra.com         • CIN : L64200MH1986PLC041370	Regd. & Corp. Office: "Jir Shivranjani Shyamal 132 F Ph : 079-71001500 • Email Id : cs
(For the attention of Equity Shareholders of the company)	STATEMENT OF STANDALON (As per Regulation 33 of SEBI (LODR) Reg * For the Quarte
Sub: Transfer of Equity shares and unclaimed / unpaid dividends to the Investor Education and Proction Fund (IEPF)	{Pursuant to Regulation
This Notice is published pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and	Sr. No. Particulars
Refund) Rules, 2016, which have come into effect from 7th September 2016, read with the amendments and circulars issued	
by the Ministry of Corporate Affairs from time to time (collectively"the Rules")	Total income from operations (net)     Z. Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)
The Rules, amongst other matters, contain provisions for transfer of shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more in the name	<ol> <li>Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).</li> <li>Net Profit / (Loss) for the period after tax</li> </ol>
of Investor Education and Protection Fund constituted by the Government of India under Section 125 of the Companies Act,	Anter exceptional and/or Extraordinary items)     S. Total Comprehensive income for the period     after share of profit after associates and
2013. Adhering to the various requirements set out in the Rules, the	minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]
Company has communicated individually to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF under the Rules (at their latest available addresses with the	6. Equity Share Capital 7 Reserves (excluding Revaluation Reserve) as
Company) for taking appropriate action(s). The Company has uploaded full details of such shareholders,	shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31 <sup>th</sup> March 2023 and Current Financial Year ended 31 <sup>th</sup> March 2024 8. Earnings: Per Share (of Rs.1/- each)
their unclaimed / unpaid dividends and shares due for transfer to IEPF on its website at www.techmahindra.com.	(for continuing and discontinued operations): 1. Basic 2. Diluted
Shareholders are requested to refer to the web-link : https:// insights.techmahindra.com/investors/iepf-unclaimed- dividend-and-corresponding-shares-data-fy-2016-17.pdf	1. Total income from operations (net)
to verify the details of unclaimed / unpaid dividends and shares and the shares liable to be transferred to IEPF.	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items)     Net Profit/ (Loss) for the period before tax
Shareholders may note that both unclaimed / unpaid dividends and the shares transferred to IEPF Authority including all benefits	<ul> <li>(after Exceptional and/or Extraordinary items).</li> <li>4. Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)</li> </ul>
accuring on such shares, if any, can be claimed back by the shareholders from IEPF Authority after following the procedure precribed under the Rules.	<ol> <li>Total Comprehensive income for the period after share of profit after associates and minority interest (Comprising Profit/(Loss))</li> </ol>
The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF authorities, may	for the period (after tax) and other Comprehensive Income (after tax)] 6. Equity Share Capital
note that the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose	<ol> <li>Equity Share Capital 7. Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31<sup>ed</sup> March 2023 and Current Financial Year ended 31<sup>ed</sup> March 2024</li> </ol>
of transfer of shares to IEPF authorities as per Rules and upon such issue, the original share certificate(s) which stand registered in their name will stand automatically cancelled. This shall be deemed as	Earnings Per Share (of Rs.1/- each) (for continuing and discontinued
adequate notice in respect of issue of new share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF authorities	2. Diluted
pursuant to the rules. In case the Company does not receive any communication from the	Notes: 1. The above Standalone & Consolidated F 2024 have been reviewed and recomme and approved by the Board of Directors in
concerned shareholders by August 23, 2024 the Company shall, pursuant to the requirements set out in the Rules,transfer the shares & the unclaimed / unpaid dividends to the IEPF by the due	<ol> <li>The Board of Directors in thier meeting he the paid up Equity Share Capital of the C financial year 2023-2024.</li> </ol>
date as per procedure stipulated in the Rules. In case the shareholders have any queries on the subject matter	<ol> <li>The above financial results have been Standards) Rules, 2015 (Ind AS) presi recognised accounting practices &amp; polici</li> </ol>
or the Rules they may contact the Company's Registrar and ShareTransfer Agent (RTA) M/s. Link Intime India Pvt. Ltd.,	be disclosed in terms of Regulation 33 Regulations, 2015 (as amended).
Block No. 202, 2nd Floor, Akshay Complex, Near Ganesh Temple, Off. Dhole Patil Road, Pune-411001. Tel No. : 020-26161629, email : pune@linkintime.co.in	<ol> <li>At standalone level, the Company is eng accordance with Ind AS 108 'Operating' not applicable at standalone level for Consolidated Segment Revenue, Result</li> </ol>
	<ol> <li>The figures for the corresponding previo make them comparable.</li> <li>Pursuant to SEBI Circular No. SEBI/HO.</li> </ol>
For <b>TECH MAHINDRA LIMITED</b> Sd/- Place : Pune <b>Anil Khatri</b>	by Issuance of Debt Securities by Larg Corporates as per the given applicabil Financial Year 2023-2024.
Date : May 28, 2024 Company Secretary	<ol> <li>Pursuant to the compliance of SEBI no Statement Of Cash Flows (both Standald enclosed herewith as Annexure-A to the Obtempeted Acastra &amp; Unbillion</li> </ol>
	Statement of Assets & Liabilities. 8. The financial results for the quarter end Consolidated Financial Results are the Einancial Year and/of on 31 <sup>th</sup> March 200
	Financial Year ended on 31 <sup>st</sup> March, 202 quarter of the financial year under revier the Statutory Auditor's thereon. 9, A statement of Standalone & Consolida
	<ol> <li>A statement of Standalone &amp; Consolida available on the website of BSE Limite (www.nseindia.com) and on the website</li> </ol>

	•												
okaro Po	wer	Supp	ly Co	(P)	Itd.	1 m					TED		
okaro Po M-01, Old Administrative Buildi	(A Joint Ver	ture of SAIL	& DVC) 27001(Jharkhand)	CIN No. : U40300	0L2001PTC112074	- 3	5	ິ 50	FINSER'	A Securities Lirr	ited)		
NOTIC I-25/Paper Advt./004/123	EINVITIN	IG TEND	ER	Da	te : 27/05/2024	SG	FINS	Registered Off SE₹VE Email: compliance@sgfins	CIN: L64990DL CIN: L64990DL ice: 37, Hargobind erve.com   Websit	1994PLC057941 Enclave, Vikas M e: www.sqfinser	arg. Delhi-1100 ve.com   Tel: +9	92  -120-4041400	
Date		Description	n	25/	BOD & Time 6/2024 at 12.15 Hrs.		-						
NIT-011 dt. 23/05/2024 Procureme NIT-012 dt. 27/05/2024 Procureme NIT-013 dt. 24/05/2024 Procureme	ent of Spares of Dredg ent of M.S. ERW Block	e Pumps (Model : A Pipes.	R-300/750A, Make :	SAM Turbo). 28/ 25/	06/2024 at 12.15 Hrs. 16/2024 at 12.15 Hrs.	1  '	EXTR	ACT OF FINANCIAL RESULTS	FOR THE QU.	ARTER AND			
kindly visit Website : w			equested to v	isit website r	egulariy.	1   ,				Quarter	( ₹ in Lakhs ex Quarter	cept earning pe Year	r share data) Yeor
										ended	ended	ended	ended
							NO.	Particulare		31st March, 2024	31st March, 2023	31st March, 2024	31st March. 2023
गवनी	INDU	STR	IES L	IMIT	ED		1	Total Income from Operations		Unaudited 5,854.99	Unaudited 2,753.53	Audited 18,971.94	Audited 4,196,18
OF AUDITED S						1   1	2	Net Profit / (Loss) for the period		3,190.98	1,874.02	10,502.97	2,501.72
QUARTER AND					(₹ in Lakh)		3	(before Tax, Exceptional items) Net Profit / (Loss) for the period b	efore tax	3,190.98	1,874.02	10,502.97	2,501.72
ulars	QUART		R QUARTER	Year	Year		4	(after Exceptional items) Net Profit / (Loss) for the period a	fler tax	2,380.17	1,405.31	7,858.48	1,840.63
ulais	ENDE 21/02/2			ENDED	ENDED		5	(after Exceptional items) Total Comprehensive Income for	the period	2.380.17	1.405.31	7.858.48	1.840.63
	31/03/2 Audite		023 31/03/202 ted Audited		4 31/03/2023 Audited			((Comprising Profit / (Loss) for the and Other Comprehensive Incom	e period (after Tax	0			
n operations (net)	27152	56 22713	.10 24707.1	98570.5	1 104334.98		6	Equity Share Capital (of Rs.10/- e	sach)	5,497.90	4,127.30	5,497.90	4,127.30
) for the period before tems	Tax -1220	56 -1653	.84 386.8	-6346.7	-6375.16		<i>'</i>	Earnings Per Share of Rs 10/- ea (For Continuing Operations- Not)		s.)			
) for the period before	tax -1220	56 -1653	.84 386.8	-6346.7	-6375.16			1. Basic 2. Diluted		4.33	6.49 3.85	15.72 15.31	8.50 5.05
items		-	Const and the				Notes	R					
) for the period after nal items	-775	01 -1653	.84 508.5	-5901.1	5 -5872.15		the SE	above is an extract of the detailed format EBI (Listing Obligations and Disclosure	Requirements) Rep	julations, 2015. T	he full format of t	he Audited finance	ial results is
e Income for the period (Loss) for the period (afte	er tax) -813	95 -1653	.27 528.5	-5938.7	9 -5851.82	11	avana	able on the website of Stock Exchange,	ww.usenficia.com				
ensive Income (after tax)]							Dia	: Delhi		Por an	_ on senal 0	f the Board of SG FINSER	Sd/-
are Capital	10364	24 10364	.24 10364.2				Place Date :	: Delhi : May 28, 2024				F	Rahul Gupta Director I:- 07151792
uding Revaluation Rese	erves		-	9217.0	1 -3278.22							DIN	:- 07151792
(of Rs. 10/- each not annu	alised)												
iscontinued operations)	-0	79 -1	.60 0.4	-5.7	3 -5.67								
		-	-	-				ARO TILES LI			Δ		aro
f the detailed format of Audite	d Einsesial Borultr	for the quarter a	end water and ad ar	21 02 2024 6	od with the Stock			ice: Survey No169 & 170, Vavdi H 'alod, Sabarkantha-383 305, Gujar			C	~~~	TILES
lation 33 of the SEBI (Listing	Obligations and D	isclosure Requir	ements) Regulati	ons, 2015. The	full format of the	CIN:	L2691	14GJ2008PLC052518				Passion I	for Innovation
lable on the website of the Sto etindustries.com.								EXTRACT OF STATEME FOR THE QU	INT OF CONSOL	IDATED AUDITE	D FINANCIAL MARCH 2024		
ial Results for the quarter and records by Resolution Profes	year ended on 31s sional (RP) on 28th	March,2024 we May, 2024	ere reviewed and a	approved by the B	loard of Directors		_			Quarter		(Rs in Lakhs exce	ept per shares dat Ended
Resolution Process of Sumee	et Industries Limite	t has been initiate	ed vide the Hon'bl skruptcy Cone. 20	e National Comp	any Law Tribunal, Bank Limited, Mr	Sr. No.		Particular		31.03.2024	31.03.2023		
rder dated 20.12.2022, under g. No. IBBI/IPA-002/IP-N0000	2/2016-17/10002	is appointed as F		sional (RP) of the and on behalf			-			(Audited)	(Audited)	(Audited)	
			SUN	IEET INDUSTR	IES LIMITED	1.		al Income from operation Profit / (Loss) for the period		8053.90 218.68	9411.14 232.49	30392.35 318.87	31978.64
CIN No.	L45200GJ19	88PI C0110		inkarlal Soma	ni (Director)		(befi	fore tax, Exceptional and/or Extrao	rdinary items)				1010 50
4. Trividh Chambers	s. Opp. Fire	Station, Rin	a Road, Su	rat - 395 00	02. India.	3.	(afte	Profit / (Loss) for the period before er Exceptional and/or Extraordinary	ritems)	218.68	134.59	318.87	1013.52
orate@sumeetindus	stries.com, V	isit us at :	www.sumee	etindustries	.com	4.	Net (afte	Profit / (Loss) for the period after t er Exceptional and/or Extraordinary	ax (items and	119.76	110.23	224.64	727.15
							after	r minority interest)					
						5.		al Comprehensive Income for the p d up Equity Share Capital	eriod	163.88 4474.11	110.26 4474.11	268.00 4474.11	726.14 4474.11
L JINDAI				ITED		7.	Earr	nings Per Share (of Rs: 10/- each)					
	L17110GJ19	86PLC008	942	D				Basic: Diluted:		0.27	0.25	0.50	1.63
& Corp. Office: "Jind ani Shyamal 132 Ft F 1500 • Email Id : csjin	ai House', O Ring Road, S	atellite, Ahn	nedabad - 3	Bump Lan 30015, Guja	arat	Note	s:					0.00	1.00
1500 • Email Id : csjin ENT OF STANDALONE	ndal@jindalte	ATED AUDI	Website : w	ww.jindalte	xtiles.com	1. 3	Summ	narized Standalone Audited Financ	ial performance				(Rs in Lac
of SEBI (LODR) Regul	lation, 2015,	Schedule III	of Companie	es Act, 2013	and IND-AS			Particular		Quarter 31.03.2024	31.03.2023	31.03.2024	Ended 31.03.2023
* For the Quarter a rsuant to Regulation	47(1)(b) of S	EBI (LODR) I	Regulations,	2015}		No.				(Audited)	(Audited)	(Audited)	(Audited)
r	Qui	arter Ended			except EPS) Ended	1.		al Income from operation Profit / (Loss) for the period		8054.75 220.26	9411.63 234.82	30395.73 323.60	31979.13 1114.24
	3 months Pr	eeceeding 3 C	orr. 3 months	Current Financial	Previous Financial		(befi	fore tax, Exceptional and/or Extrao					
3	1" March, 2024 31	" Dec, 2023 3	ended in P.Y. 1" March, 2023	Year Ended 51" March, 2024	Year Ended 31" March, 2023	3.	Net (after	Profit / (Loss) for the period before er tax, Exceptional and/or Extraord	tax tinary items)	119.98	112.56	228.01	729.97
R	efer Note No.8 (L STANDALC	n-Audited) Re	efer Note No.8	(Audited)	(Audited)	4.		al Comprehensive Income for the p		164.10	112.59	271.37	728.96
	59455.06 4	4624.25		185935.50	214902.04			ompany's financial results for the qu					
the period (before Tax, xtraordinary items)		2791.37	3448.17	9528.99	15195.72		2024.	ubsequently approved & taken on n The statutory auditors have expres-	sed unmodified a	udit opinion on t	hese financial	results.	
he period before tax	3301.41	2791.37	3448.17	9528.99	15195.72	3.	The fir	nancial results have been prepared (S) prescribed under section 133 of	in accordance w	ith the Compan	ies (Indian Ac:	counting Standa	
for Extraordinary items). the period after tax	2334.94	2096.70	2565.93	7002.94	11411.09		Disclo	sure Requirement) Regulation 201	5 (as amended) a	ind circulars and	Inotifications is	ssued thereund	er.
/or Extraordinary items)						4.	The C (Vitrifi	Company's Operations fall under a ied Tiles)". Hence, Segment reporti	i single segmen na is not applicat	t "Manufacturin de as per Indian	g and Trading Accounting St	of refractory of andard (Ind AS	ceramic product
for the period fter associates and	2080.61	2096.70	2616.34	6748.61	11461.50		Repor	rting.					
nprising Profit / (Loss) ax) and other		1						es of previous reporting periods h is of the current reporting period.	ave been regrou	ped/reclassifier	i wherever ne	cessary to con	respond with th
me (after tax)]	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	6.	These	financial results have been extracte	ed from the audite	d financial state	ments. Figure	s for the quarter	ended March 3
aluation Reserve) as							∠uz4 r nine m	represent the difference between th nonths ended December 31, 2023.	e audited ligures	mrespect of full			
ance Sheet as at Previous March 2023 and Current	NA	NA	NA	69042.96	62695.39						On I		oard of Directo ro Tiles Limite
March 2024 e (of Rs.1/- each)	1.16	1.05	1.28	3.49	5.69			May 2024 medabad					hkumar B. Pate maging Directo
discontinued sic							•. And					Ma	
uted	1.16	1.05	1.28	3.49	5.69								
operations (net)	CONSOLII 57379.15 4		54945.84	181408.90	207001.40			CREMICA	ACRO	FOOF		AITED	·
he period (before Tax xtraordinary items)		2799.32	3559.23	10249.58	15405.05	Re	ad_O	ffice: 455, Sohan Palace, 2nd Fle	AGRO	Idhiana Punia	5-141001 CH	N: L15146PB19	989PLC009676
e period before tax	3893.46	2799.32	3559.23	10249.58	15405.05	rte	gu. 01	Email: manager.cafl@gmai	I.com, Website:	www.cafi.co.i	n, Contact No	. 01826-22541	8
or Extraordinary items).		2102.68	2653.01	7564.78	11571.67			Extract of Standalor				Quarter &	
raordinary items)									al Year ended		rch, 2024		( Rs. in 000
income for the period ter associates and	2562.97	2102.68	2703.42	7310.45	11622.08	Sr No	Partic	culars		Quarter ended		2020/2	ended
nrising Profit/(Loss)	1	1							31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023

11	exceptional and/or Extraordinary items)					
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Los) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2562.97	2102.68	2703.42	7310.45	11622.08
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31" March 2023 and Current Financial Year ended 31" March 2024	NA	NA	NA	69902.05	62992.59
8.	Earnings Per Share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1.41	1.05	1.32	3.77	5.77
	2. Diluted	1.41	1.05	1.32	3.77	5.77

Financial Results for the quarter and financial year ended 31" March rended by the Audit Committee in its meeting held on 27" May, 2024. In their meeting held on 27" May, 2024, held on 27" May, 2024 Autor ecommended a Final Dividend of 20% o Company (i.e. Rs. 0.20 paise pur Equity Share of Rs. 1/- each) for the

an prepared in accordance with the Companies (Indian Accounting scribed under section 133 of the Companies Act, 2013 and other icles to the extern applicable and discloses the information required rt 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements

gaged in business of Textile' and has only one reportable segment in g Segments' therefore segment reporting as defined in INDAS 108 is or the Company. For consolidated level, refer the Statement Of Uts, Segment AssetAnd Liabilities. vious periods have been restated/regrouped wherever necessary, to

O/DDHS/CIR/P/2018/144 dated 26" November, 2018-"Fund Raising irge Entities"; the Company do not fall under the category of Large bility framework of the said circular as on 31" March, 2024 for the

notification No. SEBI/LAD-NRO/GN/2018/10 dated 9<sup>th</sup> May, 2016, lone & Consolidated) for the Financial Year ended 31<sup>th</sup> March, 2024 the said notes to Standalone and Consolidated Financial Results

ded 31<sup>st</sup> March, 2024 forming part of the statement of Standalone 8 e balancing figure between the audited figures in respect of the ful 24 and the published year to date Un-audited figures up to the thir ew i.e. 31<sup>st</sup> December, 2023, which were subject to limited review by

tated Financial Results & Statement of Assets & Liabilities are als ted (www.bseindia.com), National Stock Exchange of India Limite e of the Company (www.jindaltextiles.com)

laitextiles.com) For and On Behalf of the Board For JINDAL WORLDWIDE LIMITED SD/-(MR. AMIT AGRAWAL) Vice Chairman & Managing Director DIN : 00169061

# Place: Ludhiana Date: 27th May, 2024

(Director DIN: 01091404

1.	Total Income from operation	8054.75	9411.63	30395.73	31979.13			
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	220.26	234.82	323.60	1114.24			
3.	Net Profit / (Loss) for the period before tax (after tax, Exceptional and/or Extraordinary items)	119.98	112.56	228.01	729.97			
4.	Total Comprehensive Income for the period	164.10	112.59	271.37	728.96			
а ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ;	The Company's financial results for the quarter's year ended 31" March, 2024 have been reviewed by the Audit Committee and subsequently approved 5 laken on record by the Board of Directors of the Company at Is meeting held on 28th May, 2024. The statutory auditors have expressed unmodified audit opinion on these financial results. The financial results have been prepared in accordance with the Companies ((findan Accounting) Stathards) Rules, 2015 ((nd AS) prescribed under section 133 of The Companies A(I), 2013 and Repulsion 33 of SEB ((Listing) Obligations and Disclosure Requirement Regulation 2015) is a mended and activation and molifications issued therounder.							
(	The Company's Operations fall under a single segment "Manufacturing and Trading of refractory ceramic products (Vitrified Tiles)". Hence, Segment reporting is not applicable as per Indian Accounting Standard (Ind AS) - 108 - Segment Reporting.							
	Figures of previous reporting periods have been regrouped/reclassified wherever necessary to correspond with the figures of the current reporting period.							

# D B1989PLC009676

No	Particulars	Quarter ended			Year ended	
		31.03.2024 (Audited)	31.12.2023 (Un-Audited)	31.03.2023 (Audited)	31.03.2024 (Audited)	31.03.2023 (Audited)
1	Total Income from Operations	1269.00	1132.00	920.00	3,784.00	3,163.0
	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	989.00	586.00	605.00	2,174.00	(10,373.00
	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	989.00	586.00	605.00	2,174.00	(10,373.00
	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	739.00	418.00	445.00	1,605.00	(7,778.00
	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	739.00	418.00	445.00	1,605.00	(7,778.00
	Paid-up Equity Share Capital (Face value of Rs. 10 <sup>(L</sup> - each)	44,955.00	44,955.00	44,955.00	44,955.00	44,955.0
	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at 31st March				40,819.00	39,214.0
	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations):					
	Basic:	0.16	0.00	0.10	0.36	-1.7
	Diluted:	0.16	0.09	0.10	0.36	-1.7

Date : 27<sup>th</sup> May, 2024 Place : Ahmedabad